

GUJARAT STATE INVESTMENTS LIMITED

**28th Annual Report And
Accounts 2015-2016**



**ગુજરાત સ્ટેટ
ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ**

**૨૮મો વાર્ષિક અહેવાલ અને
હિસાબો ૨૦૧૫-૨૦૧૬**



GUJARAT STATE INVESTMENTS LIMITED

BOARD OF DIRECTORS	Shri Anil Mukim, IAS	(w.e.f. 21.09.2016)	Chairman
	Smt. Mona Khandhar, IAS	(w.e.f. 16.07.2016)	Managing Director
	Ms. Arti Kanwar, IAS	(w.e.f. 21.09.2016)	Director
	Ms. Mamta Verma, IAS	(w.e.f. 21.06.2016)	Independent Director
	Shri Vasant Raval	(w.e.f. 21.06.2016)	Independent Director

CESSATION OF DIRECTORS

Dr. J. N. Singh, IAS	(Upto 03.08.2016)	Chairman
Shri J. P. Gupta, IAS	(Upto 21.09.2016)	Director
Shri Kaimas Mehta	(Upto 22.03.2016)	Independent Director
Ms. Shilpi Thapar	(Upto 22.03.2016)	Independent Director
Shri T. Natarajan, IAS	(Upto 24.06.2016)	Managing Director

CHIEF FINANCIAL OFFICER

Shri G. S. Pathak

COMPANY SECRETARY

Shri Sandip Shah

STATUTORY AUDITORS

M/s. J. P. Shah & Co.
Chartered Accounts,
Ahmedabad.

SECRETARIAL AUDITORS

Shri Harish P. Jain
Company Secretary
Ahmedabad

INTERNAL AUDITORS

M/s. J. H. Mehta & Co.
Chartered Accounts,
Ahmedabad.

BANKERS

State Bank Of India

Bank of Baroda

REGISTERED OFFICE

H. K. House, 6th Floor,
Ashram Road,
Ahmedabad - 380 009.

CIN No. : U64990GJ1988SGC010307



DIRECTORS' REPORT

To,
The Members
Gujarat State Investments Limited

The Directors take pleasure in presenting the 28th Annual Report together with the audited financial statements for the year ended on 31.03.2016. The Consolidated performance of the Company and its associates has been referred to wherever required.

THE HIGHLIGHTS OF THE FINANCIAL PERFORMANCE

Standalone

During the year under review there is Profit Before Tax of Rs. 9038.36 Lakhs (Previous year is Rs. 10,933.49 Lakhs), Net Profit After Tax is Rs.8253.97 Lakhs (Previous year is Rs. 9,699.48 Lakhs), Dividend Income of Rs. 6854.91 Lakh (Previous year Rs. 5053.07 Lakh), Interest Income was of Rs. 2225.68 Lakh (Previous year Rs. 3559.56 Lakh) while operating expenses were of Rs. 152.24 Lakh including depreciation Rs. 3.40 Lakh (Previous operating expenses Rs. 86.93 Lakh inclusive of deprecation of Rs. 1.19 Lakh). As on last date of the year amount of Reserves and surplus is Rs. 8253.97 Lakhs (Previous year 9699.48 Lakhs).

Income Tax liability is of Rs.747.51 Lakh (Previous year Rs. 1231.46 Lakh)

Consolidated

Financial performance on consolidated basis during the year under review there is Profit Before Tax of Rs. 5030.94 Lakhs (Previous year is Rs. 6141.36 Lakhs), Profit for the year is Rs. 29832.70 Lakhs (Previous year is Rs. 13190.31 Lakhs).

DIVIDEND

Keeping in view of present profit sharing policy, your Directors have not recommended any divided for the year under review.

SHARE CAPITAL

The Authorized Share Capital of the Company is Rs. 300000 Lakh (285,00,00,000 Equity Shares of Rs. 10 each and 1,50,00,000 Preference Shares of Rs. 100 each) and Paid- up Equity Capital of the company is Rs. 104276.90 Lakh , as on 31st March, 2016 which has remain same against the previous year.

Brief Highlights of the year

During the year, Your Company has purchased 3,14,915 equity shares of GIPCL. Your Company has received interest free loan from Government of Gujarat amounting Rs. 5485.00 Lakh.

Your Company has been recognized by RBI as UN-REGISTERED CORE INVESTMENT COMPANY w.e.f. 28th April, 2015

MATERIAL CHANGES AND COMMITMENTS AFFECTING THE FINANCIAL POSITION OF THE COMPANY

There have been no material changes and commitments, if any, affecting the financial position of the Company which have occurred between the end of the financial year of the Company to which the financial statements relate and the date of the report.

ASSOCIATES

At the beginning of the year, your Company had three associates companies. As on 31st March, 2016, Your Company have three associates companies.

During the year, your Board reviewed approved annual accounts of the associates. In accordance with the Section 129(3) the Companies Act, 2013 your company has prepared consolidated financial statements of the Company, which forms part of this report. Further, a statement of our associates in prescribed format in AOC-1 is appended as ANNEXURE to the Consolidated Financial Statements.



These documents will also be available for inspection during business hours at registered office of your company.

RISK MANAGEMENT AND INTERNAL CONTROL SYSTEM AND ITS ADEQUACY

Under the Risk Management, various risks relating to operations & maintenance, financial and other organizational risks are assessed, evaluated and continuously monitored for taking effective mitigation steps. Risk interalia, containing major anxiety areas and action plan for their mitigation and noteworthy risk management activities carried out by the Company is periodically reviewed by the Audit Committee and the Board of Directors. The Company has adequate internal controls commensurate with the nature of its business and size.

AUDITORS,

Statutory Auditor

Your Company is a Government Company within the meaning of the Section 2 (45) of the Companies Act, 2013, the Comptroller and Auditor General of India, New Delhi had appointed M/s. J. P. Shah & Co., [Registration No. 109612W] Chartered Accountants, as Auditors of your Company for the Financial Year 2015-16.

The comments of comptroller & Auditor General of India (C&AG) and the reply of the Management thereto form part of this report and are attached as annexure to this report.

Secretarial Audit

Shri Harish P. Jain, Practicing Company Secretaries, was appointed to conduct the Secretarial Audit of the Company for Financial Year 2015-16, as required under section 204 of the Companies Act, 2013 and Rules made thereunder. The Secretarial Audit Report for F.Y. 2015-16 forms part of Annual Report as annexure to this report. *The Secretarial Audit Report does not contain any qualification, reservations or adverse remarks.*

Extracts of Annual Return and other disclosures under Companies (appointment & Remuneration) Rules, 2014

The Extract of Annual Return in prescribed format, Form No. MGT-9, as per Section 134 (3) (a) of the Companies Act, 2013 read with Rule 8 of Companies Act (Accounts) Rules 2014 and Rule 12 of Companies (Management & Administration) Rules, 2014 is annexed hereto and forms part of this report.

Declaration on Independent Directors

The independent directors have submitted the declaration of independence, as required pursuant to section 149 (7) of the Companies Act, 2013 stating that they meet the criteria of independence as provided in sub-section (6).

Corporate Social Responsibility:

The report on CSR Activities, as required pursuant to Section 135(2) of the Companies Act, 2013 read with the Companies (Corporate Social Responsibility Policy) Rules, 2014 is annexed hereto.

Your company's investment in CSR activities for the year 2015-16 was Rs.73.60 Lakhs which is 2% the average profits of the Company for the last three years.

DIRECTORS & KMP

As on the Date of the Report, the Board of Directors of the Company comprises five Directors including one Managing Director and two Independent Directors.

Appointments:

Shri Anil Mukim, IAS [DIN 02842064] vide Government of Gujarat vide GR. No. JNV 10-2011-688092-A dated 17th September, 2016 has been appointed as Director and Chairman of the Board of your company w.e.f. 26.09.2016.



Shri T. Natarajan, IAS [DIN 00396367] vide Government Order No. JNV/10/2011/688092/A Dated 16th May, 2015 has been appointed as Managing Director of your company and also appointed as Key Managerial personnel.

Shri Vasant Raval [DIN 03097981], retired Bank Officer has been appointed as an Independent Director by your board keeping in as required under the Companies Act, 2013 w.e.f 21st June, 2016.

Ms. Mamta Varma, IAS [DIN 01854315], has been appointed as an Independent Director by your board as required under the Companies Act, 2013 w.e.f 21st June, 2016.

Smt. Mona Khandhar, IAS [DIN 06803015] vide Government Order No. JNV/10/2014/557212/A dated 15th July, 2016 has been appointed vice Shri T. Natarajan, IAS [DIN 00396367] as Managing Director of your company and also designated as Key Managerial Personnel.

Ms. Arti Kanwar, IAS [DIN 03535973] vide Government of Gujarat vide GR. No. JNV 2009-695332-A dated 17th September, 2016 has been appointed as Director of your company w.e.f. 26.09.2016.

Resignations and/or cessation:

Prof. Kaimas Mehta [DIN 01282370], Practicing Chartered Accountant has been cease as an Independent Director as completion of his term w.e.f. 22nd March, 2016.

CS Shilpi Thapar [DIN 00511871], Practicing Company Secretary has been cease as an Independent Director as completion of her term w.e.f 22nd March, 2016.

Shri G.C. Murmu, IAS [DIN00183142] submitted his resignation w.e.f. 04th May, 2015 and Ms. S. Aparna, IAS, [DIN 03631971] Managing Director submitted her resignation w.e.f 08th May, 2015.

Shri T. Natarajan, IAS [DIN 00396367] Managing Director submitted his resignation w.e.f. 24th June, 2016.

Dr. J.N. Singh, IAS [DIN 00955107] Chairman of the Company submitted his resignation w.e.f. 03rd August, 2016.

Shri J. P. Gupta, IAS [DIN 01952821] Director of the Company submitted his resignation w.e.f. 26th September, 2016.

Key Managerial Personnel (KMP):

The Company has Smt. Mona Khandhar, IAS [DIN 06803015], Managing Director and Shri Snadip Shah, Company Secretary and Shri G. S. Pathak, Chief Financial Officer designated as KMP as required under the Companies Act, 2013.

PARTICULARS OF LOANS, GUARANTEES OR INVESTMENTS

Your Company has not granted any Loan or given any Guarantees or made any investments which are covered under the provisions of section 186 of the Companies Act, 2013.

RELATED PARTY TRANSACTIONS

There was no related party transactions (RPTs) entered into by the Company during the financial year, which attracted the provisions of section 188 of the Companies Act, 2013.

BOARD MEETINGS AND Composition of the Board and attendance record of directors for 2015-16

During the financial year under review 04 meetings of the Board of Directors were held on following dates,

20th July, 2015	21st September, 2015	28th December, 2015
14th March, 2016		

The maximum interval between any two meetings did not exceed 120 days, as prescribed in the Companies Act, 2013.



Table 1: Composition of the Board and attendance record of directors for 2015-16

Name of director	Category	Relationship with other directors	Meetings attended	Whether attended last AGM
Dr. J. N. Singh, IAS [DIN 00955107] ^	Chairman - Non - Executive	---	4/4	No
Shri J. P. Gupta, IAS [DIN 01952821]	Director - Non - Executive, Promoter	---	3/4	No
Prof. Kaimas Mehta @ [DIN 01282370]	Independent Director	---	4/4	No
Ms. Shilpi Thapar @ [DIN 00511871]	Independent Woman Director	---	4/4	No
Shri T. Natarajan, IAS [DIN 00396367] #	Managing Director - Non-Executive, Promoter	---	4/4	No

^tendered his resignation w.e.f. 03.08.2016

@cease to be Director w.e.f. 22.03.2016

#tendered his resignation w.e.f. 24.06.2016

Meetings and Membership the Committee

1. Audit Committee

During financial year 2015-16 the Audit Committee met 03 times as following dates,

20th July, 2015	21st September, 2015	28th December, 2015
-----------------	----------------------	---------------------

The present composition of Audit Committee is as follow,

1. Shri Anil Mukim, IAS [DIN 02842064] Chairman of the Committee
2. Ms. Mamta Verma, IAS [DIN 01854315], Member (Independent Director)
3. Shri Vasant Raval [DIN 03097981], Member (Independent Director)

2. Corporate Social Responsibility Committee (CSR Committee)

During the year CSR Committee met on 14th March, 2016

The present composition of CSR Committee is as follow,

1. Shri Anil Mukim, IAS [DIN 02842064] Chairman of the Committee
2. Smt. Mona Khandhar, IAS [DIN 06803015], Member
3. Ms. Mamta Verma, IAS [DIN 01854315], Member (Independent Director)

3. Nomination and Remuneration Committee (N&R Committee)

The present composition of Nomination and Remuneration Committee is as follow,

1. Ms. Mamta Varma, IAS [DIN 01854315] Chairman of the Committee
2. Ms. Arti Kanwar, IAS [DIN 03535973], Member
3. Shri Vasant Raval [DIN 03097981], Member (Independent Director)

DIRECTORS' RESPONSIBILITY STATEMENT:

Pursuant to the requirement under section 134 (5) of the Companies Act, 2013, with respect to Directors' Responsibility Statement, it is hereby confirmed:

- (a) in the preparation of the annual accounts, the applicable accounting standards have been followed along with proper explanation relating to material departures;
- (b) the directors have selected such accounting policies and applied them consistently and made judgments and estimates that are reasonable and prudent so as to give a true and fair view of the state of affairs of the company at the end of the financial year and of the profit and loss of the company for that period;



- (c) the directors have taken proper and sufficient care for the maintenance of adequate accounting records in accordance with the provisions of this Act for safeguarding the assets of the company and for preventing and detecting fraud and other irregularities;
- (d) the directors have prepared the annual accounts on a going concern basis; and
- (e) the directors have devised proper systems to ensure compliance with the provisions of all applicable laws and that such systems were adequate and operating effectively.

Deposits

Your company has not accepted or renewed any deposits during the year under review mentioned under Section 73 of the Companies Act, 2013.

CONSERVATION OF ENERGY, TECHNOLOGY ABSORPTION, FOREIGN EXCHANGE EARNINGS AND OUTGO.

The Company primarily being an investment company and not involved in any industrial or manufacturing activities, the Company has no particulars to report regarding conservation of energy and technology absorption as required under section 134 of the Companies Act, 2013 and Rules made thereunder.

During the year under review, the Company did not have any foreign exchange earnings or foreign exchange outgo.

ACKNOWLEDGMENTS

The Board expresses its gratitude and appreciation to the Government of Gujarat, Financial Institutions and Banks, other business associates, promoters and shareholders' and employees of the Company for their continued support.

For, and on behalf of the Board

Sd/-

Shri Anik Mukim, IAS

(DIN 02842064)

Chairman

Date: 14-02-2017

Place: Gandhinagar



COMMENTS OF THE COMPTROLLER AND AUDITOR GENERAL OF INDIA UNDER SECTION 143(6)(b) OF THE COMPANIES ACT, 2013 ON THE STANDALONE FINANCIAL STATEMENTS OF GUJARAT STATE INVESTMENTS LIMITED FOR THE YEAR ENDED 31 MARCH 2016 AND REPLY THERETO.

Comments	Management's Reply
The preparation of financial statements of Gujarat State Investments Limited for the year ended 31 March 2016 in accordance with the financial reporting framework prescribed under the Companies Act, 2013 (Act) is the responsibility of the Management of the Company. The Statutory Auditors appointed by the Comptroller and Auditor General of India under Section 139(5) of the Act are responsible for expressing opinion on the financial statements under Section 143 of the Act based on independent audit in accordance with the Standards on Auditing prescribed under Section 143(10) of the Act. This is stated to have been done by them vide their Audit Report dated 28 October 2016. I, on behalf of the Comptroller and Auditor General of India, have conducted a supplementary audit under Section 143(6) (a) of the Act of the financial statements of Gujarat State Investments Limited for the year ended 31 March 2016. This supplementary audit has been carried out independently without access to the working papers of the Statutory Auditors and Company personnel and a selective examination of some of the accounting records. The financial statements of the Company have been revised by the Management to give effect to some of my audit observations highlighted during supplementary audit as indicated in the Note No.....of the financial statements. In addition, I would like to highlight the following significant matters under Section 143 (6) (b) of the Act which have come to my attention and which in my view are necessary for enabling a better understanding of the financial statements and the related Audit Report;	Statement of Fact
1. Comment on Auditors' Report Clause 3 of the Guidance Note on Auditors' Report on Revised Accounts of Companies before Circulation to Shareholders provides that "the Council recommends that members of the Institute, when called upon to issue a report on the amended accounts for the same period consequent upon the revision of the Balance Sheet and/ or the Profit and Loss Account should ensure that unless all copies of the original accounts and report are returned to the auditor, and adequate disclosure of the fact of the revision on the accounts already approved by the Board and reported upon by the Statutory Auditors appears as a specific Note on the amended accounts. In case the Statutory Auditor are satisfied that the disclosure so made by the Company in the Notes to Accounts is	The Management has taken note of the Comments issued by the C&AG office on Statutory Auditors' Report. The Management further took the note of response submitted by Statutory Auditor vide letter dated 26.12.2016 which sum up that "there is no material omission of accounting standard or lapse in audit procedure and this does not affect true and fair view of financial statements at all."



adequate, there may not be any further need for the Auditor to refer to the revision of the Balance Sheet and/or the Profit and Loss Account in his report. However, if the Notes to Accounts do not contain any note on the revision or if such a note is contained therein but not considered by the Statutory Auditors as adequately comprehensive, it will be the duty of the Statutory Auditors to refer to the fact of revision of the accounts in their report."

The Company has not disclosed the fact of revision of the accounts already approved by the Board, in the amended accounts. Hence, in view of the above Guidance Note, the Statutory Auditors' should have referred the fact of revision of the accounts in their report.

The Statutory Auditors' report is deficient to the above extent.

**For and on behalf of the
Comptroller and Auditor General of India**

**Sd/-
(Gurveen Sidhu)
Accountant General (E&RSA), Gujarat**

Place: Ahmedabad

Date: 05-01-2017

**For and on behalf of the
Gujarat State Investments Limited**

**(Anil Mukim, IAS)
(DIN 02842064)
Chairman**

Place: Gandhinagar

Date: 14-02-2017



COMMENTS OF THE COMPTROLLER AND AUDITOR GENERAL OF INDIA UNDER SECTION 143(6)(b) OF THE COMPANIES ACT, 2013 ON THE CONSOLIDATE FINANCIAL STATEMENTS OF GUJARAT STATE INVESTMENTS LIMITED FOR THE YEAR ENDED 31 MARCH 2016 AND REPLY THERETO.

Comments	Management's Reply
The preparation of consolidated financial statements of Gujarat State Investments Limited for the year ended 31 March 2016 in accordance with the financial reporting framework prescribed under the Companies Act, 2013 (Act) is the responsibility of the Management of the Company. The Statutory Auditors appointed by the Comptroller and Auditor General of India under Section 139 (5) read with Section 129 (4) of the Act are responsible for expressing opinion on the financial statements under Section 143 read with Section 129 (4) of the Act based on independent audit in accordance with the Standards on Auditing prescribed under Section 143 (10) of the Act. This is stated to have been done by them vide their Audit Report dated 28 October 2016. I/on behalf of the Comptroller and Auditor General of India have conducted a supplementary audit under Section 143(6) (a) read with Section 129 (4) of the Act of the consolidated financial statements of Gujarat State Investments Limited for the year ended 31 March 2016. We conducted a supplementary audit of the financial statements of Gujarat State Investments Limited but did not conduct supplementary audit of the financial statements of Gujarat State Fertilizers & Chemicals Limited, Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited and Gujarat Alkalies and Chemicals Limited for the year ended on that date. This supplementary audit has been carried out independently without access to the working papers of the Statutory Auditors and is limited primarily to inquiries of the Statutory Auditors and Company personnel and a selective examination of some of the accounting records. The consolidated financial statements of the Company have been revised by the Management to give effect to some of my audit observations highlighted during supplementary audit as indicated in the Note No.....of the consolidated financial statements. In addition, I would like to highlight the following significant matters under Section 143(6)(b) read with Section 129 (4) of the Act which have come to my attention and which in my view are necessary for enabling a better understanding of the consolidated financial statements and the related Audit Report:	Statement of Fact
1. Comment on Auditors' Report Clause 3 of the Guidance Note on Auditors' Report on Revised Accounts of Companies before Circulation to Shareholders provides that "the Council recommends that members of the Institute, when called upon to issue a report on the amended accounts for the same period consequent upon the revision of the Balance Sheet and/or the Profit and Loss Account should ensure that unless	The Management has taken the note of the Comments issued by the C&AG office on Statutory Auditors' Report. The Management further took the note of response submitted by Statutory Auditor vide letter dated 26.12.2016 which sum



all copies of the original accounts and report are returned to the Auditor, and adequate disclosure of the fact of the revision on the accounts already approved by the Board and reported upon by the Statutory Auditors appears as a specific Note on the amended accounts. In case the Statutory Auditors are satisfied that the disclosure so made by the Company in the Notes to Accounts is adequate; there may not be any further need for the Auditor to refer to the revision of the Balance Sheet and/or the Profit and Loss Account in his report. However, if the Notes to Accounts do not contain any note on the revision or if such a note is contained therein but not considered by the Statutory Auditors as adequately comprehensive, it will be the duty of the Statutory Auditors to refer to the fact of revision of the accounts in their report."

The Company has not disclosed the fact of revision of the accounts already approved by the Board, in the amended accounts. Hence, in view of the above Guidance Note, the Statutory Auditors' should have referred the fact of revision of the accounts in their report

The Statutory Auditors' Report is deficient to that extent.

**For and on behalf of the
Comptroller and Auditor General of India**

Sd/-

(Gurveen Sidhu)

Accountant General (E&RSA), Gujarat

Place: Ahmedabad

Date: 05-01-2017

up that "there is no material omission of accounting standard or lapse in audit procedure and this does not affect true and fair view of financial statements at all."

**For and on behalf of the
Gujarat State Investments Limited**

(Anil Mukim, IAS)

(DIN 02842064)

Chairman

Place: Gandhinagar

Date: 14-02-2017



Form No. MR-3

SECRETARIAL AUDIT REPORT

FOR THE FINANCIAL YEAR ENDED MARCH 31, 2016

[Pursuant to section 204(1) of the Companies Act, 2013 and rule, No.9 of the Companies
[(Appointment and Remuneration Personnel) Rules, 2014]

To,
The Members,
GUJARAT STATE INVESTMENTS LIMITED

We have conducted the secretarial audit of the compliance of applicable statutory provisions and the adherence to good corporate practices by Gujarat State Investments Limited (hereinafter called "the company"). Secretarial Audit was conducted in a manner that provided us a reasonable basis for evaluating the corporate conducts/statutory compliances and expressing my opinion thereon.

Based on our verification of the company's books, papers, minute books, forms and returns filed and other records maintained by the company and also the information provided by the Company, its officers, agents and authorized representatives during the conduct of secretarial audit. We hereby report that in our opinion, the company has, during the audit period covering the financial year ended on March 31, 2016 complied with the statutory provisions listed hereunder and also that the Company has proper Board-processed and compliance-mechanism in place to the extent, in the manner and subject to the reporting made hereinafter :

We have examined the books, papers, minute books, forms and returns filed and other records maintained by the Company for the financial year ended on March 31, 2016 according to the provisions of :

- (i) The Companies Act, 2013 (the Act) and the rules made thereunder;
- (ii) The Law as applicable specifically to the Company is as under :
 - a. Reserve Bank of India, 1934

We have also examined compliance with the applicable clauses of the following :

- (i) Secretarial Standards issued by The Institute of Company Secretaries of India, to the extent applicable under the companies Act, 2013.

During the period under review the Company has complied with the provisions of the Act, Rules, Regulations, Guidelines, Standards, etc, mentioned above.

The Company was not required to comply with the provision of order regulation listed in the Form No. MR-3 prescribed under the Companies Rules, 2014 as there were no instance / events falling within the preview of these regulation, during the financial year.

We further report that :

- (i) The Board of Directors of the Company is duly constituted with proper balance of Executive Directors, Non-Executive Directors and Independent Directors. The changes in the composition of the Board of Directors that took place during the period under review were carried out in compliance with the provisions of the Act.
- (ii) Adequate notice is given to all directors to schedule the Board Meetings, agenda and detailed notes on agenda were sent at least seven days in advance, and a system exists for seeking and obtaining further information and clarifications on the agenda items before the meeting and for meaningful participation at the meeting.
- (iii) As per the minutes of the Board duly recorded and signed by the Chairman, decision of the Board was unanimous and no dissenting view are recorded.

We further report that there are adequate systems and processes in the company commensurate with the size and operations of the company to monitor and ensure compliance with applicable laws, rules, regulations and guidelines.

For HARISH P. JAIN & ASSOCIATES
PRACTISING COMPANY SECRETARIES

(HARISH JAIN)

Proprietor

Membership No. 4203 C.P. No. 4100

Date:07/06/2016

Place: Ahmedabad



FORM NO. MGT 9

EXTRACT OF ANNUAL RETURN

As on financial year ended on 31.03.2016

Pursuant to Section 92 (3) of the Companies Act, 2013 and rule 12(1) of the Company (Management & Administration) Rules, 2014.

I. REGISTRATION & OTHER DETAILS:

1.	CIN	U64990GJ1988SGC010307
2.	Registration Date	29/01/1988
3.	Name of the Company	GUJARAT STATE INVESTMENTS LIMITED
4.	Category/Sub-category of the Company	Company Limited by Shares/ Government Company
5.	Address of the Registered office & contact details	6 th Floor, H. K. House, Ashram Road, Ahmedabad-380 009 (P)079-26586636, 26579731 Mail:- infoatgsil@gmail.com
6.	Whether listed company	NO
7.	Name, Address & contact details of the Registrar & Transfer Agent, if any.	N.A.

II. PRINCIPAL BUSINESS ACTIVITIES OF THE COMPANY (All the business activities contributing 10 % or more of the total turnover of the company shall be stated)

S. No.	Name and Description of main products / services	NIC Code of the Product/service	% to total turnover of the company
1	Investments Activities	6430	
2			
3			

III. PARTICULARS OF HOLDING, SUBSIDIARY AND ASSOCIATE COMPANIES

SN	NAME AND ADDRESS OF THE COMPANY	CIN/GLN	HOLDING/ SUBSIDIARY	% of shares held	Applicable Section
1	GUJARAT STATE FERTILIZERS & CHEMICALS LIMITED	L99999GJ1962PLC001121	Associate	37.84 %	Section 2(6)
2	GUJARAT NARMADA VALLEY FERTILIZERS & CHEMICALS LIMITED	L24110GJ1976PLC002903	Associate	21.38 %	Section 2(6)
3	GUJARAT ALKALIES AND CHEMICALS LIMITED	L24110GJ1973PLC002247	Associate	20.87 %	section 2(6)



IV. VI. SHARE HOLDING PATTERN (Equity Share Capital Breakup as percentage of Total Equity)

(i) Category-wise Share Holding

Category of Shareholders	No. of Shares held at the beginning of the year[As on 31-March-2014]				No. of Shares held at the end of the year[As on 31-March-2015]				% Change during the year
	De mat	Physical	Total	% of Total Shares	De mat	Physical	Total	% of Total Shares	
A. Promoters									
(1) Indian									
a) Individual/ HUF									
b) Central Govt									
c) State Govt(s)		1042769000	1042769000	100		1042769000	1042769000	100	NIL
d) Bodies Corp.									
e) Banks / FI									
f) Any other		70	70			70	70		
Total shareholding of Promoter (A)		1042769070	1042769070	100		1042769070	1042769070	100	NIL
B. Public Shareholding									
1. Institutions									
a) Mutual Funds									
b) Banks / FI									
c) Central Govt									
d) State Govt(s)									
e) Venture Capital Funds									
f) Insurance Companies									
g) FIs									
h) Foreign Venture Capital Funds									
i) Others (specify)									
Sub-total									



(B)(1):-									
2. Non-Institutions									
a) Bodies Corp.									
i) Indian									
ii) Overseas									
b) Individuals									
i) Individual shareholders holding nominal share capital upto Rs. 1 lakh									
ii) Individual shareholders holding nominal share capital in excess of Rs 1 lakh									
c) Others (specify)									
Non Resident Indians									
Overseas Corporate Bodies									
Foreign Nationals									
Clearing Members									
Trusts									
Foreign Bodies - D R									
Sub-total (B)(2):-									
Total Public Shareholding (B)=(B)(1)+(B)(2)									
C. Shares held by Custodian for GDRs & ADRs									
Grand Total (A+B+C)		1042769070	1042769070	100		1042769070	1042769070	100	NIL



(ii) Shareholding of Promoter-

S N	Shareholder's Name	Shareholding at the beginning of the year			Shareholding at the end of the year			% change in shareho lding during the year
		No. of Shares	% of total Shares of the company	%of Shares Pledged / encumber ed to total shares	No. of Shares	% of total Shares of the company	%of Shares Pledged / encumber ed to total shares	
1	Hon'ble Governor of Gujarat	1042769070	100	Nil	1042769070	100	Nil	NIL
2								
3								
4								
5								
6								
7								
8								
9								

(iii) Change in Promoters' Shareholding (please specify, if there is no change)

No Change

(iv) Shareholding Pattern of top ten Shareholders:

(Other than Directors, Promoters and Holders of GDRs and ADRs):

Not Applicable

(v) Shareholding of Directors and Key Managerial Personnel:

SN	Shareholding of each Directors and each Key Managerial Personnel	Shareholding at the beginning of the year		Cumulative Shareholding during the year	
		No. of shares	% of total shares of the company	No. of shares	% of total shares of the company
	At the beginning of the year	NIL	NIL	NIL	NIL
	Date wise Increase / Decrease in Promoters Shareholding during the year specifying the reasons for increase /decrease (e.g. allotment / transfer / bonus/ sweat equity etc.):	NIL	NIL	NIL	NIL
	At the end of the year	NIL	NIL	NIL	NIL



V) INDEBTEDNESS - Indebtedness of the Company including interest outstanding/accrued but not due for payment.

	Secured Loans excluding deposits	Unsecured Loans	Deposits	Total Indebtedness
Indebtedness at the beginning of the financial year	N.A.	8,25,00,00,000.00	N.A.	8,25,00,00,000.00
i) Principal Amount				
ii) Interest due but not paid				
iii) Interest accrued but not due				
Total (i+ii+iii)				
Change in Indebtedness during the financial year				
* Addition		54,85,00,000.00		54,85,00,000.00
* Reduction				
Net Change		54,85,00,000.00		54,85,00,000.00
Indebtedness at the end of the financial year				
i) Principal Amount		8,79,85,00,000.00		8,79,85,00,000.00
ii) Interest due but not paid				
iii) Interest accrued but not due				
Total (i+ii+iii)		8,79,85,00,000.00		8,79,85,00,000.00

VI. REMUNERATION OF DIRECTORS AND KEY MANAGERIAL PERSONNEL-

A. Remuneration to Managing Director, Whole-time Directors and/or Manager:

The Managing Director of the Company is non-executive MD hence, remuneration to MD is not applicable

B. Remuneration to other Directors

- a Note: Till the last financial year all directors of the Company has nominated by Government of Gujarat, i.e Promoter of the Company, as Non-Executive Directors, therefore sitting fees has not been paid by the Company

b REMUNERATION TO OTHER DIRECTOR

A Independent Directors

Amount in ₹

SN	Particulars of Remuneration	Independent Director		
		Shri Kaimas Mehta	Ms. Shilpi Thapar	Total
1.	Fees for attending Board/Committee Meeting	13500.00	12000.00	25500.00
2.	Commission	NIL	NIL	NIL
3.	Other	NIL	NIL	NIL
	Total Payment	13500.00	12000.00	25500.00


**C. REMUNERATION TO KEY MANAGERIAL PERSONNEL OTHER THAN
MD/MANAGER/WTD**

Amount in ₹

SN	Particulars of Remuneration	Key Managerial Personnel			
		CEO	CS	CFO	Total
1	Gross salary	N.A.	5,98,255.00	8,01,759.00	14,00,014.00
	(a) Salary as per provisions contained in section 17(1) of the Income-tax Act, 1961		NIL	NIL	NIL
	(b) Value of perquisites u/s 17(2) Income-tax Act, 1961		NIL	NIL	NIL
	(c) Profits in lieu of salary under section 17(3) Income-tax Act, 1961		NIL	NIL	NIL
2	Stock Option		NIL	NIL	NIL
3	Sweat Equity		NIL	NIL	NIL
4	Commission		NIL	NIL	NIL
	- as % of profit		NIL	NIL	NIL
	others, specify...		NIL	NIL	NIL
5	Others, please specify		NIL	NIL	NIL
	Total		5,98,255.00	8,01,759.00	14,00,014.00

VII. PENALTIES / PUNISHMENT/ COMPOUNDING OF OFFENCES:

During the year 2015-16, there were no penalties/punishment/compounding of offences under the Companies Act, 2013.

**GUJARAT STATE INVESTMENTS LIMITED**

6th Floor, H.K. House, Ashram Road,

AHMEDABAD-380009

(CIN:-U64990GJ1988SGC010307)

FORMAT FOR THE ANNUAL REPORT ON GSR ACTIVITIES

1. CSR Policy of the Company as annexed hereto
2. The present composition of CSR Committee is as follow,
 1. Shri Anil Mukim, IAS [DIN 02842064], Chairman of the Committee
 2. Smt. Mona Khandhar, IAS [DIN 06803015], Member
 3. Ms. Mamta Verma, IAS [DIN 01854315], Member (Independent Director)
3. The Average Net Profit of the Company for last three financial year is ₹ 73,60,404.02
4. Prescribed CSR expenditure (two percent of the amount as in item 3 above) is ₹ 73,60,404/-
5. The details of CSR spend during the financial year 2015-16 is
 - a Total amount spend for financial year: ₹ 73,60,404.00/-
 - b Amount unspent: NIL
 - c. The Company being a Government Company has contributed the amount ₹ 51,00,000/- to "Mukhya Mantrishri Swachhta Nidhi-Gujarat Rajya", fund created by the State Government and ₹ 22,60,404/- to "Gujarat CSR Authority" towards its CSR contribution

The Committee declares that the amount which has been spent by the Company for CSR Contribution is in compliance with CSR objectives and policy of the Company.

Sd/-

Sd/-

Managing Director_____
Chairman of the CSR Committee

Corporate Social Responsibility Policy

Gujarat State Investments Limited

Preamble

Gujarat State Investments Limited (GSIL) is a wholly owned Government of Gujarat Company with employee size of total five employee, having regard to the Company's size and scope, for social development contribution in the local area it would not be practical to undertake direct CSR project.

CSR Policy

The Company will focus on activities in areas, excluding those undertaken in pursuance of normal business of the Company, selected from those identified and prescribed under the Companies Act, 2013 with greater participation in the area of health, sanitation and social welfare, efforts towards reducing child mortality, promotion of education & social responsible behavior, and employment enhancing vocational skills.

The Government of Gujarat, keeping in view of objective prescribed under the Companies Act, 2013 read with CSR Rules, 2014 has formulate CSR Authority, to carry out various CSR Activities.

The Company will transfer, in every financial year, an amount considered appropriate by the Board, inter-alia keeping in view of the benchmark of 2% of the average net profits of the Company during the 3 immediately preceding financial years, to the CSR Authority and/trust/society as established by the Government of Gujarat, to fulfill its Corporate Social Responsibilities.

Place : Gandhinagar

**INDEPENDENT AUDITOR'S REPORT**

To,
The Members of
GUJARAT STATE INVESTMENTS LIMITED,

Report on the Standalone Financial Statements

We have audited accompanying financial statements of Gujarat State Investments Limited ('the company') which comprise the Balance Sheet as at 31 March, 2016, and the Statement of Profit and Loss and Cash Flow Statement for the year then ended and a summary of significant accounting policies and other explanatory information.

Management's Responsibility for the Financial Statements

The Company's Board of Directors is responsible for the matters stated in Section 134(5) of the Companies Act, 2013 ("the Act") with respect to the preparation of these financial statements that give true and fair view of the financial position, financial performance and cash flows of the Company in accordance with the accounting principles generally accepted in India, including the Accounting Standards specified under Section 133 of the Act, read with Rule 7 of the Companies (Accounts) Rules, 2014. This responsibility also includes maintenance of adequate accounting records in accordance with the provision of the Act for safeguarding the assets of the Company and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgments and estimates that are reasonable and prudent; and design, implementation and maintenance of adequate internal financial controls, that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the financial statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error.

Auditor's Responsibility

Our responsibility is to express an opinion on these standalone financial statements based on our audit.

We have taken into account the provisions of the Act, the accounting and auditing standards and matters which are required to be included in the audit report under the provisions of the Act and Rules made there under.

We conducted our audit in accordance with the Standards on Auditing specified under Section 143(10) of the Act. Those Standards require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether the financial statements are free from material misstatement.

An audit involves performing procedures to obtain audit evidence about the amounts and the disclosures in the financial statements. The procedures selected depend on the auditor's judgment, including the assessment of the risk of material misstatement of the financial statements, whether due to fraud or error. In making those risk assessments, the auditor considers internal financial control relevant to the Company's preparation of the financial statements that give true and fair view in order to design audit procedures that are appropriate in the circumstances, but not for the purpose of expressing an opinion on whether the Company has in place an adequate internal financial controls system over financial reporting and the operating effectiveness of such controls. An audit also includes evaluating the appropriateness of the accounting policies used and the reasonableness of the accounting estimates made by the Company's Directors, as well as evaluating the overall presentation of the financial statements. We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion on the financial statements.

Opinion

In our opinion and to the best of our information and according to explanations given to us, the aforesaid Standalone Financial Statements give the information required by the Act in the manner so required and give a true and fair view in conformity with the accounting principles generally accepted in India, of the state of affairs of the Company as at 31st March 2016 and its profit and its cash flows for the year ended on that date.

**Report on Other Legal and Regulatory Requirements**

1. As required by the Companies (Auditors' Report) Order, 2016 issued by the Central Government of India in terms of section 143(11) of the Act, we give in the Annexure I a statement on the matters specified in paragraphs 3 and 4 of the said Order, to the extent applicable.
2. As required by Section 143(3) of the Act, we report that:
 - (a) We have sought and obtained all the information and explanations which to the best of our knowledge and belief were necessary for the purpose of our audit.
 - (b) In our opinion, proper books of accounts required by the law have been kept by the company so far it appears from our examination of those books.
 - (c) The Balance Sheet, the Statement of Profit and Loss and the Cash Flow Statement dealt with by this Report are in agreement with the books of account.
 - (d) In our opinion, the aforesaid financial statements comply with the Accounting Standards specified under Section 133 of the Act, read with Rule 7 of the Companies (Accounts) Rules, 2014.
 - (e) GSIL being a Government Company, Section 164(2) of The Companies Act 2013 is not applicable.
 - (f) With respect to the adequacy of the internal financial controls over financial reporting of the Company and the operating effectiveness of such controls, refer to our separate Report in "Annexure B".
 - (g) With respect to the other matters to be included in the Auditor's Report in accordance with Rule 11 of the Companies (Audit and Auditors) Rules, 2014, in our opinion and to the best of our information and according to the explanations given to us:
 - (i) The Company has disclosed the impact of pending litigations on its financial position in its financial statements.
 - (ii) The Company did not have any long-term contracts including derivative contracts for which there were any material foreseeable losses:
 - (iii) As the Company being a Government Company & 100% owned by Government of Gujarat, the said clause is not applicable, and the Company has not declared any dividend, so there has been no delay in transferring amounts, required to be transferred to the Investors Education and Protection Fund by the Company.
3. As required by Section 143(5) of the Act, 2013 we are enclosing herewith compliances to directions / sub directions as part of Audit Report in Annexure II enclosed herewith.

Place : Ahmedabad
Date : 28 - 10 - 2016

For, J P SHAH & CO
CHARTERED ACCOUNTANTS
FRN : 109612W
(CA Nirav J. Shah)
Partner
Membership No. 107717

**ANNEXURE TO AUDITOR'S REPORT**

(Referred to in paragraph 1 of our report of even date)

The Annexure referred to in our Independent Auditor's Report to the members of the Company on the financial statements for the year ended 31st March, 2016, we report that:

1. (a) The company has maintained proper records showing full particulars, including quantitative details and situation of Fixed Assets up to 31st March, 2016.
(b) According to the information and explanation given to us all the fixed assets have been physically verified by the company during the year, there is a regular programme of verification which is reasonable having regard to the size of the company and the nature of its assets. No material discrepancy was noticed on such verification.
(c) According to the information and explanations given to us and on the basis of our examination of the records of the Company, the title deeds of immovable properties are held in the name of the Company.
2. This clause is not applicable to the company as the company does not deal in Inventories.
3. The company has not granted any loans secured or unsecured to companies, firms or other parties covered in register maintained under section 189 of the Companies Act, 2013 ("the Act"). Accordingly provisions of clause 3(iii) (a) to (c) of the order are not applicable to the company and hence not commented upon.
4. In our opinion and according to the information and explanations given to us, the Company has complied with the provisions of section 185 and 186 of the Act, in respect of the loans, investment, guarantees and security.
5. The Company has not accepted any deposits from the public and the directives issued by the Reserve Bank of India and the provisions of Sections 73 to 76 or any other provisions of the Act and the Companies (Acceptance of Deposit) Rules, 2015 with regard to deposit accepted from the public are not applicable.
6. The company is not required to maintain the cost records as may be prescribed by the Central Government under section 148(1) of the Companies Act, 2013
7. In respect of statutory dues :
(a) According to the information and explanation given to us, the company is generally Regular in depositing with appropriate authorities undisputed statutory dues including provident fund, employees state insurance, income tax, service tax, cess and other material statutory dues, applicable to it.
According to the information and explanation given to us by the management of the company and based on the records provided to us by the company, there are no disputed amount payables in respect of Income Tax, Service Tax, cess in arrears, as at 31st March, 2016 for a period of more than six months from the date they became payable.
(b) According to the Information and explanations given to us, there are no dues of Income Tax, Service Tax outstanding on account of any dispute.
8. The company does not have any loans or borrowings from any financial institutions, banks, or debenture holders during the year. Accordingly, paragraph 3 (ix) of the Order is not applicable.
9. The company did not raise any money by way of initial public offer or further public offer (including debt instruments) and term loans during the year. Accordingly, paragraph 3 (ix) of the Order is not applicable.
10. According to the information and explanations given to us, no material fraud by the company or on the Company by its officers or employees has been noticed or reported during the course of our audit.
11. According to the information and explanation given to us, and based on our examination of the records of the Company, the Managing Director is a non executive director.



12. In our opinion and according to the information and explanations given to us, the Company is not a Nidhi company and hence the provision of this clause is not applicable.
13. According to the information and explanation given to us and based on the examination of the records, transactions with the related parties are in compliance with sections 177 and 188 of the Act where applicable and the details of such transactions have been disclosed in the financial statements as required by the applicable accounting standards.
14. According to the information and explanations given to us and based on the examination of the records, the Company has not made any preferential allotment or private placement of shares or fully or partly convertible debentures during the year. Accordingly, the provisions of Clause 3 (xiv) of the Order are not applicable to the company and hence not commented upon.
15. According to the information and explanation given to us and based on the examination of the records, the Company has not entered into non-cash transactions with directors or persons connected with him. Accordingly, the provisions of clause 3(xv) of the Order are not applicable to the company and hence not commented upon.
16. According to the information and explanation given to us and based on the examination of the records, The Company has complied with the requirement of section 45-IA of Reserve Bank of India Act, 1934. The details of which are prescribed in Annexure-II

Place : Ahmedabad
Date : 28 - 10 - 2016

For, **J P SHAH & CO**
CHARTERED ACCOUNTANTS
FRN : 109612W
(CA Nirav J. Shah)
Partner
Membership No. 107717

**"Annexure B" to the Auditor's Report of even date on the Standalone Financial Statements of GUJARAT STATE INVESTMENTS LIMITED.****Report on the Internal Financial Controls under Clause (i) of Sub-section 3 of Section 143 of the Companies Act, 2013 ("the Act")**

We have audited the internal financial controls over financial reporting of Gujarat State Investments Limited ("the Company") as of March 31, 2016 in conjunction with our audit of the standalone financial statements of the Company for the year ended on that date.

Management's Responsibility for Internal Financial Controls

The Company's management is responsible for establishing and maintaining internal financial control. These responsibilities include the design, implementation and maintenance of adequate internal financial controls that were operating effectively for ensuring the orderly and efficient conduct of its business, including adherence to company's policies, the safeguarding of its assets, the prevention and detection of frauds and errors, the accuracy and completeness of the accounting records, and the timely preparation of reliable financial information, as required under the Companies Act, 2013.

Auditors' Responsibility

Our responsibility is to express an opinion on the Company's internal financial controls over financial reporting based on our audit. We conducted our audit in accordance with the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting (the "Guidance Note") and the Standards on Auditing, issued by ICAI and deemed to be prescribed under section 143(10) of the Companies Act, 2013, to the extent applicable to an audit of internal financial controls, both applicable to an audit of Internal Financial Controls and, both issued by the Institute of Chartered Accountants of India. Those Standards and the Guidance Note require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether adequate internal financial controls over financial reporting was established and maintained and if such controls operated effectively in all material respects.

Our audit involves performing procedures to obtain audit evidence about the adequacy of the internal financial controls system over financial reporting and their operating effectiveness. Our audit of internal financial controls over financial reporting included obtaining an understanding of internal financial controls over financial reporting, assessing the risk that a material weakness exists, and testing and evaluating the design and operating effectiveness of internal control based on the assessed risk. The procedures selected depend on the auditor's judgement, including the assessment of the risks of material misstatement of the financial statements, whether due to fraud or error.

We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion on the Company's internal financial controls system over financial reporting.

Meaning of Internal Financial Controls over Financial Reporting

A company's internal financial control over financial reporting is a process designed to provide reasonable assurance regarding the reliability of financial reporting and the preparation of financial statements for external purposes in accordance with generally accepted accounting principles. A company's internal financial control over financial reporting includes those policies and procedures that (1) pertain to the maintenance of records that, in reasonable detail, accurately and fairly reflect the transactions and dispositions of the assets of the company; (2) provide reasonable assurance that transactions are recorded as necessary to permit preparation of financial statements in accordance with generally accepted accounting principles, and that receipts and expenditures of the company are being made only in accordance with authorisations of management and directors of the company; and (3) provide reasonable assurance regarding prevention or timely detection of unauthorised acquisition, use, or disposition of the company's assets that could have a material effect on the financial statements.

Inherent Limitations of Internal Financial Controls over Financial Reporting

Because of the inherent limitations of internal financial controls over financial reporting, including the possibility of collusion or improper management override of controls, material misstatements due to error or fraud may occur and not be detected. Also, projections of any evaluation of the internal financial controls over financial reporting to future periods are subject to the risk that the internal financial control



over financial reporting may become inadequate because of changes in conditions, or that the degree of compliance with the policies or procedures may deteriorate.

Opinion

In our opinion, the Company has, in all material respects, an adequate internal financial controls system over financial reporting and such internal financial controls over financial reporting were operating effectively as at March 31, 2016, based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India.

Place : Ahmedabad
Date : 28 - 10 - 2016

For, **J P SHAH & CO**
CHARTERED ACCOUNTANTS
FRN : 109612W
(CA Nirav J. Shah)
Partner
Membership No. 107717



REPORT IN RESPECT OF DIRECTIONS UNDER SECTION 143(5) OF THE COMPANIES ACT, 2013 FOR THE YEAR 2015-2016.

Sr. No.	Particulars	Comments on
(1)	If the Company is selected for disinvestment, a complete status report in terms of valuation of assets (including intangible assets and land) and liabilities (including committed & general reserves) may be examined including the mode and present stage of disinvestment process.	The company is not selected for disinvestment process. So, this clause will no be applicable to it.
(2)	Please report whether there are any cases of waiver/write off of debts /loan/interest etc. if yes, the reasons therefore and the amount involved.	No such instances found.
(3)	Whether proper records are maintained for inventories lying with third parties & assets received as gift from Government or other authorities.	Not applicable.
(4)	A report on age-wise analysis of pending legal/arbitration cases including the reasons of pendency and existence / effectiveness of a monitoring mechanism for expenditure on all legal cases (foreign and local) may be given.	No such pending legal / arbitration cases.

**SECTOR SPECIFIC SUB-DIRECTIONS UNDER SECTION 143(5) OF THE COMPANIES ACT, 2013
FINANCE SECTOR**

Sr. No.	Particulars	Comments on
(1)	Whether the Company has complied with the directions issued by Reserve Bank of India for : - Non – Banking Finance Companies (NBFCs); - Classification of non-performing assets; and - Capital adequacy norms for NBFCs.	The Company had applied to RBI for carrying out the business as NBFC-CIC on 4/08/2014 & same has been considered & approved by RBI on 28/04/2015. So, as on date of reporting the Company is recognized as Unregistered CIC.
(2)	Whether the Company has a system to ensure that loans were secured by adequate security free from encumbrances and have first charge on the mortgaged assets. Further instances of undue delay in disposal of seized units may be reported.	The said clause is not applicable to the Company
(3)	Whether introduction of any scheme for settlement of dues and extensions hereto complied with policy/ guidelines of Company / Government.	The said clause is not applicable to the Company
(4)	Comments on the confirmation of balances of trade receivables, trade payables, term deposits, bank accounts and cash obtained.	Yes, the confirmation for term deposits, bank accounts & cash is obtained
(5)	Whether the bank guarantees have been revalidated in time ?	The said clause is not applicable to the Company

Place : Ahmedabad
Date : 28 - 10 - 2016

For, **J P SHAH & CO**
CHARTERED ACCOUNTANTS
FRN : 109612W
(CA Nirav J. Shah)
Partner
Membership No. 107717



GUJARAT STATE INVESTMENTS LIMITED
BALANCE SHEET AS AT 31st MARCH 2016 (Standalone) Amount in (Rs.)

Particulars	Note No.	As at 31-3-2016	As at 31-3-2015
I. EQUITY AND LIABILITIES			
(1) Shareholder's Funds			
(a) Share Capital	2	10427690700	10427690700
(b) Reserves and Surplus	3	7344734968	6515714131
Shareholder's Funds		17772425668	16943404831
(2) Share Application Money pending allotment		0	0
(3) Non-Current Liabilities			
(a) Long-Term Borrowings	4	8798500000	8250000000
(b) Long Term Provisions	5	829664	799881
Non-Current Liabilities		8799329664	8250799881
(4) Current Liabilities			
(a) Trade Payables		0	0
(b) Other Current Liabilities	6	1164930	467825
(c) Short term Provisions	7	27382	23728
Current Liabilities		1192312	491553
Total		26572947644	25194696265
II. ASSETS			
(1) Non-Current Assets			
(a) Fixed Assets			
(i) Tangible assets	8	1088172	222354
(b) Non-current investments	9	22885567578	22860374378
(c) Deferred tax assets (net)	10	366829	108793
(d) Long term loans and advances	11	39769638	89534306
Non-Current Assets		22926792217	22950239831
(2) Current Assets			
(a) Cash and Cash Equivalents	12	552461691	4922024
(b) Short-term loans and advances	13	2963093492	2133137969
(c) Other current assets	14	130600244	106396441
Current Assets		3646155427	2244456434
Total		26572947644	25194696265

Notes to Balance Sheet and Statement of Profit & Loss 1 to 31
As per our report attached

For **J. P. Shah & Co.**
Chartered Accountants
Firm registration number : 109612W
(CA Nirav J. Shah)
Partner
Membership No. : 107717
Place : Ahmedabad
Date : 28-10-2016

For and on behalf of board of directors of
Gujarat State Investments Limited

Managing Director | Director | Company Secretary | Chief Financial Officer
Place : Gandhinagar
Date : 28-10-2016


PROFIT & LOSS ACCOUNT FOR THE YEAR ENDED 31st MARCH 2016 (Standalone)
 Amount in (Rs.)

Particulars	Note No	Year ended 31-3-2016	Year ended 31-3-2015
I Revenue :			
Revenue from operations	15	908058932	861263542
Other Income	16	11000900	240779169
Total Revenue		919059832	1102042711
II Expenses			
Employee Benefits Expenses	17	3239362	3176302
Finance Costs	18	79886	0
Depreciation expenses	8	339572	119283
Other expenses	19	11564751	5397699
Total Expenses		15223571	8693284
III Profit before Tax		903836261	1093349427
IV Tax Expense			
(a) Current tax		74751287	123146213
(b) Current tax expense related to prior years		322173	111080
(c) Deferred Tax Assets/(Liabilities)		258036	(143638)
V Profit for the year(III - IV)		829020837	969948496
VI Earnings Per Equity Share (F.V of Rs. 10 each)			
Basic (in Rs.)		0.80	0.93
Diluted (in Rs.)		0.80	0.93

Notes to Balance Sheet and Statement of Profit & Loss 1 to 31
 As per our report attached

For **J. P. Shah & Co.**
 Chartered Accountants
 Firm registration number : 109612W
 (CA Nirav J. Shah)
 Partner
 Membership No. : 107717
 Place : Ahmedabad
 Date : 28-10-2016

For and on behalf of board of directors of
 Gujarat State Investments Limited

Managing Director | Director | Company Secretary | Chief Financial Officer
 Place : Gandhinagar
 Date : 28-10-2016


CASH FLOW STATEMENT FOR THE YEAR ENDED ON 31st MARCH 2016 (Standalone)
Amount in (Rs.)

Particulars	2015-2016	2014-2015
A. CASH FLOW FROM OPERATING ACTIVITIES		
Net Profit Before Tax	903,836,261.00	1,093,349,426.52
Adjustments for :		
Provision for diminution in value of investments, credited to the statement of Profit & Loss Account	0.00	-1,060,936.00
Depreciation	339,572.00	119,283.00
Liabilities / Provisions no longer required	0.00	0.00
Liabilities / Provisions no longer required		
Profit / Loss on sale of Assets	0.00	-497.70
Profit & Loss on sale of Investment	0.00	-239,717,735.24
Prior Period Adjustment		
Operating profit before working capital changes		
Adjustments for :		
Provision of Gratuity & Retirement benefits		
Operating profit before working capital changes	904,175,833.00	852,689,540.58
Movments in working Capital		
Decrease/increase in other current assets	-24,203,803.00	65,636,840.00
Other Non current assets	29,783.00	
Decrease/increase in loan & Advances	-780,190,855.00	2,642,283,240.36
Decrease / Increase in Current Liability	697,105.00	-2,165,935.00
Cash used in operations	-803,667,770.00	2,705,754,145.36
Direct Tax Paid (Net of Refunds)	-75,073,460.00	-123,257,293.00
Net Cash used in Operating Activities	25,434,603.00	3,435,186,392.94
B CASH FLOW FROM INVESTING ACTIVITIES		
Proceeds from sale of Fixed Assets	0.00	21,200.00
Proceeds from sale of Investment	0.00	250,671,878.00
Purchase of Fixed Asset	-1,205,390.00	-263,161.00
Capital Expenditure on Purchase of Fixed Assets	0.00	0.00
Purchase of Investments	-25,193,200.00	-85,612,220.00
Intercompany Deposits Placed		
Intercompany Deposits Withdrawn		
Net Cash from Investing Activities	-26,398,590.00	164,817,697.00
C CASH FLOW FROM FINANCING ACTIVITIES		
Proceeds from unsecured loans	548,500,000.00	-3,685,839,000.00
Proceeds for Share Application Money	0.00	0.00
Net Cash from Financing Activities	548,500,000.00	-3,685,839,000.00
Net Increase / (Decrease) in Cash And Cash Equivalents (A + B + C)	547,536,013.00	-85,834,910.06
Cash And Cash Equivalents - Opening Balance	4,922,023.94	90,756,934.00
Cash And Cash Equivalents - Closing Balance	552,461,690.94	4,922,023.94

Note:

- Since Company is a Investment Company, Purchase & sale of investments have been considered as part of " Cash flow from Investing activities & interest / dividend earned from said investments during the year have been considered as part of " Cash flow from Operating activities"
- Cash and cash equivalents represents cash and bank balances as per Balance Sheet, intercompany deposits placed for three months or lower tenure.
- Previous year's figures have been regrouped, wherever necessary.

As per our report attached
For J. P. Shah & Co.
Chartered Accountants
Firm registration number : 109612W
(CA Nirav J. Shah)
Partner
Membership No. : 107717
Place : Ahmedabad
Date : 28-10-2016

For and on behalf of board of directors of
Gujarat State Investments Limited

Managing Director | Director | Company Secretary | Chief Financial Officer

Place : Gandhinagar
Date : 28-10-2016



Notes forming part of financial statements for the year ended 31st March'2016 (Standalone)

1. SIGNIFICANT ACCOUNTING POLICIES

1.1 Basis of preparation of Financial Statements

The Financial Statements are prepared in accordance with Generally Accepted Accounting Principles (GAAP) in India under the historical cost convention on accrual basis of accounting.

Accounting Policies have been consistently followed except where a newly issued Accounting Standard is initially adopted or a revision of an existing Accounting Standard requires a change in the accounting policy hitherto in use. The company adopts the accrual system of accounting. The accounting is on the basis of a going concern concept.

The accounting policies adopted in preparation of financial statements are consistent with those of previous year except for the change in accounting policy explained below.

1.2 Use of Estimates

The preparation of financial statements in conformity of Indian GAAP requires the management to make judgments, estimates & assumptions that affects the reported amounts of revenues, expenses, assets, liabilities and the disclosure of contingent liabilities, at the end of the reporting period. Although these estimates are based on the management's best knowledge of current events and actions.

Uncertainty about these assumptions and estimates could result in the outcomes requiring a material adjustment to the carrying amounts of assets or liabilities in future periods.

1.3 Income Recognition

Income from dividend is accounted as and when such dividend has been declared and company's right to received payment is established.

Interest income is recognized on a time proportion basis, taking into the account the amount outstanding and the rate applicable.

1.4 Fixed Assets

Fixed assets are stated at cost of acquisition less accumulated depreciation provided on written down value method.

Cost comprises the purchase price and any attributable cost of bringing the asset to its working condition for its intended use.

1.5 Depreciation

Depreciation on fixed assets is provided on written down value method as per the Useful life prescribed in Schedule II to the Companies Act, 2013.

1.6 Impairment of Fixed Assets

a) Consideration is given during the period to determine whether there is any indication of impairment of the carrying amount of the Company's Fixed Assets. If any indication exists, an Asset's recoverable amount is estimated, an impairment loss is recognized whenever the carrying amount of an Asset exceeds recoverable amount.

b) Reversal of impairment losses recognized in prior years is recorded when there is an indication that the impairment losses recognized for the asset no longer exist or have decreased.

1.7 Investments

Investments are long term and are stated at cost of acquisition.

Provision is made for diminution in the value of investment other than of temporary nature.

1.8 Employee Benefits

i) Short-term employee benefits;

Short-term employment benefits are recognized as an expense at the undiscounted amount in the profit & loss account of the year in which the related service is rendered.



ii) Post employment benefits;

- a) Post employment benefits comprise of gratuity, leave encashment Post employment benefits are recognized as an expense in the profit and loss account for the year in which the employee has rendered services. The expense is recognized at the present value of the amount payable using actuarial valuation carried out as at the end of the year in accordance with the Accounting Standard As-15 on 'Employee Benefits' notified under Companies Accounting Standards Rules ,2006.
- b) The company has setup a separate Provident Fund Trust. Contribution paid / payable for provident fund of eligible employees is recognized in the profit and loss account each year. The Company has an obligation to make good the short fall if any, between the return from the investment of the trust and the interest rate notified by the government.

Actuarial gains and losses in respect of post employment benefits are charged to the profit and loss account.

1.9 Taxation.

- a) Provision for Income Tax is made on the basis of taxable income for the current accounting year in accordance with the Income Tax Act, 1961 and Rules framed there under.
- b) Deferred tax asset / liability are recognized at the applicable rate of tax on the basis of timing differences between book profit and taxable income. Deferred tax assets are recognized only to the extent that there is reasonable certainty that sufficient future taxable income is available against which deferred tax assets can be realized. In situations where the company has carry forward tax losses all deferred tax assets are recognized only if there is virtual certainty supported by convincing evidence that they can be realized against future taxable profits.

1.10 Earning Per Share

The company reports basic and diluted earnings per share (EPS) in accordance with Accounting standard 20 on Earnings Per Share. Basic EPS is computed by dividing the net profit or loss for the year by the weighted average number of equity shares outstanding during the year.

1.11 Provisions And Contingent Liabilities

Provisions

A provision is recognized when an enterprise has a present obligation as a result of past event; it is probable that an out flow of resources will be required to settle the obligation ,in respect to its present value and are determined based on best estimate required to settle the obligation at the Balance Sheet date. These are reviewed at each Balance Sheet date and adjusted to reflect the current estimates.

Contingent liabilities, if any, are disclosed by way of note.



NOTES TO FINANCIAL STATEMENTS (Standalone)

Amount in (Rs.)

Note No.	Particulars	As at 31-3-2016	As at 31-3-2015
Notes to Financial Statements			
2	Share Capital		
a	The company has two class of shares referred to as Equity shares & Preference shares. The details thereof are as under :		
	Authorised		
	285,00,00,000 Equity Shares of Rs. 10 each	28500000000	28500000000
	1,50,00,000 Preference Shares of Rs. 100 each	1500000000	1500000000
	Total	30000000000	30000000000
	Issued, Subscribed and Paid up		
	104,27,69,070 Equity Shares of Rs. 10 each	10427690700	10427690700
	Total	10427690700	10427690700
Held by:			
1. Governor of Gujarat (100 % Shareholding) (P.Y. : 100 % Shareholding)			
b	Reconciliation of number of shares outstanding :		
	Particulars	Equity Shares (in Nos.)	
	A Shares at the beginning of the year	1042769070	1042769070
	B Issued during the period	0	0
	C Less : Share bought back	0	0
	D Shares At the end of the year (A + B - C)	1042769070	1042769070
c	Rights of Equity Shareholders, Dividend and Repayment of Capital :		
i	All shares rank equally with regard to company's residual assets.		
ii	The holders of equity shares are entitled to receive dividends as declared from time to time and are entitled to one vote per share at the meeting of the company.		
d	The details of shareholders holding more than 5 % of Shares :		
	Name of the Shareholders	Equity Shares (in Nos.)	
	Gbvornor of Gujarat (100 % Shareholding)	1042769070	1042769070



NOTES FORMING PART OF FINANCIAL STATEMENTS (Standalone)

Amount in (Rs.)

Note No.	Particulars	As at 31-3-2016	As at 31-3-2015
3 Reserves & Surplus			
	Surplus i.e. Balance in the Statement of Profit & Loss As per last Balance Sheet	5995714131	5025770337
	Less : Depreciation on transition to Schedule II of the Companies Act, 2013 on tangible fixed assets with nil remaining useful life	0	4702
	Addition : Profit for the year	829020837	969948496
	Total (a)	6824734968	5995714131
	Capital Redemption Reserve As per last Balance Sheet	520000000	520000000
	Total (b)	520000000	520000000
	Total Reserves & Surplus (a + b)	7344734968	6515714131
4 Long Term Borrowings - Unsecured			
	Loan from State Government (GOG)	8798500000	8250000000
	Total	8798500000	8250000000
5 Long Term Provisions			
	(a) Provision for Employee Benefits :		
	(i) Provision for gratuity	532737	476575
	(ii) Provision for leave encashment	296927	257928
	(ii) Provision for other employee benefits	0	65378
	Total	829664	799881
	Trade Payables		
	Creditors for Expenses / Services if any	0	0
	Total	0	0
	There are no amounts due to the parties covered under Micro, Small and Medium Enterprises Development Act, 2006.		
6 Other Current Liabilities			
	Other payables	1164930	467825
	Total	1164930	467825
7 Short Term Provisions			
	(i) Provision for Gratuity	15847	14469
	(ii) Provision for Leave Encashment	11535	9259
	Total	27382	23728



Notes forming part of financial statements (Standalone)

8. Tangible Assets

Amount in Rs.

Particulars	Gross Block			Depreciation Block			Net Block	
	As at March 31, 2015	Additions during the Year	Sale/ Disposal during the year	As at March 31, 2016	For the Year	Adjustment	As at March 31, 2016	As at March 31, 2015
Furniture & Fixtures	515,769.55	0.00	0.00	515,769.55	0.00	0.00	497,023.39	18,746.16
Vehicles	507,535.02	1,205,390.00	0.00	1,712,925.02	264,347.00	0.00	746,504.80	25,377.22
Office Equipment	158,226.00	0.00	0.00	158,226.00	16,888.00	0.00	97,810.22	77,303.78
Computer	317,003.00	0.00	0.00	317,003.00	58,337.00	0.00	268,711.31	105,628.69
Total	1,498,533.57	1,205,390.00	0.00	2,703,923.57	339,572.00	0.00	1,611,049.72	227,055.85
Previous Year	2,235,095.57	263,161.00	999,723.00	1,498,533.57	119,283.00	979,020.70	1,271,477.72	103,880.15

No assets are under lease or are acquired due to business combinations and other adjustments

No assets have been written off on reduction of capital or revalued during the preceding five years as on March, 31, 2016



NOTES FORMING PART OF FINANCIAL STATEMENTS (Standalone)

Amount in (Rs.)

Note No.	Particulars	No. of Shares		Book Value Amount	
		As at 31-3-2016	As at 31-3-2015	As at 31-3-2016	As at 31-3-2015
9 Non-current investments					
	Long Term - Trade Investments (At cost) (No. of Equity Shares of face value of Rs. 10 each fully paid-up unless otherwise specified.)				
(a)	Quoted				
(i)	Equity Shares - Strategic investments				
	Gujarat Narmada Valley Fertilisers Co. Ltd.	33227546	33227546	1353153175	1353153175
	Gujarat State Fertilisers & Chemicals Co. Ltd. (F.V Rs.2)	150799905	150799905	2523796172	2523796172
	Gujarat Alkalies & Chemicals Ltd.	15329373	15329373	1733152505	1733152505
	Gujarat Industries Power Co. Ltd .	352415	37500	26383825	1190625
	Torrent Power Ltd.	46871621	46871621	178859260	178859260
	Gujarat Leasing Financing Ltd.	1328125	1328125	71492209	71492209
	Total (i)			5886837145	5861643945
(ii)	Equity Shares - Non Strategic investments				
	Digjam Limited	1234744	1234744	188026969	188026969
	Atul Products Ltd.	130594	130594	14096129	14096129
	Batliboi & Co. Ltd. (F.V. Rs.5)	38895	38895	1025876	1025876
	G S L (India) Limited	157140	157140	1571400	1571400
	Gujarat State Financial Corporation	935600	935600	18712000	18712000
	Sun Pharmaceutical Industries Ltd. (F.V Rs.1)	505265	505265	9287287	9287287
	Bank of Baroda (F.V Rs. 2)	250000	250000	11012500	11012500
	Total (ii)			243732160	243732160
	Total (a) (i + ii)			6130569306	6105376106
(b)	Un Quoted				
(i)	Equity Shares - Non Strategic investments				
	Cama Hotels Ltd.	5340	5340	72700	72700
	Gujarat State Machine Tools Co. Ltd. (F. V Rs. 1)	1929050	1929050	20000	20000
	Gujarat State Trans Receivers Limited	12000	12000	1000	1000
	Total (i)			93700	93700
(ii)	Equity Shares - Strategic investments				
	Bhavnagar Energy Corporation Ltd.	143583900	143583900	1435839000	1435839000
	Gujarat State Petroleum Corporation Ltd. (F.V Rs. 1)	192592441	192592441	15599987726	15599987726
	Total (ii)			17035826726	17035826726
	Total (b) (i + ii)			17035920426	17035920426
	Total (a + b)			23166489732	23141296532
	Less : Provision for diminution in value of investments			280922154	280922154
	Total Book Value of investments			22885567578	22860374378
	Aggregate Market Value of Quoted investments			26474587353	25613464101



NOTES FORMING PART OF FINANCIAL STATEMENTS (Standalone)

Amount in (Rs.)

	As at 31-3-2016	As at 31-3-2015
10 Deferred Tax Assets In terms of the provisions of the Accounting Standard No. 22 " Accounting for tax on Income", notified by companies (Accounting Standards) Rule 2006 the company has started recognition of Deferred Tax. In compliance with the provision of the Accounting Standard and based on general prudence, the company has started recognizing the said DTA / DTL while preparing the Accounts for the current year. Deferred Tax Asset - Depreciation Accrued Expenses - Deductible on Payment Net Deferred Tax Asset	 70222 296607 366829	 28894 79899 108793
11 Long Term Loans and advances (a) Advance Income Tax { (net of provisions of Current Year Rs.7,47,51,287 /-) (Previous Year : Rs.12,31,46,213/-) (b) Other loans and advances (Bridge loan) Doubtful Less : Provision for other doubtful loans and advances	 39769638.00 2500000.00 2500000.00 39769638.00	 89534306.00 2500000.00 2500000.00 89534306.00
12 Cash & Cash Equivalents (a) Cash on hand (b) Balances with Banks : -In current accounts © Liquid deposits with GSFS Total	 11816.00 550406199.94 2043675.00 552461690.94	 7003.50 371345.44 4543675.00 4922023.94
13 Short-term loans and advances (a) Security Deposits Unsecured, considered good (b) Loans & advances to employees Secured, considered good (c) Prepaid expenses - Unsecured, considered good (d) Balances with government authorities (i) FBT Refund (ii) Income Tax Refund (e) Inter-corporate deposits unsecured, considered good Gujarat State Financial Services Ltd. Total	 1263215.00 2857.00 4026.00 0.00 2961823394.00 2963093492.00	 4000.00 2994.00 4026.00 746717.00 2132380232.00 2133137969.00
14 Other current assets (i) Interest accrued on investments Total	 130600244.00 130600244.00	 106396441.00 106396441.00



NOTES FORMING PART OF FINANCIAL STATEMENTS (Standalone)

Amount in (Rs.)

	As at 31-3-2016	As at 31-3-2015
15 Details of Revenue from operations		
(a) Income from Investments		
(i) Dividends	685491289.50	505307171.00
(ii) Interest on Investments	222567642.00	355956371.00
Total	908058931.50	861263542.00
16 Other Income		
(i) Adjustment to the carrying amount of long term investments- reversal of reduction in the carrying amount	0.00	1060935.58
(ii) Profit on sale of Investments	0.00	239717735.24
(iii) Profit on sale of Assets	0.00	497.70
(iv) Adjustment of shortfall payment on CPF trust	106066.00	0.00
(v) Interest on Income Tax refund	10894834.00	0.00
Total	11000900.00	240779168.52
17 Employee Benefits Expenses		
(i) Salaries	2791054.00	2718295.00
(ii) Contribution to provident and other funds	448308.00	458007.00
Total	3239362.00	3176302.00
18 Finance Costs		
(i) Interest Expenses on Borrowings	0.00	0.00
(ii) Interest expenses paid to I.T Department	79886.00	0.00
Total	79886.00	0.00
19 Other Expenses		
Power & fuel	110084.00	73425.00
Office rent	2297756.00	478500.00
Repairs & maintenance	0.00	10128.00
Insurance	5164.00	5456.00
Rates & Taxes	74403.00	80060.00
Communication	46413.00	26448.00
Travelling & Conveyance	136163.00	106237.00
Printing & Stationery	92175.50	69345.00
Legal & Professional	312657.00	96587.00
Payment to auditors	83874.00	98315.00
Stamp duty Expense	145600.00	0.00
service tax (RCM)	28157.00	0.00
Miscellaneous Expenses	829050.00	152542.00
Advertisement Expenses	0.00	1020.00
Prior Period items	0.00	0.00
Expenditure on Corporate Social Responsibility	7360404.00	4199636.00
registration fees	42850.00	0.00
Total	11564750.50	5397699.00



NOTES FORMING PART OF FINANCIAL STATEMENTS (Standalone)

20 This being an investment Company, the disclosure as per Para 4 (a) & (b) of Part II to the Schedule III of the Companies Act 2013, is not required to be made.

21 Depreciation is calculated on WDV method on the number of remaining useful life of the assets as per the provisions of Companies Act, 2013.

22 Segment Reporting

The Company operates in one business segment. In view of this, no separate disclosure is required under Accounting Standard AS – 17 "Segment Reporting".

23 Related Party disclosure as required under the Accounting Standard "AS-18" on Related Party Disclosures, notified under Companies Accounting Standard Rules 2006 are given below :

a) The Company being state controlled enterprise, it is not required to disclose transaction with other State controlled enterprise Accounting Standards AS-18

b) There is no transaction with Key management personnel

24 Employee Benefits

"The disclosures required under Accounting Standard 15 "Employees Benefit" notified in the Companies (Accounting Standards) Rules 2014 are given below:

(a) Changes in present value of obligation (As on March 31, 2016) (Amount Rs.)

Particulars	(Gratuity) March 31, 2016	(Gratuity) March 31, 2015	(Leave Encashment) March 31, 2016	(Leave Encashment) March 31, 2015
Present value of obligation as at beginning of the year	491044	3,48,355	267187	178928
Current Service Cost	46,847	22,206	22,711	20,034
Interest Cost	37,737	31,187	20,479	15,821
Actuarial Gain/ (Loss) on obligations	(27044)	89,296	(1915)	52,404
Benefits payable	0	0	0	0
Present Value of Obligation as at end of the year	548,584	4,91,044	308,462	267,187

(b) The gratuity plan is not funded. Hence particulars relating to plan assets are not given

(c) The Amount Recognized in Balance Sheet

(Amount in Rs)

Particulars	(Gratuity) March 31, 2016	(Gratuity) March 31, 2015	(Leave Encashment) March 31, 2016	(Leave Encashment) March 31, 2015
Present Value of obligation at the end of the Year	548584	4,91,044	3,08,462	2,67,187
Fair Value of Plan Assets as at the end of the Year	Nil	Nil	Nil	Nil
New Asset/ (Liability) recognized in Balance Sheet	548,584	491,044	308,462	2,67,187

(d) Amount Recognized in the Profit and Loss Account

(Amount in Rs)

Particulars	(Gratuity) March 31, 2016	(Gratuity) March 31, 2015	(Leave Encashment) March 31, 2016	(Leave Encashment) March 31, 2015
Current Service Cost	46,847	22,206	22,711	20,034
Interest Cost	37,737	31,187	20,479	15,821
Net Actuarial Gain/(Loss) recognized in the year 2015-16	(27044)	89,296	(1915)	52,404
Exp. Recognized in the statement of Profit & Loss	57,540	142,689	41,275	88,259

(e) Assumptions

Particulars	(Gratuity) March 31, 2016	(Gratuity) March 31, 2015	(Leave Encashment) March 31, 2016	(Leave Encashment) March 31, 2015
Mortality Table (LIC)	2006-08 (Ultimate)	1994-96 (Ultimate)	2006-08 (Ultimate)	1994-96 (Ultimate)
Discount Rate	7.6%	7.8%	7.6%	7.8%
Rate of Increase in Compensation levels	5.0%	5.0%	5.0%	5.0%
Rate of Return Plan Assets	Not applicable	Not applicable	Not applicable	Not applicable



- 25 The estimates of rate of escalation in salary considered in actuarial valuation, take into account inflation, seniority, promotion and other relevant factors including supply and demand in the employment market. The relevant information is certified by the Actuary.

In terms of the guidance on implementing the As - 15 (Revised 2005) issued by the Institute of Chartered Accountants of India, the Employees Provident Fund setup by the Company is treated as defined benefit plan since the company has to meet the specified minimum rate of return, at the year end, no short fall have remained un-provided for. Accordingly an amount of Rs.40688/- (previous year Rs. 68095/- as expenses) is recognized as excess amount towards the Provision for Provident Fund Scheme of the Company and the same credited to Profit and Loss Account

26 **Cash and cash equivalents**

Cash and cash equivalents for the purposes of cash flow statement comprise cash at bank and in hand along with balance of Liquid deposit with GSFS.

27 **Auditor's Remuneration**

(Amount in Rs.)

Particulars	2015-16	2014-15
For Statutory Audit Fees	17421.00	16854.00
For Tax Audit Fees	14518.00	14045.00
For Internal Audit Fees	28625.00	28090.00
For Epf Trust Audit Fees	2863.00	11236.00
For Secretarial Audit Fees	23310.00	28090.00

28 **Earnings per Share**

	2015-16	2014-15
Profit/(Loss) for the period (Rs.)	829020837	969948496
Weighted average no. of shares (Face Value Rs. 10 each)		
Earnings per Share(Basic/Dilluted)	1042769070	1042769070
(Face Value Rs.10 each)	0.80	0.93

29 **Contingent Liabilities**

Claim of Income Tax for the Assessment Years 2001-02,2004-05, 2006-07,2010-2011,2011-12,2012-13,2013-14 against the company is disputed and not acknowledged as debt. The company is in appeal before appellate authorities, & as on date of preparing Financial Statements there are no outstanding demand against the Company.

- 30 The previous year's figures have been regrouped / recast / reclassified / rearranged wherever necessary to correspond with the current year's classification / disclosure.

- 31 As a promoter of Bhavnagar Energy Company Limited (BECL), the company has signed the Sponsors' Support Agreement (SSA) and as per the said Agreement, the promoters collectively shall not, till the final settlement date (being the date on which all obligations under the SSA have been irrevocably and unconditionally paid and discharged in full to the satisfaction of lenders), dispose-off their shareholdings which would result in dilution of their shareholding below 51%.

As per our report attached
For **J. P. Shah & Co.**
Chartered Accountants
Firm registration number : 109612W
(CA Nirav J. Shah)
Partner
Membership No. : 107717
Place : Ahmedabad
Date : 28-10-2016

For and on behalf of board of directors of
Gujarat State Investments Limited

Managing Director | Director | Company Secretary | Chief Financial Officer

Place : Gandhinagar
Date : 28-10-2016

**Independent Auditors' Report on Consolidated Financial Statements**

To,
The Members of
Gujarat State Investments Limited

Report on the Consolidated Financial Statements

We have audited the accompanying consolidated financial statements of Gujarat State Investments Limited ("the Investor Company") and its Associates (collectively referred to as "the Company" or "the Group"), comprising of the consolidated balance sheet as at 31 March 2016, the consolidated statement of profit and loss, the consolidated cash flow statement for the year then ended, and a summary of the significant accounting policies and other explanatory information (hereinafter referred to as "the consolidated financial statements").

Management's Responsibility for the Consolidated Financial Statements

The Investor Company's Board of Directors is responsible for the preparation of the consolidated financial statements in terms of the requirements of the Companies Act, 2013 ("the Act") that give a true and fair view of the consolidated financial position, consolidated financial performance and consolidated cash flows of the Company in accordance with the accounting principles generally accepted in India, including the Accounting Standards specified under Section 133 of the Companies Act, 2013 (hereinafter referred to as "the Act") read with Rule 7 of the Companies (Accounts) Rules, 2014. The Board of Directors of the Company are responsible for maintenance of adequate accounting records in accordance with the provisions of the Act for safeguarding of the assets of the Company and for preventing and detecting frauds and other irregularities; the selection and application of appropriate accounting policies; making judgments and estimates that are reasonable and prudent; and the design, implementation and maintenance of adequate internal financial controls, that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the financial statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error, which have been used for the purpose of preparation of the consolidated financial statements by the Directors of the Investor Company, as aforesaid.

Auditors' Responsibility

Our responsibility is to express an opinion on the consolidated financial statements based on our audit. While conducting the audit, we have taken into account the provisions of the Act, the accounting and auditing standards and matters which are required to be included in the audit report under the provisions of the Act and the Rules made there under.

We conducted our audit in accordance with the Standards on Auditing specified under section 143(10) of the Act. Those standards require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether the consolidated financial statements are free from material misstatement.

An audit involves performing procedures to obtain audit evidence about the amounts and the disclosures in the consolidated financial statements. The procedures selected depend on the auditor's judgment, including the assessment of the risks of material misstatement of The Consolidated financial statements, whether due to fraud or error. In making those risk assessments, the auditor considers internal financial control relevant to the Investor Company's preparation of the consolidated financial statements that give a true and fair view in order to design audit procedures that are appropriate in the circumstances. An audit also includes evaluating the appropriateness of the accounting policies used and the reasonableness of the accounting estimates made by the Investors Company's Board of Directors, as well as evaluating the overall presentation of the consolidated financial statements.

We believe that the audit evidence obtained by us is sufficient and appropriate to provide a basis for our audit opinion on the consolidated financial statements.

Opinion

In our opinion and to the best of our information and according to the explanations given to us, the aforesaid consolidated financial statements give the information required by the Act in the manner so



required and give a true and fair view in conformity with the accounting principles generally accepted in India, of the consolidated state of affairs of the Company, as at 31 March 2016, and their consolidated profit and their consolidated cash flows for the year ended on that date.

Report on Other Legal and Regulatory Requirements

1. As required by sub-section 3 of Section 143 of the Act, we report, to the extent applicable, that:
 - (a) We have sought and obtained all the information and explanations which to the best of our knowledge and belief were necessary for the purposes of our audit of the aforesaid consolidated financial statements.
 - (b) In our opinion, proper books of account as required by law relating to preparation of the aforesaid consolidated financial statements have been kept so far as it appears from our examination of those books.
 - (c) The consolidated balance sheet, the consolidated statement of profit and loss, and the consolidated cash flow statement dealt with by this Report are in agreement with the relevant books of account maintained for the purpose of preparation of the consolidated financial statements.
 - (d) In our opinion, the aforesaid consolidated financial statements comply with the Accounting Standards specified under Section 133 of the Act, read with Rule 7 of the Companies (Accounts) Rules, 2014.
 - (e) On the basis of the written representations received from the directors of the Investor Company as on 31 March 2016 taken on record by the Board of Directors of the Investor Company and the report of the statutory auditors of its associated companies incorporated in India, none of the Directors of the Group companies incorporated in India is disqualified as on 31 March 2016 from being appointed as a Director of that company in terms of sub-section 2 of Section 164 of the Act.
 - (f) With respect to the adequacy of the internal financial controls over financial reporting of the Group and the operating effectiveness of such controls, refer to our separate report in "Annexure A"; and
 - (g) With respect to the other matters to be included in the Auditor's Report in accordance with Rule 11 of the Companies (Audit and Auditors) Rules, 2014, in our opinion and to the best of our information and according to the explanations given to us:
 - i. The consolidated financial statements disclose the Impact of pending litigations on the consolidated financial position of the Group. Refer Note 29 to the consolidated financial statements;
 - ii. The Group did not have any long term contracts including derivative contract for which there were any material foreseeable losses.
 - iii. There has been no delay in transferring amount, required to be transferred to the Investors Education Protection Fund.

Place : Ahmedabad
Date : 28 - 10 - 2016

For, J P SHAH & CO
CHARTERED ACCOUNTANTS
FRN : 109612W
(CA Nirav J. Shah)
Partner
Membership No. 107717



Annexure A to Auditors' Report

Report on the Internal Financial Controls under Clause (i) of Sub-section 3 of Section 143 of the Companies Act, 2013 ("the Act")

In conjunction with our audit of the consolidated financial statements of the Company as of and for the year ended 31 March 2016, we have audited the internal financial controls over financial reporting of Gujarat State Investments Limited ("the Investor Company") and its Associate companies which are companies incorporated in India, as of that date.

Management's Responsibility for Internal Financial Controls

The Respective Board of Directors of the Investor Company and its Associate companies, which are companies incorporated in India, are responsible for establishing and maintaining internal financial controls based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India ("ICAI"). These responsibilities include the design, implementation and maintenance of adequate internal financial controls that were operating effectively for ensuring the orderly and efficient conduct of its business, including adherence to company's policies, the safeguarding of its assets, the prevention and detection of frauds and errors, the accuracy and completeness of the accounting records, and the timely preparation of reliable financial information, as required under the Companies Act, 2013.

Auditors' Responsibility

Our responsibility is to express an opinion on the Company's internal financial controls over financial reporting based on our audit. We conducted our audit in accordance with the Guidance Note on Audit of Internal Financial Controls over Financial Reporting (the "Guidance Note") issued by ICAI and the Standards on Auditing, issued by ICAI and deemed to be prescribed under section 143(10) of the Companies Act, 2013, to the extent applicable to an audit of internal financial controls, both issued by the Institute of Chartered Accountants of India. Those Standards and the Guidance Note require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether adequate internal financial controls over financial reporting was established and maintained and if such controls operated effectively in all material respects. Our audit involves performing procedures to obtain audit evidence about the adequacy of the internal financial controls system over financial reporting and their operating effectiveness. Our audit of internal financial controls over financial reporting included obtaining an understanding of internal financial controls over financial reporting, assessing the risk that a material weakness exists, and testing and evaluating the design and operating effectiveness of internal control based on the assessed risk. The procedures selected depend on the auditor's judgment, including the assessment of the risks of material misstatement of the financial statements, whether due to fraud or error. We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion on the Company's internal financial controls system over financial reporting.

Meaning of Internal Financial Controls over Financial Reporting

A company's internal financial control over financial reporting is a process designed to provide reasonable assurance regarding the reliability of financial reporting and the preparation of financial statements for external purposes in accordance with generally accepted accounting principles. A company's internal financial control over financial reporting includes those policies and procedures that (1) pertain to the maintenance of records that, in reasonable detail, accurately and fairly reflect the transactions and dispositions of the assets of the company; (2) provide reasonable assurance that transactions are recorded as necessary to permit preparation of financial statements in accordance with generally accepted accounting principles, and that receipts and expenditures of the company are being made only in accordance with authorisations of management and directors of the company; and (3) provide reasonable assurance regarding prevention or timely detection of unauthorised acquisition, use, or disposition of the company's assets that could have a material effect on the financial statements.

**Inherent Limitations of Internal Financial Controls over Financial Reporting**

Because of the inherent limitations of internal financial controls over financial reporting, including the possibility of collusion or improper management override of controls, material misstatements due to error or fraud may occur and not be detected. Also, projections of any evaluation of the internal financial controls over financial reporting to future periods are subject to the risk that the internal financial control over financial reporting may become inadequate because of changes in conditions, or that the degree of compliance with the policies or procedures may deteriorate.

Opinion

In our opinion, the Investor Company and its associate companies, which are companies incorporated in India, have, in all material respects, an adequate internal financial controls system over financial reporting and such internal financial controls over financial reporting were operating effectively as at 31 March 2016, based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting issued by the ICAI.

Place : Ahmedabad
Date : 28 - 10 - 2016

For, **J P SHAH & CO**
CHARTERED ACCOUNTANTS
FRN : 109612W
(CA Nirav J. Shah)
Partner
Membership No. 107717



GUJARAT STATE INVESTMENTS LIMITED
BALANCE SHEET AS AT 31st MARCH 2016 (Consolidated) Amount in (Rs.)

	Note No.	As at 31-3-2016	As at 31-3-2015
I. EQUITY AND LIABILITIES			
(1) Shareholder's Funds			
(a) Share Capital	2	10427690700	10427690700
(b) Reserves and Surplus	3	28616909236	25630015631
Shareholder's Funds		39044599936	36057706331
(2) Share Application Money pending allotment		0	0
(3) Non-Current Liabilities			
(a) Long-Term Borrowings	4	8798500000	8250000000
(b) Long Term Provisions	5	829664	799881
Non-Current Liabilities		8799329664	8250799881
(4) Current Liabilities			
(a) Trade Payables		0	0
(b) Other Current Liabilities	6	1164930	467825
(c) Short Term Term Provisions	7	27382	23728
Current Liabilities		1192312	491553
Total		47845121913	44308997765
II. ASSETS			
(1) Non-Current Assets			
(a) Fixed Assets			
(i) Tangible assets	8	1088172	222354
(ii) Intangible assets		0	0
(b) Non-current investments	9	44157741847	41974675878
(c) Deferred tax assets (net)	10	366829	108793
(d) Long term loans and advances	11	39769638	89534306
Non-Current Assets		44198966486	42064541331
(2) Current Assets			
(a) Cash and Cash Equivalents	12	552461691	4922024
(b) Short-term loans and advances	13	2963093492	2133137969
(c) Other current assets	14	130600244	106396441
Current Assets		3646155427	2244456434
Total		47845121913	44308997765

Notes to Balance Sheet and Statement of Profit & Loss 1 to 33

As per our report attached

For **J. P. Shah & Co.**

Chartered Accountants

Firm registration number : 109612W

(CA Nirav J. Shah)

Partner

Membership No. : 107717

Place : Ahmedabad

Date : 28-10-2016

For and on behalf of board of directors of
Gujarat State Investments Limited

Managing Director | Director | Company Secretary | Chief Financial Officer

Place : Gandhinagar

Date : 28-10-2016


PROFIT & LOSS ACCOUNT FOR THE YEAR ENDED 31st MARCH 2016 (Consolidated)
 Amount in (Rs.)

	Note No	Year ended 31-3-2016	Year ended 31-3-2015
I Revenue :			
Revenue from operations	15	507316962	382049829
Other Income	16	11000900	240779169
Total Revenue		518317862	622828998
II Expenses			
Employee Benefits Expenses	17	3239362	3176302
Finance Costs	18	79886	0
Depreciation expenses	8	339572	119283
Other expenses	19	11564751	5397699
Total Expenses		15223571	8693284
III Profit before Tax		503094291	614135714
IV Tax Expense			
(a) Current tax		74751287	123146213
(b) Current tax expense related to prior years		322173	111080
(c) Deferred Tax		258036	143638
V Share in Profit of associates Companies		2558614739	828295745
V Profit for the year(III - IV)		2986893606	1319030527
VI Earnings Per Equity Share (F.V of Rs. 10 each)			
Basic (in Rs.)		2.86	1.26
Diluted (in Rs.)		2.86	1.26

Notes to Balance Sheet and Statement of Profit & Loss 1 to 33

As per our report attached

 For **J. P. Shah & Co.**

Chartered Accountants

Firm registration number : 109612W

(CA Nirav J. Shah)

Partner

Membership No. : 107717

Place : Ahmedabad

Date : 28-10-2016

 For and on behalf of board of directors of
 Gujarat State Investments Limited

Managing Director | Director | Company Secretary | Chief Financial Officer

Place : Gandhinagar

Date : 28-10-2016


CASH FLOW STATEMENT FOR THE YEAR ENDED ON 31st MARCH 2016 (Consolidated)
 Amount in (Rs.)

Particulars	2015-2016	2014-2015
A. CASH FLOW FROM OPERATING ACTIVITIES		
Net Profit Before Tax	503,094,291.00	614,135,713.52
Adjustments for :		
Provision for diminution in value of investments, credited to the statement of Profit & Loss Account	0.00	-1,060,936.00
Depreciation	339,572.00	119,283.00
Liabilities / Provisions no longer required		
Profit / Loss on sale of Assets	0.00	-497.70
Profit & Loss on sale of Investment	0.00	-239,717,735.24
Prior Period Adjustment		
Operating profit before working capital changes		
Adjustments for :		
Provision of Gratuity & Retirement benefits		
Operating profit before working capital changes	503,433,863.00	373,475,827.58
Movments in working Capital		
Decrease/increase in other current assets	-24,203,803.00	65,636,840.00
Other Non current assets		
Decease/increase in loan & Advances	-780,190,855.00	2,642,283,240.36
Decrease / Increase in Current Liability	730,542.00	-2,165,935.00
Cash used in operations	-803,664,116.00	2,705,754,145.36
Direct Tax Paid (Net of Refunds)	-75,073,460.00	-123,257,293.00
Dividend Received of Associates	400,741,970.00	479,213,713.00
Net Cash used in Operating Activities	25,438,257.00	3,435,186,392.94
B CASH FLOW FROM INVESTING ACTIVITES		
Proceeds from sale of Fixed Assets		21,200.00
Proceeds from sale of Investment		250,671,878.00
Purchase of Fixed Asset	-1,205,390.00	-263,161.00
Capital Expenditure on Purchase of Fixed Assets		0.00
Purchase of Investments	-25,193,200.00	-85,612,220.00
Net Cash from Investing Activities	-26,398,590.00	164,817,697.00
C CASH FLOW FROM FINANCING ACTIVITES		
Proceeds from unsecured loans	548,500,000.00	-3,685,839,000.00
Net Cash from Financing Activities	548,500,000.00	-3,685,839,000.00
Net Increase / (Decrease) in Cash And Cash Equivalents (A + B + C)	547,539,667.00	-85,834,910.06
Cash And Cash Equivalents - Opening Balance	4,922,023.94	90,756,934.00
Cash And Cash Equivalents - Closing Balance	552,461,690.94	4,922,023.94

Note:

1. Since Company is a Investment Company, Purchase & sale of investments have been considered as part of " Cash flow from Investing activites & interest / dividend earned from said investments during the year have been considered as part of " Cash flow from Operating activites"
2. Cash and cash equivalents represents cash and bank balances as per Balance Sheet, intercorporate deposits placed for three months or lower tenure.
3. Previous year's figures have been regrouped, wherever necessary.

As per our report attached
 For **J. P. Shah & Co.**
 Chartered Accountants
 Firm registration number : 109612W
 (CA Nirav J. Shah)
 Partner
 Membership No. : 107717
 Place : Ahmedabad
 Date : 28-10-2016

For and on behalf of board of directors of
 Gujarat State Investments Limited

Managing Director | Director | Company Secretary | Chief Financial Officer

Place : Gandhinagar
 Date : 28-10-2016



Form AOC-T

(Pursuant to first proviso to sub-section (3) of section 129 read with rule 5 of Companies (Accounts) Rules, 2014)

Statement containing salient features of the financial statement of subsidiaries/
associate companies/joint ventures

Part "A": Subsidiaries

Gujarat State Investments Limited does not have any subsidiary Part "A" is not required to be filled

Part "B": Associates and Joint Ventures

Statement pursuant to Section 129 (3) of the Companies Act, 2013 related to Associate Companies
and Joint Ventures

Amount in (Rs. Lakh)

		Name of associates		
		GSFC	GNFC	GACL
1	Latest audited Balance Sheet Date	31.03.2016	31.03.2016	31.03.2016
2	Date on which the Associate or Joint Venture was associate or acquired	21.09.1990	17.08.1991	05.09.2013
3	Number of Shares of Associate held by the company on the year end	15,07,99,905	3,32,27,546	1,53,29,373
	Amount of Investment in Associates	25237.96	13531.53	17331.53
	Extend of Holding %	37.84	21.39	20.87
4	Description of how there is significant influence	By way of Shareholding	By way of Shareholding	By way of Shareholding
5	Reason why the associate/joint venture is not consolidated	N.A.	N.A.	N.A.
6	Net worth attributable to shareholding as per latest audited Balance Sheet	4,73,805.00	57,052.26	2,26,393.38
7	Profit/Loss for the year			
	i. Considered in Consolidation	14654.31	6305.58	6394.74
	ii. Not Considered in Consolidation	-----	-----	-----

For **J. P. Shah & Co.**
Chartered Accountants
Firm registration number : 109612W
(CA Nirav J. Shah)
Partner
Membership No. : 107717
Place : Ahmedabad
Date : 28-10-2016

For and on behalf of board of directors of
Gujarat State Investments Limited

Managing Director | Director | Company Secretary | Chief Financial Officer

Place : Gandhinagar
Date : 28-10-2016



Notes forming part of financial statements for the year ended 31st March'2016

1. SIGNIFICANT ACCOUNTING POLICIES**GROUP INFORMATION**

Gujarat State Investment Limited (GSIL) is a wholly owned undertaking of Govt. of Gujarat incorporated on 29.11.1988 as a Public Limited Company domiciled and incorporated in India. The Consolidated Financial Statements relate to the Company, and Associates viz. Gujarat Narmada valley Fertilizers Company Limited (GNFC), Gujarat State Fertilizer & Chemicals Ltd. (GSFC) and Gujarat Alkalies & Chemicals Limited (GACL).

Summary of Investment in Associates

Sr. No.	Name of Associate	No. of Shares Held	% of Holding	Last Audited Balance Sheet date
1	Gujarat State Fertilizers & Chemicals Ltd.	15,07,99,905 (15,07,99,905)	37.84 % (37.84 %)	31.03.2016
2	Gujarat Narmada Valley Fertilizer Company Ltd.	3,32,27,546 (3,32,27,546)	21.39 % (21.39 %)	31.03.2016
3	Gujarat Alkalies & Chemicals Ltd.	1,53,29,373 (1,53,29,373)	20.87 % (20.87 %)	31.03.2016

"Due to change in Inter-say Share holding of promoters in BECL, the Company ceased to be associate for F.Y 2015-2016. However, as per revised pattern of Investments GSIL has invested to the extent 23.46% of Equity of BECL amounting to Rs.54.85 crore of additional investments made on 28-4-2016 i.e F.Y 2016-17."

1.1 Basis of preparation of Financial Statements

The Consolidated Financial Statements are prepared under the historical cost convention in accordance with the generally accepted accounting principles in India. The applicable mandatory Accounting Standards specified under Section 133 of the Companies Act, 2013 read with rule 7 of the Companies (Accounts) Rule, 2014 of India have been followed in preparation of these consolidated Financial Statements.

The Notes and Significant Accounting Policies to the Consolidated Financial Statements are intended to serve as a guide for better understanding of the Group's position. In this respect, the Group has disclosed such notes and policies, which represent the needed disclosure.

1.2 Principles of Consolidation

Significant Accounting policies and Notes to these Consolidated Financial Statements are intended to serve as a means of informative disclosures and a guide for better understanding of the consolidated position of the group. Recognizing this purpose, only such policies and notes from the individual financial statements have been disclosed which fairly represent the needed disclosures. Lack of homogeneity and other similar considerations made it desirable to exclude some of them, which in the opinion of the management, could be better viewed when referred from the individual Financial Statements.

The Consolidated Financial Statements are prepared on the following basis:

- The Financials Statement of the Associates companies' consolidation are drawn up to the same reporting date as of the Company i.e. year ended 31st March, 2016.
- The Consolidated Financial Statement include the share of Profit/Loss of the Associate which has been accounted as per the "Equity Method" and accordingly, the share of profit/loss of the associate has been added to / deducted from the cost of investments.
- The difference between the cost of investment in the Associates and the net assets at the time of acquisition of the shares in the Associate is recognized in the Consolidated Financial Statements as Goodwill or Capital Reserve, as the case may be.



1.3 Use of Estimates

The preparation of financial statements in conformity of Indian GAAP requires the management to make judgments, estimates & assumptions that affects the reported amounts of revenues, expenses, assets, liabilities and the disclosure of contingent liabilities, at the end of the reporting period. Although these estimates are based on the management's best knowledge of current events and actions.

Uncertainty about these assumptions and estimates could result in the outcomes requiring a material adjustment to the carrying amounts of assets or liabilities in future periods.

1.4 Income Recognition

Income from dividend is accounted as and when such dividend has been declared and company's right to received payment is established.

Interest income is recognized on a time proportion basis, taking into the account the amount outstanding and the rate applicable.

1.5 Fixed Assets

Fixed assets are stated at cost of acquisition less accumulated depreciation provided on written down value method.

Cost comprises the purchase price and any attributable cost of bringing the asset to its working condition for its intended use.

1.6 Depreciation

Depreciation on fixed assets is provided on written down value method as per the Useful life prescribed in Schedule II to the Companies Act, 2013.

1.7 Impairment of Fixed Assets

- a) Consideration is given during the period to determine whether there is any indication of impairment of the carrying amount of the Company's Fixed Assets. If any indication exists, an Asset's recoverable amount is estimated, an impairment loss is recognized whenever the carrying amount of an Asset exceeds recoverable amount.
- b) Reversal of impairment losses recognized in prior years is recorded when there is an indication that the impairment losses recognized for the asset no longer exist or have decreased.

1.8 Investments

Investments are long term and are stated at cost of acquisition.

Provision is made for diminution in the value of investment other than of temporary nature.

1.9 Employee Benefits

- i) Short-term employee benefits;
Short-term employment benefits are recognized as an expense at the undiscounted amount in the profit & loss account of the year in which the related service is rendered.
- ii) Post employment benefits;
 - a) Post employment benefits comprise of gratuity, leave encashment Post employment benefits are recognized as an expense in the profit and loss account for the year in which the employee has rendered services. The expense is recognized at the present value of the amount payable using actuarial valuation carried out as at the end of the year in accordance with the Accounting Standard As-15 on 'Employee Benefits' notified under Companies Accounting Standards Rules ,2006.
 - b) The company has setup a separate Provident Fund Trust. Contribution paid / payable for provident fund of eligible employees is recognized in the profit and loss account each year. The Company has an obligation to make good the short fall if any, between the return from the investment of the trust and the interest rate notified by the government.



Actuarial gains and losses in respect of post employment benefits are charged to the profit and loss account.

1.10 Taxation.

- a) Provision for Income Tax is made on the basis of taxable income for the current accounting year in accordance with the Income Tax Act, 1961 and Rules framed there under.
- b) Deferred tax asset / liability are recognized at the applicable rate of tax on the basis of timing differences between book profit and taxable income. Deferred tax assets are recognized only to the extent that there is reasonable certainty that sufficient future taxable income is available against which deferred tax assets can be realized. In situations where the company has carry forward tax losses all deferred tax assets are recognized only if there is virtual certainty supported by convincing evidence that they can be realized against future taxable profits.

1.11 Earning Per Share

The company reports basic and diluted earnings per share (EPS) in accordance with Accounting Standard 20 on Earnings Per Share. Basic EPS is computed by dividing the net profit or loss for the year by the weighted average number of equity shares outstanding during the year.

1.12 Provisions And Contingent Liabilities

Provisions

A provision is recognized when an enterprise has a present obligation as a result of past event ; it is probable that an out flow of resources will be required to settle the obligation ,in respect to its present value and are determined based on best estimate required to settle the obligation at the Balance Sheet date. These are reviewed at each Balance Sheet date and adjusted to reflect the current estimates.

Contingent liabilities, if any, are disclosed by way of note.

Contingent Assets are neither recognized nor disclosed in the Financial Statements.



NOTES FORMING PART OF FINANCIAL STATEMENTS

Amount in (Rs.)

Note No.	Particulars	As at 31-3-2016	As at 31-3-2015
Notes to Financial Statements			
2	Share Capital		
a	The company has two class of shares referred to as Equity shares & Preference shares. The details thereof are as under :		
	Authorised		
	285,00,00,000 Equity Shares of Rs. 10 each	28500000000	28500000000
	1,50,00,000 Preference Shares of Rs. 100 each	1500000000	1500000000
	Total	30000000000	30000000000
	Issued, Subscribed and Paid up		
	104,27,69,070 Equity Shares of Rs. 10 each	10427690700	10427690700
	Total	10427690700	10427690700
Held by:			
1. Governor of Gujarat (100 % Shareholding) (P.Y. : 100 % Shareholding)			
b	Reconciliation of number of shares outstanding :		
	Particulars	Equity Shares (in Nos.)	
	A Shares at the beginning of the year	1042769070	1042769070
	B Issued during the period	0	0
	C Less : Share bought back	0	0
	D Shares At the end of the year (A + B - C)	1042769070	1042769070
c	Rights of Equity Shareholders, Dividend and Repayment of Capital :		
i	All shares rank equally with regard to company's residual assets:		
ii	The holders of equity shares are entitled to receive dividends as declared from time to time and are entitled to one vote per share at the meeting of the company.		
d	The details of shareholders holding more than 5 % of Shares :		
	Name of the Shareholders	Equity Shares (in Nos.)	
	Governor of Gujarat (100 % Shareholding)	1042769070	1042769070



NOTES FORMING PART OF FINANCIAL STATEMENTS

Amount in (Rs.)

	As at 31-3-2016	As at 31-3-2015
3 Reserves & Surplus		
Surplus i.e. Balance in the Statement of Profit & Loss		
As per last Balance Sheet	25110015630	5025770337
Less : Depreciation on transition to Schedule II of the Companies Act, 2013 on tangible fixed assets with nil remaining useful life	0	4702
Addition : Profit for the year	0	18765219468
	2986893606	1319030527
Total (a)	28096909236	25110015630
Capital Redemption Reserve		
As per last Balance Sheet	520000000	520000000
Total (b)	520000000	520000000
Total Reserves & Surplus (a + b)	28616909236	25630015630
4 Long Term Borrowings - Unsecured		
Loan from State Government (GOG)	8798500000	8250000000
Total	8798500000	8250000000
5 Long Term Provisions		
(a) Provision for Employee Benefits :		
(i) Provision for gratuity	532737	476575
(ii) Provision for leave encashment	296927	257928
(ii) Provision for other employee benefits	0	65378
Total	829664	799881
Trade Payables		
Creditors for Expenses / Services if any	0	0
Total	0	0
There are no amounts due to the parties covered under Micro, Small and Medium Enterprises Development Act, 2006.		
6 Other Current Liabilities		
Other payables	1164930	467825
Total	1164930	467825
7 Short Term Provisions		
(i) Provision for Gratuity	15847	14469
(ii) Provision for Leave Encashment	11535	9259
Total	27382	23728



Gujarat State Investments Limited
Notes forming part of financial statements

8. Tangible Assets

Amount in Rs.

Particulars	Gross Block			Depreciation Block			Net Block	
	As at March 31, 2015	Additions during the Year	Sale/ Disposal during the year	As at March 31, 2016	For the Year	Adjustment As at March 31, 2016	Adjustment recorded against surplus balance in statement of Profit & Loss	As at March 31, 2016
Furniture & Fixtures	515,769.55	0.00	0.00	515,769.55	0.00	0.00	655.00	18,091.16
Vehicles	507,535.02	1,205,390.00	0.00	1,712,925.02	264,347.00	0.00	0.00	966,420.22
Office Equipment	158,226.00	0.00	0.00	158,226.00	16,888.00	0.00	4,047.00	56,368.78
Computer	317,003.00	0.00	0.00	317,003.00	58,337.00	0.00	0.00	47,291.69
Total	1,498,533.57	1,205,390.00	0.00	2,703,923.57	339,572.00	0.00	4,702.00	1,088,171.85
Previous Year	2,235,095.57	263,161.00	999,723.00	1,498,533.57	119,283.00	979,020.70	4,702.00	222,353.85
								103,880.15

No assets are under lease or are acquired due to business combinations and other adjustments

No assets have been written off on reduction of capital or revalued during the preceding five years as on March, 31, 2016



NOTES FORMING PART OF FINANCIAL STATEMENTS

Amount in (Rs.)

Note No.	Particulars	No. of Shares		Book Value Amount	
		As at 31-3-2016	As at 31-3-2015	As at 31-3-2016	As at 31-3-2015
9 Non-current investments					
	Long Term - Trade Investments (At cost) (No. of Equity Shares of face value of Rs. 10 each fully paid-up unless otherwise specified.)				
	(a) Quoted				
	(i) Equity Shares - Strategic investments				
	Investment in Associates (Refer Note No 26)				
	Gujarat Narmada Valley Fertilisers Co. Ltd.	33227546	33227546	5721056082	5090498082
	Gujarat State Fertilisers & Chemicals Co. Ltd. (F.V Rs.2)	150799905	150799905	18394950411	17261278753
	Gujarat Alkalies & Chemicals Ltd.	15329373	15329373	2766269628	2372626517
	Investment in Others				
	Gujarat Industries Power Co. Ltd .	352415	37500	26383825	1190625
	Torrent Power Ltd.	46871621	46871621	178859260	178859260
	Gujarat Leasing Financing Ltd.	1328125	1328125	71492209	71492209
	Total (i)			27159011414	24975945445
	(ii) Equity Shares - Non Strategic investments				
	Digjam Limited	1234744	1234744	188026969	188026969
	Atul Products Ltd.	130594	130594	14096129	14096129
	Battliboi & Co. Ltd. (F.V. Rs.5)	38895	38895	1025876	1025876
	G S L (India) Limited	157140	157140	1571400	1571400
	Gujarat State Financial Corporation	935600	935600	18712000	18712000
	Sun Pharmaceutical Industries Ltd. (F.V Rs.1)	505265	505265	9287287	9287287
	Bank of Baroda (F.V Rs. 2)	250000	250000	11012500	11012500
	Total (ii)			243732160	243732160
	Total (a) (i + ii)			27402743575	25219677606
	(b) Un Quoted				
	(i) Equity Shares - Non Strategic investments				
	Cama Hotels Ltd.	5340	5340	72700	72700
	Gujarat State Machine Tools Co. Ltd. (F. V Rs. 1)	1929050	1929050	20000	20000
	Gujarat State Trans Receivers Limited	12000	12000	1000	1000
	Total (i)			93700	93700
	(ii) Equity Shares - Strategic investments				
	Bhavnagar Energy Corporation Ltd.	143583900	143583900	1435839000	1435839000
	Gujarat State Petroleum Corporation Ltd.(F.V Rs. 1)	192592441	192592441	15599987726	15599987726
	Total (ii)			17035826726	17035826726
	Total (b) (i + ii)			17035920426	17035920426
	Total (a + b)			44438664001	42255598032
	Less : Provision for diminution in value of investments			280922154	280922154
	Total Book Value of investments			44157741847	41974675878
	Aggregate Market Value of Quoted investments			26474587353	25613464101



NOTES FORMING PART OF FINANCIAL STATEMENTS

Amount in (Rs.)

	As at 31-3-2016	As at 31-3-2015
10 Deferred Tax Assets In terms of the provisions of the Accounting Standard No. 22 " Accounting for tax on Income", notified by companies (Accounting Standards) Rule 2006 the company has started recognition of Deferred Tax. In compliance with the provision of the Accounting Standard and based on general prudence, the company has started recognizing the said DTA / DTL while preparing the Accounts for the current year. Deferred Tax Asset - Depreciation Accrued Expenses - Deductible on Payment Net Deferred Tax Asset	 70222 296606 366829	 28894 79899 108793
11 Long Term Loans and advances (a) Advance Income Tax { (net of provisions of Current Year Rs.7,83,75,361 /-) (Previous Year : Rs.12,31,46,213/-) (b) Other loans and advances (Bridge loan) Doubtful Less : Provision for other doubtful loans and advances	 39769638.00 2500000.00 2500000.00 39769638.00	 89534306.00 2500000.00 2500000.00 89534306.00
12 Cash & Cash Equivalents (a) Cash on hand (b) Balances with Banks : -In current accounts © Liquid deposits with GSFS Total	 11816.00 550406199.94 2043675.00 552461690.94	 7003.50 371345.44 4543675.00 4922023.94
13 Short-term loans and advances (a) Security Deposits Unsecured, considered good (b) Loans & advances to employees Secured, considered good (c) Prepaid expenses - Unsecured, considered good (d) Balances with government authorities (i) FBT Refund (ii) Income Tax Refund (e) Inter-corporate deposits unsecured, considered good Gujarat State Financial Services Ltd. Total	 1263215.00 2857.00 4026.00 0.00 2961823394.00 2963093492.00	 4000.00 2994.00 4026.00 746717.00 2132380232.00 2133137969.00
14 Other current assets (i) Interest accrued on investments Total	 130600244.00 130600244.00	 106396441.00 106396441.00



NOTES FORMING PART OF FINANCIAL STATEMENTS (Standalone)

Amount in (Rs.)

	As at 31-3-2016	As at 31-3-2015
15 Details of Revenue from operations		
(a) Income from Investments		
(i) Dividends	284749319.50	26093458.00
(ii) Interest on Investments	222567642.00	355956371.00
Total	507316961.50	382049829.00
16 Other Income		
(i) Adjustment to the carrying amount of long term investments- reversal of reduction in the carrying amount	0.00	1060935.58
(ii) Profit on sale of Investments	0.00	239717735.24
(iii) Profit on sale of Assets	0.00	497.70
(iv) Adjustment of shortfall payment on CPF trust	106066.00	0.00
(V) Interest on Income Tax refund	10894834.00	0.00
Total	11000900.00	240779168.52
17 Employee Benefits Expenses		
(i) Salaries	2791054.00	2718295.00
(ii) Contribution to provident and other funds	448308.00	458007.00
Total	3239362.00	3176302.00
18 Finance Costs		
(i) Interest Expenses on Borrowings	0.00	0.00
(ii) Interest expenses paid to I.T Department	79886.00	0.00
Total	79886.00	0.00
19 Other Expenses		
Power & fuel	110084.00	73425.00
Office rent	2297756.00	478500.00
Repairs & maintenance	0.00	10128.00
Insurance	5164.00	5456.00
Rates & Taxes	74403.00	80060.00
Communication	46413.00	26448.00
Travelling & Conveyance	136163.00	106237.00
Printing & Stationery	92175.50	69345.00
Legal & Professional	312657.00	96587.00
Payment to auditors	83874.00	98315.00
Stamp duty Expense	145600.00	0.00
service tax (RCM)	28157.00	0.00
Miscellaneous Expenses	829050.00	152542.00
Advertisement Expenses	0.00	1020.00
Prior Period items	0.00	0.00
Expenditure on Corporate Social Responsibility	7360404.00	4199636.00
registration fees	42850.00	0.00
Total	11564750.50	5397699.00



NOTES FORMING PART OF FINANCIAL STATEMENTS

20 This being an investment Company, the disclosure as per Para 4 (a) & (b) of Part II to the Schedule III of the Companies Act 2013, is not required to be made.

21 Depreciation is calculated on WDV method on the number of remaining useful life of the assets as per the provisions of Companies Act, 2013.

22 **Segment Reporting**

The Company operates in one business segment. In view of this, no separate disclosure is required under Accounting Standard AS – 17 "Segment Reporting".

23 **Related Party disclosure as required under the Accounting Standard "AS-18" on Related Party Disclosures, notified under Companies Accounting Standard Rules 2006 are given below :**

- The Company being state controlled enterprise, it is not required to disclose transaction with other State controlled enterprise Accounting Standards AS-18
- There is no transaction with Key management personnel

24 **Employee Benefits**

"The disclosures required under Accounting Standard 15 "Employees Benefit" notified in the Companies (Accounting Standards) Rules 2014 are given below:

(a) **Changes in present value of obligation (As on March 31, 2016) (Amount Rs.)**

Particulars	(Gratuity) March 31,2016	(Gratuity) March 31,2015	(Leave Encashment) March 31,2016	(Leave Encashment) March 31,2015
Present value of obligation as at beginning of the year	491044	3,48,355	267187	178928
Current Service Cost	46,847	22,206	22,711	20,034
Interest Cost	37,737	31,187	20,479	15,821
Actuarial Gain/ (Loss) on obligations	(27044)	89,296	(1915)	52,404
Benefits payable	0	0	0	0
Present Value of Obligation as at end of the year	548,584	4,91,044	308,462	267,187

(b) The gratuity plan is not funded. Hence particulars relating to plan assets are not given

(c) **The Amount Recognized in Balance Sheet**

(Amount in Rs)

Particulars	(Gratuity) March 31,2016	(Gratuity) March 31,2015	(Leave Encashment) March 31,2016	(Leave Encashment) March 31,2015
Present Value of obligation at the end of the Year	548584	4,91,044	3,08,462	2,67,187
Fair Value of Plan Assets as at the end of the Year	Nil	Nil	Nil	Nil
New Asset/ (Liability) recognized in Balance Sheet	548,584	491,044	308,462	2,67,187

(d) **Amount Recognized in the Profit and Loss Account**

(Amount in Rs)

Particulars	(Gratuity) March 31,2016	(Gratuity) March 31,2015	(Leave Encashment) March 31,2016	(Leave Encashment) March 31,2015
Current Service Cost	46,847	22,206	22,711	20,034
Interest Cost	37,737	31,187	20,479	15,821
Net Actuarial Gain/(Loss) recognized in the year 2015-16	(27044)	89,296	(1915)	52,404
Exp. Recognized in the statement of Profit & Loss	57,540	142,689	41,275	88,259

(e) **Assumptions**

Particulars	(Gratuity) March 31,2016	(Gratuity) March 31,2015	(Leave Encashment) March 31,2016	(Leave Encashment) March 31,2015
Mortality Table (LIC)	2006-08 (Ultimate)	1994-96 (Ultimate)	2006-08 (Ultimate)	1994-96 (Ultimate)
Discount Rate	7.6%	7.8%	7.6%	7.8%
Rate of Increase in Compensation levels	5.0%	5.0%	5.0%	5.0%
Rate of Returned Plan Assets	Not applicable	Not applicable	Not applicable	Not applicable



- 25 The estimates of rate of escalation in salary considered in actuarial valuation, take into account inflation, seniority, promotion and other relevant factors including supply and demand in the employment market. The relevant information is certified by the Actuary.

In terms of the guidance on implementing the As - 15 (Revised 2005) issued by the Institute of Chartered Accountants of India, the Employees Provident Fund setup by the Company is treated as defined benefit plan since the company has to meet the specified minimum rate of return, at the year end, no short fall have remained un-provided for. Accordingly an amount of Rs.40688/- (previous year Rs. 68095/- as expenses) is recognized as excess amount towards the Provision for Provident Fund Scheme of the Company and the same credited to Profit and Loss Account

26 **Cash and cash equivalents**

Cash and cash equivalents for the purposes of cash flow statement comprise cash at bank and in hand along with balance of Liquid deposit with GSFS.

27 **Investment in Equity Shares of Associates**

(Amount in Rs.)

	As at 31 st March 2016	As at 31 st March 2015
A Gujarat Narmada Valley Fertilisers Co. Ltd.	863877855	863877855
Add : Goodwill Arise on acquisition of Associates	489275320	489275320
Add : Share of Accumulated Reserves / Profits	3737344907	5049768318
Add : Current Year's Profit *	630558000	-1196127000
Less: Dividend Received during Current Year	0	116296411
Accumulated Cost of Investment	5721056082	5090498082
* Current Year's shares in Profit of Associates includes exceptional items of Rs. Nil (P.Y. 7058.70 lacs)	26882276121	
B Gujarat State Fertilisers & Chemicals Co. Ltd	3350206513	3350206513
Less: Capital Reserve arise on acquisition of associates	-826410341	-826410341
Add : Share of Accumulated Reserves / Profits	14737482581	13490197414
Add : Current Year's Profit	1465431449	1548884977
Less: Dividend Received during Current Year	331759791	301599810
Accumulated Cost of Investment	18394950411	17261278753
C Gujarat Alkalies & Chemicals Limited	3791494144	3791494144
Less: Capital Reserve arise on acquisition of associates	-2058341639	-2058341639
Add : Share of Accumulated Reserves / Profits	639474011.9	225253736.2
Add : Current Year's Profit	462625290	475537767.7
Less: Dividend Received during Current Year	68982179	61317492
Accumulated Cost of Investment	2766269628	2372626517



Additional Information as required by paragraph 2 of the General Instruction for Preparation of Consolidated Financial Statements to Schedule III to the Act.

Name of the Enterprise	Net Assets i.e. Total Assets minus Total Liabilities (FY 2015-16)		Share in Profit or Loss (FY 2015-16)		Net Assets i.e. Total Assets minus Total Liabilities (FY 2014-15)		Share in Profit or Loss (FY 2014-15)	
	As % of consolidated net assets	Rs.	As % of consolidated profit or	Rs.	As % of consolidated net	Rs.	As % of consolidated profit or	Rs.
Parent								
Gujarat State Investments Limited	31.15	12,162,323,816	14.34	428,278,867	31.43	1133,33,02,979	37.2	49,07,34,782
Associate								
Gujarat Narmda Valley Fertilisers Co. Ltd	14.65	5,72,10,56,082	21.11	63,05,58,000	14.12	509,04,98,082	(90.68)	(119,61,27,000)
Gujarat State Fertilisers & Chemicals Co. Ltd. (F.V Rs.2)	47.11	18,39,49,50,411	49.06	1,46,54,31,449	47.87	1726,12,78,753	117.42	154,88,84,977
Gujarat Alkalies & Chemicals Ltd.	7.08	2,76,62,69,628	15.49	46,26,25,290	6.58	237,26,26,517	36.05	47,55,37,767
Total	100.00	39,04,45,99,936	100.00	2,98,68,93,606	100.00	3605,77,06,331	100.00	131,90,30,527



29.	Auditor's Remuneration	(Amount in Rs.)	
	Particulars	2015-16	2014-15
	For Statutory Audit Fees	17421.00	16854.00
	For Tax Audit Fees	14518.00	14045.00
	For Internal Audit Fees	28625.00	28090.00
	For Epf Trust Audit Fees	2863.00	11236.00
	For Secretarial Audit Fees	23310.00	28090.00
30	Earnings per Share	2015-16	2014-15
	Profit/(Loss) for the period (Rs.)	2986893606	1319030527
	Weighted average no. of shares		
	(Face Value Rs. 10 each)	1042769070	1042769070
	Earnings per Share(Basic/Dilluted)		
	(Face Value Rs.10 each)	2.86	1.26
31	Contingent Liabiles		
	Claim of Income Tax for the Assessment Years 2001-02,2004-05, 2006-07,2010-2011,2011-12,2012-13,2013-14 against the company is disputed and not acknowledged as debt. The company is in appeal before appellate authorities, & as on date of preparing Financial Statements there are no outstanding demand against the Company.		
32	The previous year's figures have been regrouped / recast / reclassified / rearranged wherever necessary to correspond with the current year's classification / disclosure.		
33	As a promoter of Bhavnagar Energy Company Limited (BECL), the company has singed the Sponsors' Support Agreement (SSA) and as per the said Agreement, the promoters collectively shall not, till the final settlement date (being the date on which all obligations under the SSA have been irrevocably and unconditionally paid and discharged in full to the safisfaction of lenders), dispose-off their shareholdings which would result in dilution of their shareholding below 51%.		

As per our report attached
 For **J. P. Shah & Co.**
 Chartered Accountants
 Firm registration number : 109612W
 (CA Nirav J. Shah)
 Partner
 Membership No. : 107717
 Place : Ahmedabad
 Date : 28-10-2016

For and on behalf of board of directors of
 Gujarat State Investments Limited

Managing Director | Director | Company Secretary | Chief Financial Officer

Place : Gandhinagar
 Date : 28-10-2016



ગુજરાત રાજ્ય મૂડીરોકાણ લિમિટેડ

નિયામક મંડળ	શ્રી અનિલ મુકીમ, આઈ.એ.એસ. (તા. ૨૧-૦૮-૨૦૧૬ થી)	અધ્યક્ષ
	શ્રીમતી મોના ખંધાર, આઈ.એ.એસ. (તા. ૧૬-૦૭-૨૦૧૬ થી)	વહિવટી સંચાલક
	સુશ્રી આરતી કંવર, આઈ.એ.એસ. (તા. ૨૧-૦૮-૨૦૧૬ થી)	નિયામક
	સુશ્રી મમતા વર્મા, આઈ.એ.એસ. (તા. ૨૧-૦૬-૨૦૧૬ થી)	સ્વતંત્ર નિયામક
	શ્રી વસંત રાવલ (તા. ૨૧-૦૬-૨૦૧૬ થી)	સ્વતંત્ર નિયામક

નિવૃત્ત થયેલ

નિયામક મંડળ	ડૉ. જે. એન. સિંહ, આઈ.એ.એસ. (તા. ૦૩-૦૮-૨૦૧૬ સુધી)	અધ્યક્ષ
	શ્રી જે. પી. ગુપ્તા, આઈ.એ.એસ. (તા. ૨૧-૦૮-૨૦૧૬ સુધી)	નિયામક
	શ્રી કાયમસ મહેતા (તા. ૨૨-૦૩-૨૦૧૬ સુધી)	સ્વતંત્ર નિયામક
	સુશ્રી શીલ્પી થાપર (તા. ૨૨-૦૩-૨૦૧૬ સુધી)	સ્વતંત્ર નિયામક
	શ્રી ટી. નટરાજન, આઈ.એ.એસ. (તા. ૨૪-૦૬-૨૦૧૬ સુધી)	વહિવટી સંચાલક

મુખ્ય નાણાંકિય અધિકારી

શ્રી જી. એસ. પાઠક

કંપની સચિવ

શ્રી સંદિપ શાહ

ઑડિટર

મે. જે. પી. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
અમદાવાદ.

સેક્રેટરીયલ ઓડીટર

શ્રી હરીશ પી. જૈન
કંપની સેક્રેટરી
અમદાવાદ.

ઈન્ટરનલ ઓડિટર

મેસર્સ જે. એચ. મહેતા એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
અમદાવાદ.

બેંકર્સ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
બેંક ઓફ બરોડા

રજીસ્ટર્ડ ઓફિસ

એચ. કે. હાઉસ, છક્રો માળ,
આશ્રમ રોડ,
અમદાવાદ-૩૮૦ ૦૦૮.

CIN No. : U64990GJ1988SGC010307



નિયામક મંડળનો અહેવાલ

પ્રતિ,

સભાસદો જોગ,

ગુજરાત રાજ્ય મૂડીરોકાણ લિમિટેડ

આપના સંચાલકો, તા. ૩૧-૩-૨૦૧૬ ના રોજ પૂરા થતા વર્ષનો ૨૮મો વાર્ષિક અહેવાલ અને ઓડિટ થયેલા નાણાકિય સ્ટેટમેન્ટ્સ આપની સમક્ષ રજુ કરતાં આનંદ અનુભવે છે. જ્યાં જરૂરી છે ત્યાં કંપની અને તેની એસોસિએટ્સની એકત્રિત કામગીરીનો સંદર્ભ લેવામાં આવેલ છે.

૧. નાણાકિય કામગીરીની હાઈલાઈટ્સ :

સ્ટેન્ડઅલોન

સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન, કરવેરા પહેલાંનો નફો રૂ. ૮૦૩૮.૩૬ લાખ (ગત વર્ષે રૂ. ૧૦,૮૩૩.૪૮ લાખ), કરવેરા પછીનો ચોખ્ખો નફો રૂ. ૮૨૫૩.૮૭ લાખ (ગત વર્ષે રૂ. ૮,૬૮૮.૪૮ લાખ), ડિવિડન્ડની આવક રૂ. ૬૮૫૪.૮૧ લાખ (ગત વર્ષે રૂ. ૫૦૫૩.૦૭ લાખ) અને વ્યાજની આવક રૂ. ૨૨૨૫.૬૮ લાખ (ગત વર્ષે રૂ. ૩૫૫૮.૫૬ લાખ)ની હતી. જ્યારે કંપની ચલાવવાનો ખર્ચ રૂ. ૧૫૨.૨૪ લાખ થયેલ છે જેમાં ઘસારાના રૂ. ૩.૪૦ લાખનો સમાવેશ થયેલ છે. (ગત વર્ષે કંપની ચલાવવાનો ખર્ચ રૂ. ૮૬.૮૩ લાખ હતો જેમાં ઘસારાના રૂ. ૧.૧૮ લાખનો સમાવેશ થાય છે.) વર્ષના અંતે અનામત અને વધારા હેઠળ રૂ. ૮૨૫૩.૮૭ લાખ છે. (ગત વર્ષે આ રકમ રૂ. ૮૬૮૮.૪૮ લાખ હતી).

આવકવેરાની જવાબદારી રૂ. ૭૪૭.૫૧ લાખ (ગત વર્ષે આ જવાબદારી રૂ. ૧૨૩૧.૪૬ લાખ હતી.)

એકત્રિત

સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન, એકત્રિકરણના આધારે નાણાકિય કામગીરીની દૃષ્ટિએ કરવેરા પહેલાંનો નફો રૂ. ૫૦૩૦.૮૪ લાખ (ગત વર્ષે રૂ. ૬૧૪૧.૩૬ લાખ), અને વર્ષ દરમિયાન નફો રૂ. ૨૮,૮૩૨.૭૦ લાખ (ગત વર્ષે રૂ. ૧૩૧૮૦.૩૧ લાખ) છે.

ડિવિડન્ડ :

હાલની નફા વહેંચણીની નીતિને ધ્યાનમાં રાખીને, આપના સંચાલકોએ સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારનું ડિવિડન્ડ ન આપવાની ભલામણ કરી છે.

શેરમૂડી :

૩૧ માર્ચ ૨૦૧૬ ના રોજ, કંપનીની સત્તાવાર શેરમૂડીની સ્થિતિ રૂ. ૩,૦૦,૦૦૦ લાખ (રૂ. ૧૦ નો એક એવા ૨૮૫,૦૦,૦૦,૦૦૦ ઈક્વીટી. શેર અને રૂ. ૧૦૦ નો એક એવા ૧,૫૦,૦૦,૦૦૦ પ્રેફરન્સ શેર છે, અને ૩૧ માર્ચ ૨૦૧૬ ના રોજ વસુલ આવેલ શેરમૂડી રૂ. ૧,૦૪,૨૭૬.૮૦ લાખ છે. જેમાં ગત વર્ષના પ્રમાણમાં કોઈ ફેરફાર થયેલ નથી.

વર્ષ દરમિયાનની સંક્ષિપ્ત હાઈલાઈટ્સ :

વર્ષ દરમિયાન આપની કંપનીએ જી.આઈ.પી.સી.એલ. ના રૂ. ૩,૧૪,૮૧૫ ના ઈક્વીટી શેર ખરીદ્યા છે. વર્ષ દરમિયાન અમારી કંપનીને રાજ્ય સરકાર પાસેથી રૂ. ૫,૪૮૫ લાખની વ્યાજ મુક્ત લોન મળેલ છે.

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા તમારી કંપનીને તા. ૨૮-૪-૨૦૧૫થી અન-રજીસ્ટર્ડ કોર ઈન્વેસ્ટમેન્ટ કંપની તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે.

કંપનીની નાણાકિય સ્થિતિને સ્પર્શતી વચનબદ્ધતા અને અગત્યના ફેરફારો :

કંપનીના પૂરા થતા નાણાકિય વર્ષ કે જેને અનુસાંગિક નાણાકિય પત્રકો બનાવેલ છે અને સદર રિપોર્ટની તારીખ દરમિયાન, કંપનીની નાણાકિય સ્થિતિને અસર કરે તેવા કોઈ ફેરફારો ઉદ્ભવ્યા નથી.

સહયોગીઓ :

વર્ષની શરૂઆતમાં આપની કંપનીને ત્રણ સહયોગી કંપનીઓ હતી. અને ૩૧ માર્ચ, ૨૦૧૬ ના રોજ આપની કંપનીને ત્રણ સહયોગી કંપની હતી.

વર્ષ દરમિયાન આપના મંડળે આ સહયોગી કંપનીઓના અનુમોદિત વાર્ષિક હિસાબોની સમીક્ષા કરી હતી. કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૨૮ (૩) ની જોગવાઈ અનુસાર આપની કંપનીએ, કંપનીના એકત્રિત નાણાકિય પત્રકો



તૈયાર કર્યા છે જે આ અહેવાલનો એક ભાગ છે. વધુમાં આપણા સહયોગીઓનું, એઓસી-૧માં નિર્ધારિત નમુના મુજબનું પત્રક પણ એકત્રિત નાણાકિય પત્રકોના પરિશિષ્ટ તરીકે સામેલ રાખેલ છે.

ઉપરોક્ત દસ્તાવેજો આપની કંપનીની રજીસ્ટર્ડ ઓફિસે, કામકાજના સમય દરમિયાન, ચકાસણી માટે ઉપલબ્ધ રહેશે.

જોખમી પરિબલોનું સંચાલન, આંતરિક નિયંત્રણ પદ્ધતિ અને તેની પરિપૂર્ણતા :

જોખમી પરિબલોના સંચાલન હેઠળ, પ્રક્રિયા /કામગીરી અને તેનો નિભાવ, નાણાકિય અને અન્ય સંસ્થાકિય જોખમો જેવાં જોખમોનો અંદાજ કાઢી, તેનું મુલ્યાંકન કરી તેમાં અસરકારક ઘટાડો થાય તે માટે તેનું સતત મોનિટરીંગ કરવામાં આવે છે. જોખમમાં અન્ય બાબતો ઉપરાંત મુખ્ય ચિંતાજનક બાબતો અને તેના ઘટાડા માટેનો/નિયંત્રણ માટેનો એક્શન પ્લાન અને જોખમી પરિબલોનું નિયંત્રણ કરવા માટે કંપનીએ કરેલી ધ્યાનપ્રદ કાર્યવાહીની ઓડિટ કમિટિ દ્વારા અને નિયમક મંડળ દ્વારા સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે.

કંપની પાસે તેના ધંધાનો પ્રકાર અને કદને અનુરૂપ પુરતા પ્રમાણમાં આંતરિક નિયંત્રણ જોગવાઈ છે.

ઓડિટર્સ :

આપની કંપની એ કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૨(૪૫) મુજબ સરકારી કંપની હોવાથી ભારતના કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ, નવી દિલ્હી દ્વારા કાનૂની ઓડિટર તરીકે મેસર્સ જે. પી. શાહ એન્ડ કંપની, નોંધણી નંબર (૧૦૮૬૧૨W) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અમદાવાદની નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬ માટે નિમણૂક કરવામાં આવી છે. કમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલની કોમેન્ટ્સ અને સંચાલનનો જવાબ આ રિપોર્ટના ભાગ સ્વરૂપે એનેક્સરમાં જોડેલ છે.

સેક્રેટરીયલ ઓડિટ :

કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૨૦૪ અને તેની હેઠળ નિર્ધારિત નિયમોની જોગવાઈ અનુસાર, નાણાકિય વર્ષ ૨૦૧૫-૧૬ માટે કંપનીનું સેક્રેટરીયલ ઓડિટ કરવા માટે, શ્રી હરિશ પી. જૈન વ્યવસાયિક કંપની સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી છે. નાણાકિય વર્ષ ૨૦૧૫-૧૬ નો સેક્રેટરીયલ ઓડિટ રીપોર્ટ જે વાર્ષિક રિપોર્ટનો ભાગ છે. અને સદરહુ રિપોર્ટના પરિશિષ્ટ રૂપે દર્શાવેલ છે. સેક્રેટરીયલ ઓડિટ રિપોર્ટ પાસ કોઈ વિશિષ્ટતા અપવાદો કે પ્રતિકુળ ટિપ્પણીઓ (Remarks) ધરાવતો નથી.

વાર્ષિક રિટર્નનો સાર અને કંપનીના (નિમણૂક અને મહેનતાણું) નિયમો ૨૦૧૪ હેઠળની અન્ય જાહેરાતો:

કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૩૪(૩)(અ) અન્વયે કંપની અધિનિયમ (હિસાબી) નિયમો ૨૦૧૪ અને કંપનીના (મેનેજમેન્ટ એન્ડ એડમીનીસ્ટ્રેશન) નિયમો ૨૦૧૪ ના નિયમ ૧૨ને સાથે વાંચતા તેમાં દર્શાવેલ ફોર્મ નં. એમજીટી-૯ માં, વાર્ષિક અહેવાલનો સાર તૈયાર કરી આ રિપોર્ટના ભાગરૂપે પરિશિષ્ટમાં દર્શાવેલ છે.

સ્વતંત્ર સંચાલકો અંગેની જાહેરાત :

કંપનીઓના અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૪૯(૭) ની જોગવાઈ અનુસાર, સ્વતંત્ર સંચાલકોએ તેમના સ્વાતંત્ર્ય અંગેનું જાહેરનામું રજૂ કરેલ છે જેમાં જણાવાયું છે કે તેઓ પેટા કલમ ૬ માં દર્શાવેલ સ્વાતંત્ર્યના માપદંડનું પાલન કરે છે. કોર્પોરેટ સામાજિક જવાબદારીઓ (સીએસઆર) :

કંપનીઓના અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૩૫(૨) અને કંપનીઓના (કોર્પોરેટ સોસીયલ રિસ્પોન્સીબીલીટી પોલીસી) નિયમો ૨૦૧૪ ની જોગવાઈઓ અનુસાર સીએસઆર પ્રવૃત્તિઓ વિષેનો અહેવાલ આ સાથે પરિશિષ્ટ તરીકે સામેલ છે.

આપની કંપનીનું વર્ષ ૨૦૧૫-૧૬ માટેનું સીએસઆરમાં રોકાણ રૂ. ૭૩.૬૦ લાખ છે. જે કંપનીના છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ નફાના ૨ ટકા જેટલું છે.

ચાવીરૂપ સંચાલકિય વ્યક્તિઓ (KMP) :

અહેવાલની તારીખે કંપનીના સંચાલક મંડળમાં પાંચ સંચાલકો છે જેમાં એક વહિવટી સંચાલક અને બે સ્વતંત્ર સંચાલકો છે.

નિમણૂકો :

સરકારશ્રીના આદેશ નં. જનવ ૧૦-૨૦૧૧-૬૮૮૦૮૨-એ તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૬ થી શ્રી અનિલ મુકીમ આઈ.એ.એસ. (ડીઆઈએન ૦૨૮૪૨૦૬૪) ની તા. ૨૬-૯-૨૦૧૬થી આપની કંપનીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.



સરકારશ્રીના ઓર્ડર નં. જનવ/૧૦/૨૦૧૧/૬૮૮૦૮૨/અ તા. ૧૬મી મે ૨૦૧૫ થી શ્રી ટી. નટરાજન આઈ.એ.એસ. (ડીઆઈએન ૦૦૩૮૬૩૬૭)ની આપની કંપનીમાં વહિવટી સંચાલક નિમણૂક કરવામાં આવી છે જે સાથે સાથે કે.એમ.પી. તરીકે પણ નિમાયેલ છે.

કંપની અધિનિયમ, ૨૦૧૩ ની જોગવાઈ અનુસાર, આપના મંડળે ૨૧ જૂન ૨૦૧૬ થી શ્રી વસંત રાવલ (DIN ૦૩૦૮૭૮૮૧) નિવૃત્ત બેંક અધિકારીની, સ્વતંત્ર નિયામક તરીકે નિમણૂક કરી છે.

કંપની અધિનિયમ, ૨૦૧૩ ની જોગવાઈ અનુસાર આપના મંડળે ૨૧ જૂન ૨૦૧૬ થી સુશ્રી મમતા વર્મા આઈ.એ.એસ. (DIN ૦૧૮૫૪૩૧૫) ની સ્વતંત્ર નિયામક તરીકે નિમણૂક કરી છે.

સરકારી ઓર્ડર નં. જનવ/૧૦/૨૦૧૪/૫૫૭૨૧૨/ અ તા. ૧૫ જુલાઈ ૨૦૧૬ ના હુકમ થી શ્રી ટી.નટરાજન આઈ.એ.એસ.(DIN ૦૦૩૮૬૩૬) ની જગ્યાએ, શ્રીમતી મોના ખંધાર, આઈ.એ.એસ. (DIN ૦૬૮૦૩૦૧૫) ની આપની કંપનીના વહિવટી સંચાલક તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેની મુખ્ય સંચાલકિય વ્યક્તિ (Personnel) તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાત સરકારના તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૬ ના સરકારી ઠરાવ નં. જનવ.૨૦૦૮-૬૮૫૩૩૨-એ ને આધારે સુશ્રી આરતી કંવર, આઈએએસ (DIN ૦૩૫૩૫૮૭૩) ની તા. ૨૬-૮-૨૦૧૬ ના રોજથી આપની કંપનીના નિયામક તરીકે નિમણૂક કરવામાં આવી છે.

રાજીનામા અને/અથવા પદત્યાગ

તા. ૨૨ માર્ચ ૨૦૧૬ ના રોજ, તેમનો કાર્યકાળ પૂર્ણ થવાથી શ્રી કાયમસ મહેતા (DIN ૦૧૨૮૨૩૭૦) વ્યવસાયિક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપનીના સ્વતંત્ર નિયામક તરીકે પદેથી નિવૃત્ત થયા છે.

તા. ૨૨ માર્ચ ૨૦૧૬ ના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ થવાથી સી.એસ. શિલ્પી થાપર (DIN ૦૦૫૧૧૮૭૧) વ્યવસાયિક કંપની સેક્રેટરી કંપનીના સ્વતંત્ર નિયામક પદેથી નિવૃત્ત થયા છે.

શ્રી જી.સી. મુર્મુ, આઈએએસ (DIN ૦૦૧૮૩૪૧૪૨) ૪ મે ૨૦૧૫ ના રોજ અને સુશ્રી એસ. અપર્ણા, આઈએએસ તા. ૮ મે ૨૦૧૫ ના રોજથી વહિવટી નિયામક પદેથી રાજીનામું આપ્યું છે.

શ્રી ટી.નટરાજન આઈએએસ (DIN ૦૦૩૮૬૩૬૭) વહિવટી નિયામક પદેથી તા. ૨૪ જૂન ૨૦૧૬ થી રાજીનામું આપ્યું છે.

ડૉ. જે.એન. સિંહ, આઈ.એ.એસ. (DIN ૦૦૮૫૫૧૦૭) અધ્યક્ષ પદેથી તા. ૩ ઓગષ્ટ ૨૦૧૬ થી રાજીનામું આપ્યું છે.

શ્રી જે.પી. ગુપ્તા, આઈ.એ.એસ (DIN ૦૧૮૫૨૮૨૧) એ કંપનીના નિયામક પદેથી તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૬ ની અસરથી રાજીનામું આપ્યું છે.

ચાવીરૂપ સંચાલકિય વ્યક્તિઓ (KMP) :

કંપનીઓના અધિનિયમ ૨૦૧૩ ની જોગવાઈઓ અનુસાર કંપનીએ, શ્રીમતી મોના ખંધાર, આઈ.એ.એસ. (ડીઆઈએન ૦૬૮૦૩૦૧૫) વહિવટી નિયામક, શ્રી સંદિપ શાહ, કંપની સેક્રેટરી અને શ્રી જી.એસ. પાઠક, મુખ્ય નાણાંકિય અધિકારીની, ચાવીરૂપ સંચાલકિય વ્યક્તિઓ (KMP) તરીકે નિમણૂક કરી છે.

લોન, જામીનગીરી અને રોકાણોની વિગત :

કંપનીઓના અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૮૬ ની જોગવાઈઓ હેઠળ આવરી લેવાયેલ, કોઈ પણ લોન કંપનીએ મંજૂર કરેલ નથી કે કોઈ જામીનગીરી સામેલ નથી અને કોઈ રોકાણો પણ કરેલ નથી.

સંબંધિત વ્યક્તિઓ સાથેના વ્યવહારો :

કંપનીઓના અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૮૮ની જોગવાઈઓ લાગૂ પડતી હોય તેવા સંબંધિત વ્યક્તિઓ સાથેના કોઈ પણ વ્યવહારો, કંપનીએ નાણાંકિય વર્ષ દરમિયાન કર્યા નથી.

મંડળની મીટીંગો, મંડળની રચના અને ૨૦૧૫-૧૬ ના વર્ષ માટેનો નિયામકોની હાજરીનો રેકૉર્ડ :

સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન નિયામક મંડળની મીટીંગો ચાર વખત નીચે દર્શાવેલી તારીખે મળી હતી.

૨૦ જુલાઈ ૨૦૧૫,	૨૧ સપ્ટેમ્બર ૨૦૧૫,	૨૮ ડિસેમ્બર ૨૦૧૫ અને	૧૪ માર્ચ, ૨૦૧૬
----------------	--------------------	----------------------	----------------



કંપનીના અધિનીયમ ૨૦૧૩ મુજબ નિયામક મંડળની બે મીટીંગો વચ્ચેનો સમય ૧૨૦ દિવસથી વધુ ના હોવો જોઈએ.

ટેબલ-૧ : વર્ષ ૨૦૧૫-૧૬ માટેના મંડળની રચના અને નિયામકોની હાજરીનો રેકૉર્ડ :

નિયામકનું નામ	કક્ષા/હોદ્દો	બીજા નિયામક સાથેનો સંબંધ	હાજર રહેલી મીટીંગોની સંખ્યા	છેલ્લી વાર્ષિક સામાન્ય મીટીંગમાં (AGM) હાજર હતા
ડૉ. જે. એન. સિંહ IAS (DIN 00955107)^	અધ્યક્ષ	-	૪/૪	ના
શ્રી જે. પી. ગુપ્તા IAS (DIN 01952821)	બિન-કાર્યપાલક નિયામક	-	૩/૪	ના
પ્રો. કાયમસ મહેતા @ (DIN 01282370)	બિન-કાર્યપાલક (પ્રમોટર્સ) સ્વતંત્ર નિયામક	-	૪/૪	ના
સુશ્રી શિલ્પી થાપર @ (DIN 00511871)	સ્વતંત્ર મહિલા નિયામક -	-	૪/૪	ના
શ્રી ટી. નટરાજન IAS (DIN 00396367) #	વહિવટી નિયામક બિન-કાર્યપાલક (પ્રમોટર્સ)	-	૪/૪	ના

^ તા. ૩-૮-૨૦૧૬ના રોજ રાજીનામું આપેલ છે.

@ તા. ૨૨-૩-૨૦૧૬ના રોજથી નિયામક તરીકે અંત આવેલ છે.

તા. ૨૪-૬-૨૦૧૬ના રોજ રાજીનામું આપેલ છે.

કમિટિની મીટીંગો અને સભ્યપદ :

૧. ઓડિટ કમિટિ :

૨૦૧૫-૧૬ દરમિયાન ઓડિટ કમિટિ નીચે દર્શાવેલી ત્રણ તારીખોએ મળી હતી.

૨૦ જુલાઈ ૨૦૧૫, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૫, ૨૮ ડિસેમ્બર, ૨૦૧૫

હાલની ઓડિટ કમિટિનું ગઠન નીચે મુજબ છે.

૧. શ્રી અનિલ મુકીમ, IAS (DIN ૦૨૮૪૨૦૬૪) કમિટિ અધ્યક્ષ

૨. સુશ્રી મમતા વર્મા, IAS (DIN ૦૧૮૫૪૩૧૫) સભ્ય (સ્વતંત્ર નિયામક)

૩. શ્રી વસંત રાવલ, (DIN ૦૩૦૮૭૮૮૧) સભ્ય (સ્વતંત્ર નિયામક)

૨. કોર્પોરેટ સામાજિક જવાબદારી કમિટી (સી.એસ.આર. કમિટી)

વર્ષ દરમિયાન સી.એસ.આર. કમિટી તા. ૧૪ માર્ચ, ૨૦૧૬ ના રોજ મળી હતી.

હાલની સી.એસ.આર. કમિટીનું બંધારણ નીચે મુજબ છે.

૧. શ્રી અનિલ મુકીમ IAS (DIN ૦૨૮૪૨૦૬૪) કમિટી અધ્યક્ષ

૨. શ્રીમતી મોના ખંધાર IAS (DIN ૦૬૮૦૩૦૧૫) સભ્ય

૩. સુશ્રી મમતા વર્મા IAS (DIN ૦૧૮૫૪૩૧૫) સભ્ય (સ્વતંત્ર નિયામક)

૩. નિમણૂક અને વળતર કમિટી (એન એન્ડ આર કમિટી)

હાલની નિમણૂક અને વળતર કમિટીનું બંધારણ નીચે મુજબ છે.

૧. સુશ્રી મમતા વર્મા IAS (DIN ૦૧૮૫૪૩૧૫) કમિટી અધ્યક્ષ

૨. સુશ્રી આરતી કંવર IAS (DIN ૦૩૫૩૫૮૭૩) સભ્ય

૩. શ્રી વસંત રાવલ (DIN ૦૩૦૮૭૮૮૧) સભ્ય (સ્વતંત્ર નિયામક)



નિયામકોના જવાબદારી નિવેદન :

કંપનીઓના અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૩૪(પ) ની જોગવાઈઓ અનુસાર, નિયામકો જવાબદારી નિવેદન અન્વયે એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે,

(ક) વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે લાગુ પડતા “હિસાબી ધોરણો” નું પાલન કરવામાં આવેલ છે તેમજ મહત્વના ધોરણે ફેરફાર અંગે યોગ્ય ખુલાસા કરવામાં આવેલ છે.

(ખ) ૩૧ માર્ચ ૨૦૧૬ ના રોજ પુરા થતા નાણાંકીય વર્ષ માટે કંપની નફા-નુકશાનનો સાચો અને વ્યાજબી ખ્યાલ આપે એવી હિસાબી નીતિ અને તેની સાથે સુસંગત ચુકાદાઓ અને અંદાજો નિયામકશ્રીએ પસંદ કરેલ છે.

(ગ) કંપની ધારાની જોગવાઈઓ અન્વયે, કંપનીના માલ-મિલકતની યોગ્ય જાળવણી માટે અને ગુનાહિત છેતરપીંડી તેમજ અન્ય ક્ષતિઓ રોકવા અને શોધવા જરૂરી હિસાબી દસ્તાવેજોની જાળવણી માટે નિયામકોએ યોગ્ય અને જરૂરી દરકાર લીધેલ છે.

(ઘ) નિયામકશ્રીએ વાર્ષિક હિસાબો એકમ ચાલુ રહેવાનું છે તેમ સમજીને તૈયાર કરેલ છે.

(ચ) નિયામકોએ લાગુ પડતા કાયદાની જોગવાઈઓનું યોગ્ય પાલન થાય તે માટે એવી પદ્ધતિ વિકસાવી છે કે જે માત્ર પરિપૂર્ણ જ નથી પણ તેનું અસરકારક અમલીકરણ પણ શક્ય છે.

ડિપોઝીટ :

કંપની અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૭૩ ની જોગવાઈ અનુસાર આપની કંપનીએ સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન કોઈ ડિપોઝીટ સ્વીકારેલ કે રિન્યુ કરેલ નથી.

ઉર્જા ટેકનોલોજી સમાવેશ, વિદેશી હુડિયામણ કમાણી અને જાવકની જાળવણી :

મૂળભુત રીતે કંપની એક મૂડીરોકાણ કંપની હોવાથી, કંપની કોઈ ઔદ્યોગિક કે ઉત્પાદકતાલક્ષી પ્રવૃત્તિઓમાં સામેલ થયેલ નથી. જેથી કંપની અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૩૪ ની જોગવાઈઓ હેઠળ કંપનીને કોઈ ઊર્જાનો વપરાશ, ટેકનોલોજી એક્સપોઝન જેવી બાબતે કોઈ જાહેરાત કરવાની રહેતી નથી.

કંપનીની સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન કંપનીને ફોરેન એક્સચેન્જની આવક કે જાવક નથી.

આભાર દર્શન :

ગુજરાત સરકાર, નાણાંકીય સંસ્થાઓ અને બેંક, અન્ય ધંધાકીય સંગઠનો, પ્રમોટર્સ અને શેર હોલ્ડરો તેમજ કંપનીના કર્મચારીઓ તરફથી વખતો વખત મળેલ સહકાર અને સહાયની અમે આભાર સહ નોંધ લઈએ છીએ.

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૧૪-૦૨-૨૦૧૭

નિયામક મંડળ માટે અને તેમના વતી,

અનિલ મુકીમ - આઈ.એ.એસ.

(ડી.આઈ.એન. ૦૨૮૪૨૦૬૪)

અધ્યક્ષ



૩૧માર્ચ ૨૦૧૬ના રોજ પૂરા થતા વર્ષના ગુજરાત રાજ્ય મૂકીરોકાણ લિમિટેડના સ્વતંત્ર નાણાકીયપત્રકો ઉપર કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૪૩(દ)(બી) હેઠળ ભારતના નિયંત્રક અને મહાલેખાપરિક્ષક (CAG)ની ટિપ્પણીઓ અને તેના જવાબો.

ટિપ્પણીઓ	સંચાલક મંડળનો જવાબ
કંપની અધિનિયમ ૨૦૧૩ માં દર્શાવેલ માળખા મુજબ ગુજરાત સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ લિ.ના ૩૧મી માર્ચ ૨૦૧૬ ના રોજ પૂરા થતા વર્ષ માટેના નાણાંકિય પત્રકો બનાવવાની જવાબદારી સંચાલનની છે. કમ્પ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા કંપની અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૩૯(૫) મુજબ નીમવામાં આવેલા કાનુની ઓડિટર્સની જવાબદારીઓ આ નાણાંકિય પત્રકો ઉપર તેમનો અભિપ્રાય કંપની અધિનિયમની કલમ ૧૪૩(૧૦) નીચે દર્શાવેલ હિસાબી ધોરણો અને ઓડિટીંગ પર આધારિત સ્વતંત્ર ઓડિટને આધિન છે. તેમને તેમનો આ મુજબનો અહેવાલ તેમના તારીખ ૨૮ ઓક્ટોબર ૨૦૧૬ ના ઓડિટ રિપોર્ટમાં જણાવેલ છે. મેં કમ્પ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા વતી કંપની અધિનિયમની કલમ ૧૪૩ (દ) (એ) મુજબ ગુજરાત સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ લિ.ના તા. ૩૧મી માર્ચ ૨૦૧૬ ના રોજ પૂરા થતા વર્ષ માટેના નાણાંકીય પત્રકોનું પુરક ઓડિટ કરેલ છે. આ પુરક ઓડિટ સ્વતંત્રપણે, કાનુની ઓડિટરના વર્કીંગ પેપર તપાસ્યા વગર અને કંપનીના ઓડિટરો તેમજ કંપનીના માણસોની પ્રાથમિક પૂછપરછના આધારે અને પસંદ કરેલા એકાઉન્ટીંગ રેકૉર્ડની તપાસના આધારે કરવામાં આવેલ છે. મારા પૂરક (Supplementary) ઓડિટ દરમિયાન કરવામાં આવેલાં કેટલાંક અવલોકનો (Statement of Facts) કે જેનો ઉલ્લેખ, નાણાકીય પત્રકોની નોંધમાં કરવામાં આવ્યો છે જે અસરકારક બનાવવા માટે સંચાલક મંડળ દ્વારા કંપનીના નાણાકીય પત્રકોનું સમીક્ષા (Revision) કરવામાં આવ્યું છે. વધારામાં અધિનિયમની કલમ ૧૪૩(દ)(બી) હેઠળ, મારા ધ્યાનમાં આવેલી નીચેની વિશિષ્ટ બાબતો પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવા માંગું છું કે જે મારા દૃષ્ટિકોણથી નાણાકીય પત્રકો અને તેના આડિટ રિપોર્ટને વધુ સારી રીતે સમજવા માટે જરૂરી છે.	તથ્યોનું પત્રક
૧. ઓડિટર્સના અહેવાલ પર ટીપ્પણી : શેરહોલ્ડરોને વહેંચ્યા પહેલાના કંપનીના સુધારેલા હિસાબો ઉપરના ઓડિટરના રિપોર્ટ ઉપરની માર્ગદર્શક નોંધના કલમ ૩ પ્રમાણે “વહીવટી મંડળ ભલામણ કરે છે કે, જ્યારે સરવૈયાના અને/અથવા નફાનુકસાન ખાતાના રીવીઝનને કારણે જે તે સમયના આવા સુધારેલા હિસાબો ઉપર રિપોર્ટ આપવા માટે સભ્યોને જ્યારે બોલાવવામાં આવે ત્યારે તેમણે ખાતરી કરી લેવાની રહેશે કે, મૂળ	કાનુની ઓડિટરોના રિપોર્ટ ઉપર CAG ઓફિસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની સંચાલક મંડળે નોંધ લીધી છે. વળી કાનુની ઓડિટરો દ્વારા તા. ૨૬.૧૨.૨૦૧૬ના રોજ રજૂ કરેલા રિપોર્ટ ઉપર પણ પ્રતિક્રિયાત્મક નોંધ સંચાલક મંડળે લીધી છે જેનો સાર એ છે કે, “એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડમાં કોઈ મહત્વની ચૂક થઈ નથી કે ઓડિટની પ્રક્રિયામાં કોઈ ભૂલ થઈ નથી અને



હિસાબો અને રિપોર્ટની બધી કોપીઓ, ઓડિટરને પરત કરી દેવામાં આવેલ છે અને નિયામક મંડળે મંજૂર કરેલા અને સરકારી ઓડિટરોએ જેના પર અહેવાલ તૈયાર કર્યા છે તેવા સુધારેલા હિસાબો ઉપર ખાસ નોંધ તરીકે રજૂ કરેલ છે તે બાબતની પુરતી જાહેરાત કરવામાં આવે અને જો કાનુની ઓડિટર એ બાબતથી સંતુષ્ટ થાય કે એકાઉન્ટસ ઉપરની નોંધ વિશે કંપની દ્વારા કરાયેલી જાહેરાત (Disclosure) પૂરતી છે, તો પછી ઓડિટરો માટે રિપોર્ટમાં પાકુ સરવૈયુ અને નફા નુકશાન ખાતાની સમિક્ષા થયેલ છે તેવો સંદર્ભ ટાંકવો જરૂરી નથી. અને જો એકાઉન્ટસ ઉપરની નોંધ જો કોઈપણ પ્રકારના સમિક્ષા (Revision) નો ઉલ્લેખ ન કરતી હોય અથવા જો આવી કોઈ નોંધ હોય પણ કાનુની ઓડિટરોએ સંપૂર્ણપણે વિસ્તૃત નોંધ તરીકે ધ્યાનમાં ન લીધી હોય ત્યારે, કાનુની ઓડિટરોની એ ફરજ છે કે આ એકાઉન્ટસના રીવીઝનના તથ્યનો ઉલ્લેખ તેમના રિપોર્ટમાં કરે. વહીવટી મંડળ દ્વારા મંજૂર કરેલ સમિક્ષા થયેલ હિસાબોની તથ્યની જાણકારી, કંપની દ્વારા તેના સુધારેલા એકાઉન્ટમાં કરવામાં આવી નથી. જેથી ઉપરોક્ત માર્ગદર્શક નોંધના અનુસંધાને કાનુની ઓડિટરોએ એકાઉન્ટસના રીવીઝનના તથ્યનો ઉલ્લેખ તેમના રિપોર્ટમાં કરવો જોઈતો હતો.

કાનુની ઓડિટરનો અહેવાલ (Report) ઉપરોક્ત બાબત પૂરતો અપૂર્ણ છે.

ભારતના નિયંત્રક અને મહાલેખા પરિક્ષક વતી
સહી/-
(ગુરવિનસિંધુ)
મહાલેખાકાર (E & RSA) ગુજરાત

સ્થળ : અમદાવાદ
તારીખ : ૦૫/૦૧/૨૦૧૭

આ બાબતો નાણાકીય પત્રકોની સાચી અને વ્યાજબી મુલવણીને કોઈ રીતે અસરકર્તા નથી

ગુજરાત રાજ્ય મૂડી રોકાણ લિમિટેડ વતી
સહી /-
(અનિલ મુકીમ IAS)
DIN : ૦૨૮૪૨૦૬૪
અધ્યક્ષ

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૧૪/૦૨/૨૦૧૭



૩૧માર્ચ ૨૦૧૬ના રોજ પૂરા થતા વર્ષના ગુજરાત રાજ્ય મૂડીરોકાણ લિમિટેડના અલગથી એકત્રિત નાણાકીયપત્રકો ઉપર કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૪૩(દ)(બી) હેઠળ ભારતના નિયંત્રક અને મહાલેખાપરિક્ષક (CAG)ની ટિપ્પણીઓ અને તેના જવાબો.

ટિપ્પણીઓ	સંચાલક મંડળનો જવાબ
કંપની અધિનિયમ ૨૦૧૩ માં દર્શાવેલ માળખા મુજબ ગુજરાત સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ લિ.ના ૩૧મી માર્ચ ૨૦૧૬ ના રોજ પૂરા થતા વર્ષ માટેના નાણાકીય પત્રકો બનાવવાની જવાબદારી સંચાલનની છે. કમ્પ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા કંપની અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૩૯(૫) મુજબ નીમવામાં આવેલા કાનુની ઓડિટર્સની જવાબદારીઓ આ નાણાકીય પત્રકો ઉપર તેમનો અભિપ્રાય કંપની અધિનિયમની કલમ ૧૪૩(૧૦) નીચે દર્શાવેલ હિસાબી ધોરણો અને ઓડિટીંગ પર આધારિત સ્વતંત્ર ઓડિટને આધિન છે. તેમને તેમનો આ મુજબનો અહેવાલ તેમના તારીખ ૨૮ ઓક્ટોબર ૨૦૧૬ ના ઓડિટ રિપોર્ટમાં જણાવેલ છે. મેં કમ્પ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા વતી કંપની અધિનિયમની કલમ ૧૪૩ (દ) (એ) નીચે કલમ ૧૨૯ (૪) હેઠળ ૩૧ માર્ચ, ૨૦૧૬ના રોજ પૂરા થતાં વર્ષનું ગુજરાત રાજ્ય મૂડી રોકાણ લિમિટેડના એકત્રિત નાણાકીય પત્રકોનું પુરક ઓડિટ કરેલ છે. અમે ગુજરાત રાજ્ય મૂડી રોકાણ લિમિટેડના એકત્રિત પત્રકોનું પુરક ઓડિટ કરેલ છે. પરંતુ ગુજરાત રાજ્ય ખાતર અને કેમીકલ્સ લિમિટેડ, ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઈઝર્સ અને ગુજરાત આલ્કલીઝ કેમીકલ લિમિટેડનું પુરક ઓડિટ કરેલ નથી. પુરક ઓડિટ સ્વતંત્રપણે કાનુની ઓડિટરના વર્કિંગ પેપર તપાસ્યા વગર અને કંપનીના ઓડિટરો તેમજ માણસોની પ્રાથમિક પૂછપરછના આધારે અને પસંદ કરેલા એકાઉન્ટીંગ રેકૉર્ડની તપાસના આધારે કરવામાં આવેલ છે. મારા પૂરક (Supplementary) ઓડિટ દરમિયાન કરવામાં આવેલાં કેટલાંક અવલોકનો (Statement of Facts) કે જેનો ઉલ્લેખ, નાણાકીય પત્રકોની નોંધમાં કરવામાં આવ્યો છે ને અસરકારક બનાવવા માટે સંચાલક મંડળ દ્વારા કંપનીના એકત્રિત નાણાકીય પત્રકોનું સમીક્ષા (Revision) કરવામાં આવ્યું છે. વધારામાં અધિનિયમની કલમ ૧૪૩(દ)(બી) હેઠળ, મારા ધ્યાનમાં આવેલી નીચેની વિશિષ્ટ બાબતો પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવા માંગું છું કે જે મારા દૃષ્ટિકોણથી એકત્રિત નાણાકીય પત્રકો અને તેના આડિટ રિપોર્ટને વધુ સારી રીતે સમજવા માટે જરૂરી છે.	તથ્યોનું પત્રક
૧. ઓડિટર્સના અહેવાલ પર ટીપ્પણી : શેરહોલ્ડરોને વહેંચ્યા પહેલાના કંપનીના સુધારેલા હિસાબો ઉપરના ઓડિટરના રિપોર્ટ ઉપરની માર્ગદર્શક નોંધના કલમ ૩ પ્રમાણે “વહીવટી મંડળ ભલામણ કરે છે કે, જ્યારે સરવૈયાના અને/અથવા	ઓડિટરના રિપોર્ટ ઉપરની ટિપ્પણી સરકારી ઓડિટરોના રિપોર્ટ ઉપર CAG ઓફિસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની સંચાલક મંડળે નોંધ લીધી છે. વળી સરકારી ઓડિટરો દ્વારા તા.



નફાનુકસાન ખાતાના રીવીઝનને કારણે જે તે સમયના આવા સુધારેલા હિસાબો ઉપર રિપોર્ટ આપવા માટે સભ્યોને જ્યારે બોલાવવામાં આવે ત્યારે તેમણે ખાતરી કરી લેવાની રહેશે કે, મૂળ હિસાબો અને રિપોર્ટની બધી કોપીઓ, ઓડિટરને પરત કરી દેવામાં આવેલ છે અને નિયામક મંડળે મંજૂર કરેલા અને કાનુની ઓડિટરોએ જેના પર અહેવાલ તૈયાર કરી સુધારેલા હિસાબો ઉપર ખાસ નોંધ તરીકે રજૂ કરેલ છે તે બાબતની પુરતી જાહેરાત કરવામાં આવે અને જો કાનુની ઓડિટરો એ બાબતથી સંતુષ્ટ હોય કે એકાઉન્ટ્સ ઉપરની નોંધ વિશે કંપની દ્વારા કરાયેલી જાહેરાત (Disclosure) પૂરતી છે, તો પછી ઓડિટરો માટે રિપોર્ટમાં પાકુ સરવૈયુ અને નફા નુકસાન ખાતાની સમિક્ષા થયેલ છે તેવો સંદર્ભ ટાંકવો જરૂરી નથી. અને જો એકાઉન્ટ્સ ઉપરની નોંધનો જો કોઈ પ્રકારના સમિક્ષા (Revision) નો ઉલ્લેખ ન કરતી હોય અથવા આવી કોઈ નોંધ હોય પણ કાનુની ઓડિટરોએ અને વિસ્તૃત નોંધ તરીકે ધ્યાનમાં ન લીધી હોય ત્યારે, કાનુની ઓડિટરોની એ ફરજ છે કે આ એકાઉન્ટ્સના રીવીઝનનો ઉલ્લેખ તેમના રિપોર્ટમાં કરે.

વહીવટી મંડળ દ્વારા મંજૂર કરેલ સમિક્ષા થયેલ હિસાબોની તથ્યની જાણકારી, કંપની દ્વારા તેના સુધારેલા એકાઉન્ટમાં કરવામાં આવી નથી. જેથી ઉપરોક્ત માર્ગદર્શક નોંધના અનુસંધાને કાનુની ઓડિટરોએ એકાઉન્ટ્સના રીવીઝનનો ઉલ્લેખ તેમના રિપોર્ટમાં કરવો જોઈતો હતો. કાનુની ઓડિટરનો અહેવાલ (Report) ઉપરોક્ત બાબત પૂરતો અપૂર્ણ છે.

ભારતના નિયંત્રક અને મહાલેખા પરિક્ષક વતી
સહી/-
(ગુરવિનસિંધુ)

મહાલેખાકાર (E & RSA) ગુજરાત

સ્થળ : અમદાવાદ

તારીખ : ૦૫/૦૧/૨૦૧૭

રદ.૧૨.૨૦૧૬ના રોજ રજૂ કરેલા રિપોર્ટ ઉપર પણ પ્રતિક્રિયાત્મક નોંધ સંચાલક મંડળે લીધી છે જેનો સાર એ છે કે, “એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડમાં કોઈ મહત્ત્વની ચૂક થઈ નથી કે ઓડિટની પ્રક્રિયામાં કોઈ ભૂલ થઈ નથી અને આ બાબતો નાણાકીય પત્રકોની સાચી અને યોગ્ય મુલવણીને કોઈ રીતે અસરકર્તા નથી

ગુજરાત રાજ્ય મૂડી રોકાણ લિમિટેડ વતી

સહી/-

(અનિલ મુકીમ IAS)

DIN : ૦૨૮૪૨૦૬૪

અધ્યક્ષ

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૧૪/૦૨/૨૦૧૭



૩૧ માર્ચ, ૨૦૧૬ ના રોજ પૂરા થતા વર્ષ માટેનો કંપની સેક્રેટરીનો

ઑડિટ રિપોર્ટ (અહેવાલ)

ફોર્મ નં : એમઆર-૩

કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૨૦૪ (૧) અને કંપનીના

(એપોઈન્ટમેન્ટ અને રેમ્યુનરેશન પર્સોનેલ) નિયમો, ૨૦૧૪ ના નિયમ નં-૯ ના અનુસંધાને

સર્વે સભ્યશ્રીઓ જોગ,

ગુજરાત રાજ્ય મૂડીરોકાણ લિમિટેડ

અમે, ગુજરાત રાજ્ય મૂડીરોકાણ લિમિટેડ (હવેથી જેનો ઉલ્લેખ “કંપની” તરીકે કરવામાં આવશે.) નું સેક્રેટરીઅલ ઑડિટ, લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ અને કંપનીની કોર્પોરેટ પદ્ધતિ ને ધ્યાનમાં લઈને હાથ ધર્યું છે. કંપનીની કાર્યશૈલીનું મુલ્યાંકન કરવા માટે અમને પૂરી પાડવામાં આવેલ વ્યાજબી આધારોને લક્ષમાં લઈને અમે આ સેક્રેટરીઅલ ઑડિટ કરેલ છે. અને તે ઉપર અમારો અભિપ્રાય દર્શાવેલ છે.

ગુજરાત રાજ્ય મૂડીરોકાણ લિમિટેડનું સાહિત્ય, મીનીટ બુક્સ, પત્રકો અને ચલણો અને કંપનીએ જાળવેલ અન્ય રેકૉર્ડ તેમજ કંપની ધ્વારા તેના અધિકારીઓ, એજન્ટો અને અન્ય જવાબદાર પ્રતિનિધિઓ ધ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતીની ચકાસણીના આધારે અમે જણાવીએ છીએ કે અમારા અભિપ્રાય પ્રમાણે ૩૧ માર્ચ ૨૦૧૬ ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે, કંપનીએ નીચે દર્શાવેલ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરેલ છે. અને કંપનીમાં નીચે દર્શાવેલ વિગતો મુજબની કાર્યપદ્ધતિ અને સંચાલન અસ્તિત્વમાં છે.

(૧) કંપની અધિનિયમ, ૨૦૧૩ (ધી એક્ટ) અને તેનાં સંલગ્ન નિયમો.

(૨) કંપનીને લાગુ પડતો કાયદો નીચે મુજબ છે.

(એ) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯૩૪.

અમે નીચેના લાગુ પડતા કલોઝીસના પાલનની પણ ચકાસણી કરેલ છે.

(૧) ઈન્સ્ટીટ્યુટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયા દ્વારા નિર્ધારિત સેક્રેટરીઅલ સ્ટાન્ડર્ડ્સ જે કંપની ધારા ૨૦૧૩ હેઠળ લાગુ પડેલ છે.

સમીક્ષાના સમયગાળા દરમિયાન કંપનીએ ઉપર દર્શાવેલ કાયદાનું નિયમોનું અને અન્ય જોગવાઈઓનું સંપૂર્ણપણે પાલન કરેલ છે.

કંપની માટે, કંપની નિયમો (રૂલ્સ) ૨૦૧૪ હેઠળ નિર્દિષ્ટ ફોર્મ નં. એમ.આર.૩ માં દર્શાવેલ અન્ય જોગવાઈઓનું પાલન કરવું અનિવાર્ય નહોતું કારણકે સમીક્ષાના નાણાકીય વર્ષ દરમિયાન આવો કોઈ બનાવ બનવા પામેલ નથી.

અમે વધુમાં જણાવીએ છીએ કે,

(૧) કંપનીના સંચાલન મંડળનું ગઠન (રચના) કાર્યપાલક સંચાલક, બિન-કાર્યપાલક સંચાલક અને સ્વતંત્ર સંચાલકોના યોગ્ય સમન્વય (બેલેન્સ) થી કરવામાં આવ્યું છે. અને સમીક્ષાના સમયગાળા દરમિયાન, સંચાલક મંડળમાં કરવામાં આવેલા ફેરફારો કંપની અધિનિયમની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે.

(૨) બોર્ડની મીટીંગ, તેનો એજંડા (કાર્યસૂચિ) વગેરેની પૂરતી સૂચના દરેક સંચાલકને આપવામાં આવેલ છે. અને એજંડા ઉપરની વિસ્તૃત નોંધ પણ સાત દિવસ અગાઉ મોકલવામાં આવેલ છે અને મીટીંગમાં ઉદ્દેશ્યપૂર્ણ ચર્ચા વિચારણા થાય તે માટે એજંડાની વિગતો ઉપર વધારાની માહિતી પુરી પાડવાની અને જરૂરી ચોખવટ માટેની પદ્ધતિ પણ અસ્તિત્વમાં છે.

(૩) મોટાભાગના નિર્ણયોનો સ્વીકાર સર્વાનુમતે થયેલ છે. અને કોઈ નિર્ણય પર અસંમતી નોંધાયેલ નથી. જે ચેરમેન દ્વારા સહીથી પ્રમાણિત થયેલી બોર્ડની મિનિટ્સ પરથી માલુમ પડે છે.

અમે વધુમાં જણાવીએ છીએ કે, કંપની પાસે, લાગુ પડતા કાયદા, નિયમો માર્ગદર્શક સૂચનો વગેરેનું સંપૂર્ણપણે પાલન કરવા માટેની પૂરતી પદ્ધતિ અને પ્રક્રિયા અસ્તિત્વમાં છે.

હરિશ પી. જૈન એન્ડ એસોસીએટ્સ

પ્રેક્ટીસીંગ કંપની સેક્રેટરી

(હરિશ જૈન)

પ્રોપ્રાયટર

સ્થળ : અમદાવાદ

તારીખ : ૭-૬-૨૦૧૬

મેમ્બરશીપ નં. ૪૨૦૩ સી.પી. નં. ૪૧૦૦



ફોર્મ નં. એમજીટી-૯

વાર્ષિક રીટર્નનો સાર

૩૧-૩-૨૦૧૬ ના રોજ પુરા થતા નાણાંકીય વર્ષ માટે

કંપની અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૯૨(૩) અને કંપની (મેનેજમેન્ટ એન્ડ એડમીનીસ્ટ્રેશન) નિયમો ૨૦૧૪ ના નિયમ ૧૨(૧) અન્વયે

(૧) નોંધણી અને અન્ય વિગતો :

૧. સીઆઈએન	યુ ૬૪૮૮૦ જી જે ૧૮૮૮ એસજીસી ૦૧૦૩૦૭
૨. નોંધણીની તારીખ	૨૯-૧-૧૮૮૮
૩. કંપનીનું નામ	ગુજરાત રાજ્ય મૂડીરોકાણ લિમિટેડ
૪. કંપનીનો પ્રકાર/પેટાપ્રકાર	કંપની શેર દ્વારા મર્યાદિત/સરકારી કંપની
૫. રજીસ્ટર્ડ ઓફિસનું સરનામું અને સંપર્કની વિગતો	દફતો માળ, એચ.કે.આઈસ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૮. (ફો) ૦૭૯-૨૬૫૮૬૬૩૬, ૨૬૫૭૮૭૩૧ મેઈલ : infoatgsil@gmail.com
૬. કંપની નોંધાયેલ છે ? (Listed)	ના
૭. રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટનું નામ, સરનામું અને સંપર્કની વિગત જો હોય તો.	લાગુ પડતું નથી

(૨) કંપનીની મુખ્ય વ્યાપારીક પ્રવૃત્તિઓ (બધી વ્યાપારિક પ્રવૃત્તિઓ જો કંપનીના કુલ ટર્નઓવરના ૧૦ ટકા કે તેથી વધુ હોય તો જ દર્શાવવી)

ક્રમ નં.	મુખ્ય ઉત્પાદન/સેવાનું નામ અને વર્ણન	ઉત્પાદન/સેવાનો MIC કોડ	કંપનીના કુલ ટર્નઓવરના ટકા (%)
૧.	મૂડીરોકાણ પ્રવૃત્તિઓ	૬૪૩૦	-
૨.			
૩.			

(૩) શાસક, સહાયક કંપની અને એસોસિએટ કંપનીની વિગત :

ક્રમ નં.	કંપનીનું નામ અને સરનામું	સી.આઈએન/જીએલએન	હોલ્ડિંગ/સબસીડરી/એસોસિએટ	ધારણ કરેલ શેરની ટકાવારી	લાગુ પડતી કલમ
૧.	ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ	એલ/૮૮૮૮૮૮ જીજે ૧૮૬૨ પીએલસી ૦૦૧૧૨૧	એસોસિએટ	૩૭.૮૪	૨(દ) કલમ
૨.	ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ	એલ ૨૪૧૧૦ જીજે ૧૮૭૬ પીએલસી ૦૦૨૮૦૩	એસોસિએટ	૨૧.૩૮	૨(દ) કલમ
૩.	ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિ.	એલ ૨૪૧૧૦ જીજે ૧૮૭૩ પીએલસી ૦૦૨૨૪૭	એસોસિએટ	૨૦.૮૭	૨(દ) કલમ



(૪) શેર હોલ્ડીંગ પેટર્ન (કુલ ઈક્વિટીના ટકા રૂપે ઈક્વિટી શેર કેપીટલનું બ્રેકઅપ)

(i) કેટેગરીવાઈઝ શેર હોલ્ડીંગ :

શેરહોલ્ડરની કેટેગરી	વર્ષની શરૂઆતમાં ધારણ કરેલા શેરની સંખ્યા (૩૧ માર્ચ ૨૦૧૫)				વર્ષના અંતે ધારણ કરેલા શેરની સંખ્યા (૩૧ માર્ચ ૨૦૧૬)				વર્ષ દરમિયાનનો તફાવત ટકામાં
	ડીમેટ	ફીઝીકલ	ટોટલ	કુલ શેરની ટકા-વારી	ડીમેટ	ફીઝીકલ	ટોટલ	કુલ શેરની ટકા-વારી	
(એ) પ્રમોટર્સ									
(૧) ભારતીય									
(ક) વ્યક્તિ/એગ્રીગેટ									
(ખ) કેન્દ્ર સરકાર									
(ગ) રાજ્ય સરકાર		૧૦૪૨૭૬૮૦૦૦	૧૦૪૨૭૬૮૦૦૦	૧૦૦		૧૦૪૨૭૬૮૦૦૦	૧૦૪૨૭૬૮૦૦૦	૧૦૦	શૂન્ય
(ઘ) કોર્પોરેશન									
(ચ) બેંક્સ/નાણાકીય સંસ્થા									
(છ) અન્ય		૭૦	૭૦			૭૦	૭૦		
પ્રમોટર્સનું કુલ શેરહોલ્ડીંગ		૧૦૪૨૭૬૮૦૭૦	૧૦૪૨૭૬૮૦૭૦	૧૦૦		૧૦૪૨૭૬૮૦૭૦	૧૦૪૨૭૬૮૦૭૦	૧૦૦	શૂન્ય
(બી) પબ્લીક શેરહોલ્ડીંગ									
૧. સંસ્થાઓ									
(ક) મ્યુચ્યુઅલ ફંડ									
(ખ) બેંક્સ/નાણાકીય સંસ્થા									
(ગ) કેન્દ્ર સરકાર									
(ઘ) રાજ્ય સરકાર									
(ચ) કેપીટલ વેન્યર ફંડ્સ									
(છ) લીમા કંપનીઓ									
(જ) એફઆઈઆઈએસ									
(ઝ) વિદેશી કેપીટલ ફંડ									
(ટ) અન્ય									
(બી) (૧) નો પેટાસરવાળો									



શેરહોલ્ડરની કેટેગરી	વર્ષની શરૂઆતમાં ધારણ કરેલા શેરની સંખ્યા (૩૧ માર્ચ ૨૦૧૫)				વર્ષના અંતે ધારણ કરેલા શેરની સંખ્યા (૩૧ માર્ચ ૨૦૧૬)				વર્ષ દરમિયાનનો તફાવત ટકામાં
	ડીમેટ	ફીઝીકલ	કુલ	કુલ શેરની ટકા-વારી	ડીમેટ	ફીઝીકલ	કુલ	કુલ શેરની ટકા-વારી	
(૨) બિન સંસ્થાઓ									
(ક) બોડીઝ કોર્પોરેશન									
(i) ભારતીય									
(ii) વિદેશી									
(ખ) વ્યક્તિઓ									
(i) વ્યક્તિગત રૂ. ૧ લાખ સુધીની મુડીના શેર ધારકો									
(ii) રૂ. ૧ લાખથી વધુની મુડીના શેરધારકો									
(ગ) અન્ય									
બિન નિવાસી ભારતીય									
વિદેશી કોર્પોરેટ બોડીઝ									
વિદેશી રાષ્ટ્રો									
ક્લીયરીંગ મેમ્બર્સ									
ટ્રસ્ટ									
વિદેશી સંસ્થાઓ									
(બી) (૨) નો પેટા સરવાળો									
કુલ પબ્લીક શેર હોલ્ડીંગ (બી) = (બી) (૧) + (બી) (૨)									
(સી) જીડીઆરએસ અને એડીઆઈએસ દ્વારા ધારણ કરેલા શેર									
કુલ સરવાળો (એ + બી + સી)		૧૦૪૨૭૬૮૦૭૦	૧૦૪૨૭૬૮૦૭૦	૧૦૦		૧૦૪૨૭૬૮૦૭૦	૧૦૪૨૭૬૮૦૭૦	૧૦૦	શૂન્ય



(iii) પ્રમોટર્સનું શેરહોલ્ડીંગ :

ક્રમ નં.	શેરધારકનું નામ	વર્ષની શરૂઆતમાં શેરહોલ્ડીંગ			વર્ષના અંતે શેરહોલ્ડીંગ			વર્ષ દરમિયાનના શેરહોલ્ડીંગમાં ટકામાં વધઘટ
		શેરની સંખ્યા	કંપનીના કુલ શેરની ટકાવારી	ગીરો મૂકાયેલા કે બોજો ઊભો કરેલ શેરના ટકા	શેરની સંખ્યા	કંપનીના કુલ શેરની ટકાવારી	ગીરો મૂકાયેલા કે બોજો ઊભો કરેલ શેરના ટકા	
૧	માનનીય રાજ્યપાલશ્રી, ગુજરાત	૧૦૪૨૭૬૮૦૭૦	૧૦૦	શૂન્ય	૧૦૪૨૭૬૮૦૭૦	૧૦૦	શૂન્ય	શૂન્ય
૨								
૩								
૪								
૫								
૬								
૭								
૮								
૯								

(iii) પ્રમોટર્સના શેરહોલ્ડીંગમાં ફેરફાર (જણાવવો, જો ના હોય તો “કોઈ ફેરફાર નહીં”)

(iv) શ્રેષ્ઠ ૧૦ શેરધારકોની શેરહોલ્ડીંગના પ્રકાર (પેટની) (ડાયરેક્ટર, પ્રમોટર્સ અને જીડીઆરએસ અને એડીઆરએસ સિવાયના)

લાગૂ પડતું નથી

(v) નિયામક અને ચાવીરૂપ સંચાલકિય વ્યક્તિઓનું શેર હોલ્ડીંગ

ક્રમ નં.	પ્રત્યેક નિયામક અને મુખ્ય ધારણ કરેલ શેરહોલ્ડીંગ	વર્ષની શરૂઆતનું શેરહોલ્ડીંગ		વર્ષ દરમિયાન વધતી જતી શેરહોલ્ડીંગની સંખ્યા	
		શેરની સંખ્યા	કંપનીના કુલ શેરની ટકાવારી	શેરની સંખ્યા	કંપનીના કુલ શેરની ટકાવારી
	વર્ષની શરૂઆતમાં	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	વર્ષ દરમિયાન, તારીખ પ્રમાણે પ્રમોટર્સના શેરહોલ્ડીંગમાં થયેલો વધારો/ઘટાડો અને તેનાં કારણો (જેમકે ફાળવણી, ફેરબદલ/તબદીલી, બોનસ, સ્વીટ ઈક્વીટી વગેરે)	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	વર્ષના અંતે	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય



પ. દેવાદારો :

કંપનીના વ્યાજની બાકી આવકો/ઉદભવેલું પણ ચૂકવવા પાત્ર ન થયેલ દેવું નો સમાવેશ કંપનીના દેવાના બોજમાં થાય છે.

	સુરક્ષિત લોન ડિપોઝીટ સિવાય	બિન સુરક્ષિત લોન	ડીપોઝીટ	કુલ દેવાં
વર્ષની શરૂઆતનાં દેવાં	લાગુ પડતું નથી	૮,૨૫,૦૦,૦૦,૦૦૦	લાગુ પડતું નથી	૮,૨૫,૦૦,૦૦,૦૦૦
(i) મૂળ રકમ				
(ii) ચૂકવવા પાત્ર પણ નહીં ચૂકવેલ વ્યાજ				
(iii) ઉદભવેલ પણ નહીં મળેલ વ્યાજ				
કુલ (i+ii+iii)				
નાણાંકિય વર્ષ દરમિયાન દેવામાં				
વધારો		૫૪,૮૫,૦૦,૦૦૦		૫૪,૮૫,૦૦,૦૦૦
ઘટાડો				
ચોખ્ખો ફેરફાર		૫૪,૮૫,૦૦,૦૦૦		૫૪,૮૫,૦૦,૦૦૦
નાણાંકિય વર્ષના અંતે દેવું/બાકી				
(i) મુખ્ય રકમ		૮,૭૯,૮૫,૦૦,૦૦૦		૮,૭૯,૮૫,૦૦,૦૦૦
(ii) વ્યાજ ચૂકવવા પાત્ર પણ ન ચૂકવેલ				
(iii) વ્યાજ ઉદભવ્યું પણ ચૂકવવા પાત્ર ન થયેલ				
કુલ (i+ii+iii)		૮,૭૯,૮૫,૦૦,૦૦૦		૮,૭૯,૮૫,૦૦,૦૦૦

(vi) નિયામકો અને ચાવીરૂપ સંચાલકિય કર્મચારીઓના પગાર-ભથ્થાં

- (એ) વહિવટી નિયામક, પૂર્ણ સમય નિયામકો અને/અથવા મેનેજરના પગાર-ભથ્થાં :
વહિવટી નિયામક બિન કાર્યપાલક (નોન-એક્ઝીક્યુટીવ) હોદ્દો ધરાવતા હોવાથી તેમને પગાર-ભથ્થુ આપવાનું થતું નથી.
- (બી) અન્ય નિયામકોને ચૂકવવા પાત્ર મહેનતાણું
નોંધ : ગત નાણાંકિય વર્ષ સુધી કંપનીના બધા નિયામકોની નિમણૂક ગુજરાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવી હતી. તેઓ કંપનીના પ્રમોટર તરિકે બિન કાર્યપાલક (નોન એક્ઝીક્યુટીવ) હોદ્દો ધરાવતા હોવાથી કંપનીએ તેમને બેઠક - ફી ચૂકવેલ નથી.
- (બ) નિયામકોના પગાર ભથ્થા
સ્વતંત્ર નિયામકો

રકમ રૂપિયામાં

ક્રમ	ભથ્થાની વિગત	સ્વતંત્ર નિયામકો		
		શ્રી કાયમસ મહેતા	સુશ્રી શિલ્પી થાપર	કુલ
૧.	બોર્ડ / કમીટી મિટીંગ માં હાજર રહેવાની ફી	૧૩૫૦૦.૦૦	૧૨૦૦૦.૦૦	૨૫૫૦૦.૦૦
૨.	કમિશન	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૩.	અન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	કુલ ચુકવ્યા	૧૩૫૦૦.૦૦	૧૨૦૦૦.૦૦	૨૫૫૦૦.૦૦



(સી) વહિવટી નિયામક અને મેનેજર સિવાયના ચાવીરૂપ સંચાલકિય કર્મચારીઓને ચૂકવવા પાત્ર પગાર-ભથ્થાં :

રકમ રૂપિયામાં

ક્રમ નં.	પગાર-ભથ્થાની વિગત	મુખ્ય વહિવટી અધિકારી			
		સીઈઓ	સીએસ	સીએફઓ	કુલ
૧.	કુલ પગાર	લાગુ પડતું નથી	૫,૮૮,૨૫૫	૮,૦૧,૭૫૮	૧૪,૦૦,૦૧૪
	(એ) આવક-વેરા કાયદાની કલમ ૧૭(૧) ની જોગવાઈઓ પ્રમાણેનો પગાર	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	(બ) આવકવેરા કાયદો-૧૯૬૧ ની કલમ ૧૭(૨) હેઠળ મળવાપાત્ર ભથ્થાંની કિંમત	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	(સી) આવકવેરા કાયદો ૧૯૬૧ ની કલમ ૧૭(૩) હેઠળ પગારના બદલામાં ચુકવવા પાત્ર નફાની રકમ	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૨.	સ્ટોક ઓપ્શન	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૩.	સ્વીટ ઈક્વિટી	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૪.	કમીશન	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	- નફાના ટકા તરીકે	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	- અન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
૫.	અન્ય, વિગત આપો	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
	કુલ	શૂન્ય	૫,૮૮,૨૫૫	૮,૦૧,૭૫૮	૧૪,૦૦,૦૧૪

(vii) દંડ, સજા અને ગુનાની માંડવાળ :

કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ, ૨૦૧૫-૧૬ ના વર્ષ દરમિયાન દંડ, સજા કે ગુનાના કોઈ કેસ બન્યા નથી.



ગુજરાત રાજ્ય મૂડીરોકાણ લિમિટેડ

ફ્લો માળ, એચ.કે. હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૮
(સીઆઈએન :- યુદ્ધ૪૯૯૦૭૭૧૯૮૮ એસ.જી.સી. ૦૧૦૩૦૭)

સી.એસ.આર. પ્રવૃત્તિઓના વાર્ષિક અહેવાલનું સ્વરૂપ

૧. કંપનીની સીએસઆર નીતિ આ સાથેના સંલગ્નક પ્રમાણે
૨. સીએસઆર સમિતિનું હાલનું બંધારણ નીચે મુજબ છે.
 ૧. શ્રી અનિલ મુકીમ, આઈએએસ (ડીઆઈએન ૦૨૮૪૨૦૬૪) સમિતિના અધ્યક્ષ
 ૨. શ્રીમતી મોના ખંધાર, આઈએએસ (ડીઆઈએન ૦૬૮૦૩૦૧૫) સભ્ય શ્રી
 ૩. સુશ્રી મમતા વર્મા આઈએએસ (ડીઆઈએન ૦૧૮૫૪૩૧૫) સભ્ય શ્રી (સ્વતંત્ર સંચાલક)
૩. છેલ્લા ત્રણ નાણાંકિય વર્ષોનો કંપનીનો સરેરાશ ચોખ્ખો નફો રૂ. ૭૩,૬૦,૪૦૪.૦૨ છે.
૪. નિર્ધારિત / મુકરર કરેલ સીએસઆર ખર્ચ (ઉપરોક્ત ક્રમાંક ત્રણમાં દર્શાવેલી રકમના બે ટકા) રૂ. ૭૩,૬૦,૪૦૪ છે.
૫. નાણાંકિય વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન ખર્ચેલ સીએસઆરની વિગત
 - (એ) નાણાંકિય વર્ષ માટે ખર્ચ કરેલ કુલ રકમ : રૂ. ૭૩,૬૦,૪૦૪.૦૦
 - (બી) બિન-વપરાયેલી રકમ : નીલ / શૂન્ય
 - (સી) કંપની, સરકારી કંપની, હોવાથી રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ “મુખ્ય મંત્રી સ્વચ્છતા નિધિ-ગુજરાત રાજ્ય” ફંડમાં રૂ. ૫૧,૦૦,૦૦૦/- ફાળવેલ છે. અને રૂ. ૨૨,૬૦,૪૦૪/- ગુજરાત સીએસઆર ઓથોરીટીને સીએસઆર ફાળા તરીકે આપેલ છે.

કમિટિ/સમિતિ જાહેર કરે છે કે, કંપનીએ સીએસઆર ફાળા માટે જે રકમ ખર્ચી છે તે કંપનીના સીએસઆર હેતુઓ અને કંપનીની નીતિ સાથે સુસંગત છે.

સહી :

સહી :

વહીવટી સંચાલક

સીએસઆર કમિટિના અધ્યક્ષ



મંડળની સામાજિક જવાબદારીની નીતિ

ગુજરાત રાજ્ય મૂડીરોકાણ લિમિટેડ

પ્રસ્તાવના :-

ગુજરાત સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ (જીએસઆઈએલ) સંપૂર્ણ પણે ગુજરાત સરકારની માલિકીની કંપની છે. જેમાં કંપનીનું કદ અને કાર્યક્ષેત્ર ને અનુલક્ષીને પાંચ કર્મચારીઓ છે. અને સ્થાનિક વિસ્તારોમાં થયેલ સામાજિક વિકાસમાં કંપનીના ફાળા માટે સીધેસીધો સી.એસ.આર. અહેવાલને ગણવો તે વ્યાજબી / વ્યવહારુ ગણાશે નહિ.

સીએસઆર નીતિ :

કંપનીની કામગીરીમાં સામાન્યરીતે સમવિષ્ટ પ્રવૃત્તિઓ સિવાયની પ્રવૃત્તિઓ ઉપર કંપની તેનું ધ્યાન કેન્દ્રિત કરશે. કે જેની પસંદગી કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ દર્શાવેલ પ્રવૃત્તિઓ જેવી કે, સ્વાસ્થ્ય જાહેર સ્વચ્છતા અને સામાજિક સુખાકારી, બાળમૃત્યુના દરમાં ઘટાડો કરવા માટેના પ્રયત્નો, કેળવણી માટે પ્રોત્સાહન, સમાજ પ્રત્યે જવાબદારી ભર્યું વર્તન અને વ્યાવસાયિક કુશળતામાં વૃદ્ધિ કરે તેવી રોજગારી પૂરી પાડવા જેવી પ્રવૃત્તિઓમાંથી કરશે.

ગુજરાત સરકારે કંપની અધિનિયમ ૨૦૧૩ ને સીએસઆર નિયમો, ૨૦૧૪ ની સાથે વાંચતા તેમાં દર્શાવેલ ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખી, અલગ અલગ સીએસઆર પ્રવૃત્તિઓના અમલીકરણ માટે સીએસઆર ઓથોરીટીની રચના કરેલ છે.

દરેક નાણાંકિય વર્ષમાં, કંપની, અગાઉના નાણાંકિય વર્ષના ચોખ્ખા નફાના બે ટકાના નિર્ધારિત ધારાધોરણ (બેંચમાર્ક)ને ધ્યાનમાં રાખી, મંડળે નક્કી કરેલી/માન્ય કરેલી રકમ, સીએસઆર ઓથોરીટી / ટ્રસ્ટ / કે સોસાયટી કે જેની સ્થાપના ગુજરાત સરકારે કરી હોય તેની સામાજિક જવાબદારીઓ પરિપૂર્ણ કરવા માટે તબદિલ કરશે.

સ્થળ : ગાંધીનગર



સ્વતંત્ર ઓડિટરનો અહેવાલ

પ્રતિ,
સભ્યશ્રીઓ,
ગુજરાત રાજ્ય મૂડીરોકાણ લિમિટેડ

સ્ટેન્ડઅલોન નાણાંકીય પત્રકોનો રીપોર્ટ :

અમે ગુજરાત રાજ્ય મૂડીરોકાણ લિમિટેડ (કંપની)ના નાણાંકીય પત્રકોનું ઓડિટ કર્યું જેમાં ૩૧મી માર્ચ ૨૦૧૬ ના રોજનું સરવૈયું તેમજ તા. ૩૧મી માર્ચ ૨૦૧૬ના રોજ પૂરા થતા સમય માટેનું કંપનીનું નફા-નુકસાન ખાતું તેમજ તે દિવસે પૂરા થતા વર્ષ માટેની રોકડ લેવડ દેવડની નોંધ ચકાસી છે.

નાણાંકીય પત્રકો અંગે સંચાલકની જવાબદારી

કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૩૪(પ) અને કંપની (એકાઉન્ટ્સ) નિયમો ૨૦૧૪ ના નિયમ ૭ ની જોગવાઈઓ હેઠળકંપનીની સાચી અને પ્રમાણિક નાણાંકીય સ્થિતિ, નાણાંકીય કાર્યદક્ષતા અને રોકડની લેવડ દેવડનું સાચું ચિત્ર દર્શાવતા નાણાંકીય પત્રકો તૈયાર કરવાની જવાબદારી નિયામક મંડળની છે. આ ઉપરાંત સદરહુ જવાબદારીમાં કાયદા પ્રમાણે જરૂરી એકાઉન્ટીંગ હિસાબોની જાળવણી, કંપનીની અસ્ક્યામતોની જાળવણી, કોઈ પણ પ્રકારની, નાણાંકીય ગેરરીતિ શોધવી અને થતી રોકવી, યોગ્ય નાણાંકીય નીતીઓ લાગૂ કરવી, આંતરિક નાણાંકીય નિયંત્રણ માટે યોગ્ય ગોઠવણ કરવી અને તે માટે જરૂરી નિર્ણયો લેવા અને કંપની જે કોઈ નાણાંકીય પત્રકો બનાવે તે પ્રમાણિક, સાચાં અને અન્ય કોઈ ગેરરીતિથી બિન પ્રભાવિત હોય જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે.

ઓડિટરની જવાબદારી :

અમારી જવાબદારી ઓડિટરના આધારે આ સ્ટેન્ડઅલોન નાણાંકીય પત્રકો ઉપર અમારો અભિપ્રાય આપવાનો છે. અમે કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં લીધી છે. અમે એ બાબત પણ ધ્યાનમાં લીધી છે કે કાયદો અને તેની હેઠળ બનાવેલા નિયમોની જોગવાઈઓનું, ઓડિટ રિપોર્ટમાં પાલન કરવામાં આવ્યું છે. કંપની અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૧૦) હેઠળ દર્શાવેલ ઓડિટના ધોરણો મુજબ આ ઓડિટ કરેલ છે અને આ ધોરણોને આધારે અમે યોગ્ય ખાત્રી કરી લઈએ કે નાણાંકીય પત્રકો યોગ્ય નીતિમત્તા સાથે બનાવ્યાં છે અને વાસ્તવિક હકિકતનો કોઈ દોષ ધરાવતા નથી.

ઓડિટમાં એ વાતનો સમાવેશ થાય છે કે ચકાસણીના પ્રતીક રૂપે નાણાંકીય વિગતો તથા ખુલાસાઓનું સમર્થન તપાસવા, હિસાબો લખવાની પદ્ધતિ તથા વ્યવસ્થાપકો દ્વારા મહત્વના અંદાજોને આવકારવાનું તથા નાણાંકીય પત્રકોને સમગ્ર રીતે તપાસવાનો પણ સમાવેશ થાય છે. નાણાંકીય પત્રકોમાં જાહેરાત અને ખર્ચેલ રકમના ઓડિટ પુરાવા મેળવવા માટે કામગીરી કાર્યપદ્ધતિનો સમાવેશ ઓડિટમાં થાય છે. છેતરપીંડિઓ અને ભુલને કારણે નાણાંકીય પત્રકોના મટીરીયલ ગેરનિવેદનોનું જોખમોનું મૂલ્યાંકન સહિત ઓડિટરના ચુકાદાઓ ઉપર આધારિત પ્રક્રિયા છે. આવું જોખમ મૂલ્યાંકન કરતી વખતે ઓડિટર અમુક સંજોગોમાં જે યોગ્ય ઓડિટ પદ્ધતિઓ અમલમાં મુકેલ છે. અને જે કંપનીના નાણાંકીય પત્રકો તૈયાર કરતી વખતે સાચી અને વ્યાજબી પરિસ્થિતિ રજૂ કરે છે. તેવી આંતરિક નાણાંકીય અંકુશની પદ્ધતિ ધ્યાને લે છે. પરંતુ પુરતો આંતરિક નાણાંકીય અંકુશ ઉપર પોતાનો અભિપ્રાય આપવા માટે ઉપયોગમાં લેવાતો નથી. કંપનીના નિયામકો તેમજ નાણાંકીય પત્રકોની વ્યાજબીપણા ઓલઓવર રજૂઆતના મૂલ્યાંકન અને એકાઉન્ટીંગ નીતિ પ્રમાણે વપરાતા યોગ્યતા મૂલ્યાંકનનો ઓડિટમાં સમાવેશ થાય છે.

અમે માનીએ છીએ કે અમે ઓડિટનું અનુસંધાને જે કાંઈ પુરાવા મેળવ્યા છે તે ઓડિટ અંગેનો અમારો અભિપ્રાય આપવા માટે યોગ્ય અને પૂરતા છે.

અમારો મત :

ઉપરોક્ત નોંધને આધિન અને અમને પૂરી પાડવામાં આવેલી માહિતી અને ખુલાસાઓને આધારે અમે એ અભિપ્રાય આપીએ છીએ કે તા. ૩૧મી માર્ચ ૨૦૧૬ ના રોજનું પાકું સરવૈયું, નફા-નુકસાન ખાતું અને રોકડની આવક-જાવકના હિસાબો, ભારતમાં સામાન્ય રીતે માન્ય હિસાબો સિદ્ધાંતો મુજબ સાચી અને પૂરી માહિતી આપે છે.



અન્ય કાનૂની અને નિયંત્રણકારી જરૂરિયાતો પર અહેવાલ :

૧. કંપની અધિનિયમની કલમ ૧૪૩(૧૧) હેઠળ કેન્દ્ર સરકારના કંપનીના (ઓડિટર રિપોર્ટ) હુકમ ૨૦૧૬ ની જોગવાઈના ફકરા નં. ૩ અને ૪ માં દર્શાવેલ માહિતી અને અનુસૂચિમાં દર્શાવેલ અમારા અભિપ્રાયને આધીન અમે સામેલ પત્રકોમાં અમારો રિપોર્ટ આપીએ છીએ.
૨. અધિનિયમની કલમ ૧૪૩(૩) ની જરૂરિયાત મુજબ અમે રિપોર્ટ કરીએ છીએ કે
 - (અ) અમે અમારી શ્રેષ્ઠ જાણકારી અને માન્યતા મુજબ ઓડિટના હેતુ માટે જરૂરી હોય તેવી તમામ માહિતી અને ખુલાસા મેળવ્યા છે.
 - (બ) અમારા મંતવ્યો મુજબ, ચોપડાઓની અમે કરેલી તપાસ પરથી જણાય છે કે કાયદા દ્વારા જરૂરી હોય તેવા હિસાબના ચોપડા કંપનીએ રાખ્યા છે.
 - (ક) પાકુ સરવૈયું, નફા-નુકશાન ખાતુ તેમજ રોકડ લેવડ-દેવડની નોંધ જેના ઉપર અમે રિપોર્ટ આપ્યો છે તે હિસાબી ચોપડા સાથે મળી રહે છે.
 - (ડ) અમારા મત મુજબ, અધિનિયમની કલમ ૧૩૩ અને કંપનીના (એકાઉન્ટ્સ) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૭ ને સાથે વાંચતા તેમાં દર્શાવેલાં એકાઉન્ટીંગ ધારાધોરણો સાથે કંપનીના ઉપરોક્ત નાણાંકિય પત્રકો મળી રહે છે.
 - (ઈ) GSIL સરકારી કંપની હોવાથી, કંપની અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૬૪ (૨) લાગૂ પડતી નથી.
 - (એફ) કંપનીના નાણાંકિય રીપોર્ટીંગ ઉપર આંતરિક નાણાંકિય નિયંત્રણ પરિપૂર્ણ હોવા અંગે અને આ નિયંત્રણની કાર્યકારી અસરો ચકાસવા માટે પરિશિષ્ટ 'બ' માં દર્શાવેલ અલગ રિપોર્ટ જોવો.
 - (જી) કંપનીના (ઓડીટ અને ઓડીટર્સ) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૧૧ ની જોગવાઈ હેઠળના ઓડીટર્સ રીપોર્ટમાં સમાવવા જોગ અન્ય બાબતો અન્વયે, અમારા અભિપ્રાય મુજબ અને અમને પુરી પાડવામાં આવેલી માહિતી અને સમજૂતી ખુલાસા પ્રમાણેની છે.
 - (૧) બાકી રહેલી કાયદાકીય બાબતો (Litigations) ની કંપનીની નાણાંકિય સ્થિતિ ઉપર શી અસર થશે તે બાબત કંપનીએ તેના નાણાંકિય સ્ટેટમેન્ટ્સમાં દર્શાવેલ છે.
 - (૨) કંપની પાસે એવા કોઈ લાંબા ગાળાના કરારો નથી કે જેને લીધે કંપનીને નિશ્ચિત પ્રકારનું નુકશાન થાય.
 - (૩) કંપની એક સરકારી કંપની અને ૧૦૦% સરકારશ્રીની માલિકી ધરાવતી હોવાથી, આ કલમ લાગૂ પડતી નથી. અને કંપનીએ કોઈ ડિવિડન્ડ જાહેર નહિ કરેલ હોવાથી, “ઈન્વેસ્ટર્સ” એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ માં કોઈ રકમ તબદિલ કરવામાં કંપની દ્વારા કોઈ વિલંબ થયેલ નથી.
૩. કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૪૩(૫) ની જોગવાઈઓ અનુસાર, ઓડીટ રીપોર્ટના આ સાથે રાખેલ એનેક્સર-૨ ના ભાગ તરીકે કંપની દ્વારા ૨૦૧૩ની કલમ ૧૪૩(૫) ની જોગવાઈ અનુસાર આ સાથે જરૂરી માર્ગદર્શનો/પેટા માર્ગદર્શનોની પૂર્તતા સામેલ છે.

સ્થળ : અમદાવાદ
તારીખ : ૨૮-૧૦-૨૦૧૬

જે. પી. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વતી,
એફ.આર.એન. : ૧૦૯૬૧૨W
(સી.એ. નિરવ જે. શાહ)
ભાગીદાર
મેમ્બરશીપ નં. ૧૦૭૭૧૭



સ્વતંત્ર ઓડિટરના રિપોર્ટની અનુસૂચિ-અ

(આ તારીખના અમારા રિપોર્ટના ફકરા નં. ૧ ના અનુસંધાને)

૩૧મી માર્ચ ૨૦૧૬ ના રોજ પુરા થતા વર્ષના નાણાકિય પત્રકો ઉપર કંપનીના સભ્યોને લખેલ અમારા સ્વતંત્ર ઓડિટર્સ રિપોર્ટનો આ અનુસૂચિ એક ભાગ છે

- (૧) (અ) કંપનીએ તા. ૩૧-૩-૨૦૧૬ સુધીનો સ્થાઈ મિલકતોનો વિગતવાર જથ્થો અને પરિસ્થિતિ સહિત પૂરેપૂરી માહિતી દર્શાવતા યોગ્ય દસ્તાવેજો જાળવેલ છે.
- (બ) અમને આપવામાં આવેલી માહિતી અને ખુલાસાઓ મુજબ સંચાલકોએ બધી અસ્કયામતોની વર્ષ દરમિયાન ચકાસણી કરેલ છે. સંચાલકો દ્વારા અસ્કયામતોની નિયમિત ચકાસણી થઈ શકે તે માટે યોગ્ય નિયમો બનાવેલા છે. અમારા મત મુજબ કંપનીના ધંધાના વ્યાપ અનુસાર અને કંપનીની અસ્કયામતોના વાસ્તવિક જથ્થા અને ચોપડામાં કરવામાં આવેલ નોંધની ચકાસણી કરતાં કોઈ જ તફાવત ધ્યાને આવેલ નથી.
- (ક) અમને પુરી પાડવામાં આવેલી માહિતી અને ખુલાસા સમજૂતી પ્રમાણે અને અમે કરેલ કંપનીના હિસાબોની તપાસણીના આધારે કંપનીની અસ્થાયી અસ્કયામતોનું શિર્ષક ખત (માલીકી બાબતનો કાયદેસર હક) કંપનીના નામે જ છે.
- (૨) કંપની ઈન્વેન્ટરીમાં ડીલ કરતી નથી જેથી આ અંગેની જોગવાઈ કંપનીને લાગુ પડતી નથી.
- (૩) કંપનીએ, કંપની અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૮૯ મુજબ નિભાવેલ પત્રકમાં, કોઈ નોંધાયેલ સંસ્થાઓ, કંપની કે અન્ય પેઢીને કોઈ પણ જાતની લોન આપી નથી. આથી કલમ ૩ (iii) (એ થી સી) ની જોગવાઈ કંપનીને લાગુ પડતી નથી.
- (૪) અમારા મંતવ્ય પ્રમાણે અને અમને આપવામાં આવેલ માહિતી અને ખુલાસાઓના આધારે એવું લાગે છે કે સ્થાઈ લોન, રોકાણો અને ગેરંટી અને જામીનગીરી બાબતમાં કંપનીધારાની કલમ ૧૮૫ અને ૧૮૬ ની જોગવાઈઓનું પાલન કરેલ છે.
- (૫) કંપનીએ જનતા પાસેથી કોઈ થાપણો સ્વિકારી નથી વળી ભારતીય રિઝર્વ બેંક ધ્વારા કરાયેલ દિશા સૂચનો અને કંપનીના (Acceptance of Deposit) નિયમો ૨૦૧૫ ની જોગવાઈઓ કે કાયદાની કલમ ૭૩ થી ૭૬ ની જોગવાઈઓ અનુસાર જનતા (પબ્લીક) પાસેથી થાપણો સ્વીકારવાની બાબત લાગૂ પડતી નથી.
- (૬) સેન્ટ્રલ ગવર્નમેન્ટે કંપની અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૪૮ (૧) મુજબ કંપની પ્રોડક્ટ માટે કોસ્ટનો રેકૉર્ડ રાખવો કંપની માટે જરૂરી નથી.
- (૭) કાનૂની લેણાં અંગે
 - (અ) અમને આપવામાં આવેલી માહિતી અને ખુલાસાઓ મુજબ કંપની સામાન્ય રીતે યોગ્ય સત્તાવાળાઓ સાથે બિન વિવાદાસ્પદ બાકી, કાયદાકીય લેણા જેવાં કે પ્રોવિડંડ ફંડ, કર્મચારી રાજ્ય વીમા યોજના, ઈન્કમેટેક્સ, સેલ્સટેક્સ, વેલ્થટેક્સ, સર્વિસ ટેક્સ, એક્સાઈઝ ડ્યુટી, સેસ અને બીજા મહત્વના લાગૂ પડતા કાયદાકીય લેણા જમા કરાવે છે. ૩૧મી માર્ચ ૨૦૧૫ ના રોજ ૬ મહિના કરતાં વધારે સમય માટે બિનવિવાદાસ્પદ કાયદાકીય લેણા જમા કરાવવાના બાકી નથી.
 - (બ) અમને પૂરી પાડવામાં આવેલી માહિતી અને ખુલાસા ને આધારે કોઈ વિવાદને અનુસંધાને, ઈન્કમેટેક્સ કે સર્વિસ ટેક્સના કોઈ લેણા ચૂકવાવના બાકી નથી.
- (૮) કંપનીએ કોઈપણ નાણાકિય સંસ્થાઓ પાસેથી કે બેંકો પાસેથી લોન લીધી નથી કે નાણાં ઉછીનાં લીધા નથી. અને કંપનીના વર્ષ દરમિયાન કોઈ ડિબેન્ચર્સ ધારકો પણ નથી. જેથી ઓર્ડરનો પેરા ૩ (૯) લાગૂ પડતો નથી.
- (૯) કંપનીએ વર્ષ દરમિયાન કોઈ પ્રારંભિક જાહેર ઓફર દ્વારા કે પછીની પબ્લીક ઓફર દ્વારા કોઈ નાણાં ઊભાં કરેલ નથી. જેથી ઓર્ડરનો પેરા ૩ (૯) લાગૂ પડતો નથી.



- (૧૦) અમને પૂરી પાડવામાં આવેલી માહિતી અને ખુલાસાને આધારે અમારા ઓડીટના સમયગાળા દરમિયાન કંપની ધ્વારા કંપનીના કોઈ અધિકારી ધ્વારા કે કંપનીના કોઈ કર્મચારી ધ્વારા નાણાંકિય ઠગાઈ કરવામાં આવી હોય તેવું જણાયું નથી.
- (૧૧) અમને પૂરી પાડવામાં આવેલી માહિતી અને ખુલાસાને આધારે, અને કરેલ કંપનીના રેકૉર્ડની/દસ્તાવેજોની ચકાસણીને આધારે વહિવટી નિયામક એ બિન કાર્યપાલક (નોન-એક્ઝીક્યુટીવ) નિયામક છે.
- (૧૨) અમારા અભિપ્રાય પ્રમાણે અને અમને પૂરી પાડવામાં આવેલી માહિતી અને ખુલાસા અનુસાર આ કંપની નિધી કંપની નથી જેથી આ કલમની જોગવાઈઓ લાગૂ પડતી નથી.
- (૧૩) અમને પૂરી પાડવામાં આવેલી માહિતી અને ખુલાસાને આધારે અને અમે કરેલી કંપનીના રેકૉર્ડની ચકાસણીને આધારે, સંબંધિત પાર્ટીઓ સાથે કરેલા વ્યવહારો, અધિનિયમની કલમ ૧૭૭ અને ૧૮૮ સાથે સુસંગત છે. અને લાગુ પડતા એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડની જરૂરિયાત મુજબ, આવા વ્યવહારોની વિગત નાણાકિય પત્રકો માં દર્શાવવામાં આવેલ છે.
- (૧૪) અમને પૂરી પાડવામાં આવેલી માહિતી અને ખુલાસાઓ તેમજ અમે કરેલી કંપનીના રેકૉર્ડની ચકાસણીને આધારે, વર્ષ દરમિયાન કંપની કોઈ શેરની કે પૂર્ણ અથવા વિભાજિત (ફુલ્લી અથવા પાર્ટલી) કન્વર્ટીબલ ડિબેંચરની ફાળવણી પસંદગીના ધોરણે કે ખાનગી ધોરણે કરેલ નથી. જેથી ઓર્ડરની કલમ ૩ (૧૪) ની જોગવાઈઓ કંપનીને લાગૂ પડતી નથી જેથી તેના પર કોઈ ટિપ્પણી કરેલ નથી.
- (૧૫) અમને પૂરી પાડવામાં આવેલી માહિતી અને ખુલાસાઓ તેમજ અમે કરેલી કંપનીના રેકૉર્ડની ચકાસણીને આધારે, કંપનીનીએ તેના નિયામકો અથવા તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓ સાથે કોઈ બિન-નાણાંકીય વ્યવહારો કરેલ નથી. જેથી ઓર્ડરની કલમ ૩ (૧૫) ની જોગવાઈઓ કંપનીને લાગૂ પડતી નથી. જેથી તેના પર કોઈ ટિપ્પણી કરેલ નથી.
- (૧૬) અમને આપવામાં આવેલી માહિતી અને ખુલાસાઓ તેમજ અમે કરેલી કંપનીના રેકૉર્ડની ચકાસણીને આધારે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ ૧૯૩૪ ની કલમ ૪૫ આઈએ ની જોગવાઈઓનું કંપનીએ સંપૂર્ણ અમલીકરણ કરેલ છે. જેની વિગત પરિશિષ્ટ - ૨ માં દર્શાવવામાં આવેલ છે.

સ્થળ : અમદાવાદ
તારીખ : ૨૮-૧૦-૨૦૧૬

જે. પી. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વતી,
એફ.આર.એન. : ૧૦૮૬૧૨W
(સી.એ. નિરવ જે. શાહ)
ભાગીદાર
મેમ્બરશીપ નં. ૧૦૭૭૧૭



ગુજરાત રાજ્ય મૂડીરોકાણ લિમિટેડના તેજ તારીખે અલગથી બનાવેલ (સ્વતંત્ર)

ફાયનાન્સીયલ સ્ટેટમેન્ટના ઓડિટરના અહેવાલનું પરિશિષ્ટ “બી”

કંપની અધિનિયમ, ૨૦૧૩ (અધિનિયમ) ની કલમ ૧૪૩ ની પેટા કલમ ૩ ના કલોઝ (૧) હેઠળનાં આંતરિક નિયંત્રણ નાણાકિય નિયંત્રણ અંગેનો અહેવાલ.

અમે ૩૧. માર્ચ ૨૦૧૬ની સ્થિતિએ ગુજરાત રાજ્ય મૂડી રોકાણ લિમિટેડના કંપની નાણાકિય રિપોર્ટિંગ ઉપરના આંતરિક નાણાકિય નિયંત્રણનું ઓડિટ જે તે તારીખે પુરા થતા વર્ષના કંપનીના અલગથી તૈયાર કરેલ નાણાકિય પત્રકોના આધારે કરેલ છે.

આંતરિક નાણાકિય નિયંત્રણ માટે સંચાલનની જવાબદારીઓ :

કંપનીનું સંચાલન મંડળ, આંતરિક નાણાકિય નિયંત્રણી કામગીરી અને નિભાવ માટે જવાબદાર છે. આ જવાબદારીઓમાં આંતરિક નાણાકિય નિયંત્રણનું આલેખન, અમલીકરણ અને નિભાવનો સમાવેશ થાય છે, જે ધંધાની કાર્યદક્ષતાની ખાત્રી કરવા માટે સક્ષમતાપૂર્વકની કામગીરી બજાવે છે જેમાં કંપનીની નીતિઓને અનુસરીને, તેની અસ્કયામતોમાં વધારો કરવા, ઠગાઈ અને ભૂલોને શોધી કાઢીને તેને રોકવાના પ્રયાસ કરવા, હિસાબો રાખવાની પદ્ધતિમાં ચોકસાઈ અને પરિપૂર્ણતા રાખવી અને કંપની અધિનિયમ, ૨૦૧૩ ની જોગવાઈઓ અનુસાર સમયસર, સાચી અને ભરોસાપત્ર નાણાકિય માહિતી તૈયાર કરવી. જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓડિટરની જવાબદારી :

અમારી જવાબદારી ઓડિટને આધારે કંપનીની નાણાકિય સ્થિતિ ઉપર આંતરિક નાણાકિય નિયંત્રણ વિશેનો અભિપ્રાય આપવાની છે. નાણાકિય સ્થિતિ ઉપર આંતરિક નાણાકિય નિયંત્રણ ના ઓડિટ ઉપરની માર્ગદર્શક નોંધના આધારે અમે આ ઓડિટ કરેલ હતું. આ ઉપરાંત ભારતની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરેલ સ્ટાન્ડર્ડ ઓફ ઓડિટીંગ અને કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૪૩ (૧૦) ની જોગવાઈઓ જે જ્યાં સુધી આંતરિક નાણાકિય નિયંત્રણને લાગુ પડે છે ત્યાં સુધી તે લાગુ કરાવની છે. આ ધારાધોરણ (સ્ટાન્ડર્ડ) અને માર્ગદર્શક નોંધ હેઠળ અમારે નીતિવિષયક જરૂરિયાતોની પૂર્તિ કરવાની હોય છે. અને તેનું આયોજન અને ઓડિટની કામગીરી એવી રીતે આયોજિત કરવાની હોય છે કે જેથી જરૂરી ખાત્રી આપી શકાય કે નાણાકિય રીપોર્ટિંગ ઉપર આંતરિક નાણાકિય નિયંત્રણ પુરતું છે અને આ નિયંત્રણો ખરેખર અસરકારક પરિણામો આપે છે.

નાણાકિય અહેવાલ (રીપોર્ટિંગ) ઉપર આંતરિક નાણાકિય નિયંત્રણ પ્રણાલી પુરતી છે અને તેની કાર્યશીલ અસરકારકતા પણ પુરતી છે જે અંગેના ઓડિટ પુરાવા મેળવવા જેવી બાબતો અમારા ઓડિટમાં સમાવિષ્ટ છે. અમારું આંતરિક નાણાકિય નિયંત્રણને લગતું ઓડિટમાં એ પણ સમાવિષ્ટ છે કે અમે એક સમજ કેળવીએ જેના દ્વારા જોખમનો અંદાજ કાઢીએ ક્યાં ધ્યાનપ્રદ નબળાઈઓ રહેલી છે અને નાણાકિય અહેવાલ ઉપર આંતરિક નિયંત્રણને અંદાજીત જોખમને ધ્યાનમાં લઈ વધુ સક્ષમ બનાવી શકીએ. આ માટેની પદ્ધતિ, ઓડિટરના જજમેન્ટ ઉપર આધાર રાખે છે. જેમાં જોખમનો અંદાજ લગાવવો અને ઠગાઈ કે ભૂલને કારણે કોઈ ખોટું નાણાકિય નિવેદન ન થઈ જાય જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે.

નાણાકિય અહેવાલ (ફાયનાન્સીયલ રિપોર્ટિંગ) અને આંતરિક નાણાકિય નિયંત્રણનો અર્થ :

નાણાકિય અહેવાલ (ફાયનાન્સીયલ રિપોર્ટિંગ) ઉપરનું આંતરિક નાણાકિય નિયંત્રણએ નાણાકિય અહેવાલોની સત્યતાની ખાત્રી પૂરી પાડતી અને સામાન્ય રીતે સર્વ સ્વીકૃત એકાઉન્ટિંગ પ્રિન્સીપલ્સ (હિસાબી સિધ્ધાંતો) ની સાથે એક રૂપતા સધાય તે રીતે નાણાકિય પત્રકો તૈયાર કરવાં જેવી કાર્યો માટેની પ્રક્રિયા (પ્રોસેસ) છે. કંપનીના નાણાકિય અહેવાલ ઉપરના આંતરિક નાણાકિય નિયંત્રણમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. (૧) હિસાબોની જાળવણી એટલી વિસ્તારથી કરવી કે જેથી કંપનીના વ્યવહારો અને અસ્કયામતોના નિકાલ જેવી બાબતો ચોકસાઈથી અને સત્યતાપૂર્વક દર્શાવી શકે (૨) જરૂરી ખાત્રી પૂરી પાડી શકાય કે નાણાકિય અહેવાલો સ્વીકૃત નાણાકિય સિદ્ધાંતો મુજબ તૈયાર કરવામાં આવ્યા છે અને કંપનીની આવકો અને જાવકો (ખર્ચા) કંપનીના સંચાલકો અને નિયામકોની મંજૂરી મેળવીને જ કરવામાં આવ્યા છે. (૩) કંપની દ્વારા જરૂરી મંજૂરી વગર કોઈ અસ્કયામતોની ખરીદી, વપરાશ અને નિકાલ કરવામાં તો નથી આવ્યોને કે જેથી નાણાકિય અહેવાલો પર ખરાબ અસર પડતી હોય આ મુદ્દાની પણ યોગ્ય ખાત્રી આપવી.



નાણાકિય અહેવાલો ઉપરના આંતરિક નાણાકિય નિયંત્રણી અંગભૂત મર્યાદાઓ

આંતરિક નાણાકિય નિયંત્રણમાં રહેલી કેટલીક અંગભૂત મર્યાદાઓને કારણે, પ્રતિસ્પર્ધાઓ વચ્ચેના ખાનગી પ્રપંચ, અયોગ્ય સંચાલન, નિયંત્રણનો અતિરેક, ભૂલ કે ઠગાઈને કારણે ખોટી રજુઆત થવી જેવી બાબતો બને છે પણ શોધી શકાતી નથી. ભવિષ્યના સમય માટે નાણાકિય અહેવાલો પરના આંતરિક નાણાકિય નિયંત્રણના મુદ્દ્યાંકનને દર્શાવવું એ બદલાયેલી પરિસ્થિતિ નીતિઓ સાથેની બાંધછોડ અને બગડેલી કાર્ય પદ્ધતિ જેવી જોખમી પરિબલોને લીધે અપુરતું સાબીત થાય છે.

અભિપ્રાય :

અમારા અભિપ્રાય પ્રમાણે, કંપની પાસે નાણાકિય અહેવાલો ઉપરનું આંતરિક નાણાકિય નિયંત્રણ પુરતા પ્રમાણમાં છે અને ૩૧ માર્ચ ૨૦૧૬ ની પરિસ્થિતિએ ખૂબજ અસરકારક રીતે કામ કરે છે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થા ધ્વારા પ્રસ્થાપિત નાણાકિય અહેવાલો ઉપરના આંતરિક નાણાકિય નિયંત્રણ માટે માર્ગદર્શક નોંધ ને અનુરૂપ છે.

સ્થળ : અમદાવાદ

તા. ૨૮-૧૦-૨૦૧૬

વતી. જે.પી. શાહ એન્ડ કું.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ

FRN - ૧૦૮૬૧૨W

CA - નિરવ જે. શાહ

ભાગીદાર

મેમ્બર નં ૧૦૭૭૧૭



ઑડિટરના રિપોર્ટની અનુસૂચિ-૨

કંપની અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૧૪૩(૫) ની જોગવાઈઓ મુજબ વર્ષ ૨૦૧૫-૧૬ માટેનો અહેવાલ

ક્રમ નં.	વિગત	ટીપ્પણી
૧.	જો કંપનીની પસંદગી ડિસઈન્વેસ્ટમેન્ટ માટે થાય તો કંપનીની અસ્ક્યામતો (અમૃત અસ્ક્યામતો અને જમીન) અને જવાબદારીઓ (પ્રતિબદ્ધ અને સામાન્ય અનામતો)નો અને વર્તમાન ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાના પ્રકારનો સ્ટેટસ રિપોર્ટ તપાસવો	કંપનીની પસંદગી ડિસઈન્વેસ્ટમેન્ટ માટે થઈ નથી જેથી આ કલોઝ તેને લાગૂ પડતો નથી.
૨.	મહેરબાની કરીને જણાવો કે શું કોઈ દેવાં, લોન, વ્યાજ આદિ માંડવાળ ક્યાંના કે માફ કર્યાના કોઈ કેસ છે? જો હોય તો તેમાં સમાવિષ્ટ રકમ અને કારણો જણાવો.	આવા કોઈ કેસ નથી.
૩.	થર્ડ પાર્ટી પાસે રહેલી અસ્ક્યામતો અને સરકાર પાસેથી કે અન્ય સંસ્થાઓ પાસેથી ભેટ રૂપે મળેલી વસ્તુઓનો યોગ્ય હિસાબ રાખેલ છે?	લાગૂ પડતું નથી.
૪.	બાકી લવાદના કેસો, કાયદાકિય કેસો, વગેરેનો તારીખવાર રેકૉર્ડ, આ કેસો કેમ પેન્ડીંગ છે તેનાં કારણો, આવા કેસો ઉપર થઈ રહેલ ખર્ચનું મોનીટરીંગ (સ્થાનિક તેમજ વિદેશી) વગેરેનો રિપોર્ટ આપો.	આવા કોઈ લવાદી કે સરકારી કેસો પેન્ડીંગ નથી.

કંપની અધિનિયમ ૨૦૧૩ હેઠળ સેક્ટર માટે નિર્દિષ્ટ પેટા-સૂચનો કલમ ૧૪૩(૫)

ફાયનાન્સ સેક્ટર (નાણાંકિય ક્ષેત્ર)

ક્રમ નં.	વિગત	ટીપ્પણી
૧.	શું કંપનીએ નોન-બેંકિંગ ફાયનાન્સ ક્ષુ. (NBFC) બિન ઉપયોગી અસ્ક્યામતોનું વર્ગીકરણ અને કેપીટલ એડેક્વસી નોર્મસ ફોર એન.બી.એફ.સી. માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલ સૂચનોનો અમલ કર્યો છે?	કંપનીએ એન.બી.એફ.સી.-સી.આઈ.સી. તરીકે વ્યવસાય કરવા માટે, તા. ૪-૮-૨૦૧૪ના રોજ, રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને અરજ કરેલ હતી અને આર.બી.આઈ.એ તા. ૨૮-૪-૨૦૧૫ના રોજ તેનો સ્વીકાર કરી તેને માન્ય રાખેલ છે. જેથી અહેવાલની તારીખે, કંપનીની ઓળખ બિન-નોંધાયેલ સી.આઈ.સી. તરીકેની છે.
૨.	શું કંપનીએ ખાત્રી કરી છે કે આપવામાં આવેલી લોન સિક્યોર છે, તેના ઉપર અન્ય કોઈ બોજો નથી અને મોર્ટગેજના કેસમાં અસ્ક્યામતો ઉપર પ્રથમ અધિકાર છે? જમ કરેલી અસ્ક્યામતોના નિકાલમાં બિનજરૂરી વિલંબ થયેલ હોય તો તે પણ જણાવવો.	કંપનીને આ કલોઝ લાગૂ પડતું નથી.
૩.	બાકી લેણાની વસુલાત માટે કોઈ સ્કીમ અમલમાં મૂકી હોય કે વસુલાતની મર્યાદા લંબાવવા માટે કોઈ સૂચનો આપવામાં આવ્યા હોય તો તે સરકારની/કંપનીની નીતિ સાથે સુસંગત છે?	કંપનીને આ કલોઝ લાગૂ પડતું નથી.
૪.	બાકી દેવાદારો, બાકી લેણદારો, મુદતી થાપણો, બેંકનાં ખાતાં અને લીધેલ રોકડની સ્પષ્ટતા કરો.	હા, મુદતી થાપણો, બેંક ખાતાં અને લીધેલ કેશનું (કંફરમેશન) સમર્થન કરેલ છે.
૫.	બેંક ગેરંટી સમયસર રેવીલેડિટ કરી છે?	કંપનીને આ કલોઝ લાગૂ પડતું નથી.

સ્થળ : અમદાવાદ

તારીખ : ૨૮-૧૦-૨૦૧૬

જે. પી. શાહ એન્ડ કું.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વતી,

એફ.આર.એન. : ૧૦૮૬૧૨W

(સી.એ. નિરવ જે. શાહ)

ભાગીદાર

મેમ્બરશીપ નં. ૧૦૭૭૧૭



તા. ૩૧મી માર્ચ, ૨૦૧૬ના રોજનું પાકું સરવૈયું (સ્ટેન્ડઅલોન)

રકમ રૂપિયામાં

વિગત	અનુસૂચિ	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૬ ના રોજ	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૫ ના રોજ
૧. શેર મૂડી અને જવાબદારીઓ			
૧. સભાસદોનું ભંડોળ			
(ક) શેર મૂડી	૨	૧૦૪૨૭૬૮૦૭૦૦	૧૦૪૨૭૬૮૦૭૦૦
(ખ) અનામત અને વધારો	૩	૭૩૪૪૭૩૪૮૬૮	૬૫૧૫૭૧૪૧૩૧
સભાસદોનું ભંડોળ		૧૭૭૭૨૪૨૫૬૬૮	૧૬૯૪૩૪૦૪૮૩૧
		૦	૦
૨. શેર અરજીના નાણા			
(ફાળવણી બાકી)			
૩. સ્થાયી જવાબદારીઓ			
(ક) લાંબાગાળાનું ઋણ	૪	૮૭૮૮૫૦૦૦૦૦	૮૨૫૦૦૦૦૦૦૦
(ખ) લાંબાગાળાની જોગવાઈ	૫	૮૨૮૬૬૪	૭૮૮૮૮૧
સ્થાયી જવાબદારીઓ		૮૭૮૮૩૨૮૬૬૪	૮૨૫૦૭૮૮૮૮૧
૪. ચાલુ જવાબદારીઓ			
(ક) ટ્રેડ પેયેબલ્સ		૦.૦૦	૦.૦૦
(ખ) અન્ય ચાલુ જવાબદારીઓ	૬	૧૧૬૪૮૩૦	૪૬૭૮૨૫
(ગ) ટૂંકા ગાળાની જોગવાઈ	૭	૨૭૩૮૨	૨૩૭૨૮
ચાલુ જવાબદારીઓ		૧૧૮૨૩૧૨	૪૮૧૫૫૩
કુલ		૨૬૫૭૨૮૪૭૬૪૪	૨૫૧૮૪૬૮૬૨૬૫
૨. મિલકતો :			
૧. સ્થાયી અસ્કયામતો			
(ક) સ્થિર મિલકતો			
(૧) દૃશ્યમ મિલકતો	૮	૧૦૮૮૧૭૨	૨૨૨૩૫૪
(ખ) સ્થાયી રોકાણો	૯	૨૨૮૮૫૫૬૭૫૭૮	૨૨૮૬૦૩૭૪૩૭૮
(ગ) વિલંબિત વેરાની અસ્કયામત	૧૦	૩૬૬૮૨૮	૧૦૮૭૮૩
(ઘ) લાંબાગાળાની લોન અને પેશગીઓ	૧૧	૩૮૭૬૮૬૩૮	૮૮૫૩૪૩૦૬
સ્થાયી મિલકતો		૨૨૮૨૬૭૮૨૨૧૭	૨૨૮૫૦૨૩૮૮૩૧
૨. ચાલુ મિલકતો			
(ક) રોકડ અને તેની સમકક્ષ	૧૨	૫૫૨૪૬૧૬૮૧	૪૮૨૨૦૨૪
(ખ) ટૂંકાગાળાની લોન અને પેશગીઓ	૧૩	૨૮૬૩૦૮૩૪૮૨	૨૧૩૩૧૩૭૮૬૮
(ગ) અન્ય ચાલુ મિલકતો	૧૪	૧૩૦૬૦૦૨૪૪	૧૦૬૩૮૬૪૪૧
ચાલુ મિલકત		૩૬૪૬૧૫૫૪૨૭	૨૨૪૪૪૫૬૪૩૪
કુલ		૨૬૫૭૨૮૪૭૬૪૪	૨૫૧૮૪૬૮૬૨૬૫

૧ થી ૩૧

મહત્વના હિસાબી નિયમો તથા હિસાબી નોંધ
સાથે બીડેલ અહેવાલ મુજબ
જે. પી. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વતી,
રજીસ્ટ્રેશન નંબર : ૧૦૮૬૧૨W
(સી.એ. નિરવ જે. શાહ)
પાર્ટનર
સભ્ય નંબર : ૧૦૭૭૧૭
સ્થળ : અમદાવાદ
તારીખ : ૨૮-૧૦-૨૦૧૬

નિયામક મંડળ અને તેમના વતી
ગુજરાત સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ લીમિટેડ

વહીવટી સંચાલક | સંચાલક | કંપની સચિવ | મુખ્ય નાણાકીય અધિકારી

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૨૮-૧૦-૨૦૧૬



તા. ૩૧મી માર્ચ, ૨૦૧૬ના રોજ પુરા થતાં વર્ષ માટે નફા નુકસાન ખાતું (સ્ટેન્ડઅલોન)

રકમ રૂપિયામાં

વિગત	અનુસૂચિ	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૬ ના રોજ પૂરા થતા વર્ષ માટે	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૫ ના રોજ પૂરા થતા વર્ષ માટે
૧. આવક :			
કામગીરીમાંથી આવક	૧૫	૮૦૮૦૫૮૮૩૨	૮૬૧૨૬૩૫૪૨
અન્ય આવક	૧૬	૧૧૦૦૦૮૦૦	૨૪૦૭૭૮૧૬૮
કુલ આવક		૮૧૯૦૫૮૮૩૨	૧૧૦૨૦૪૨૭૧૧
૨. ખર્ચ			
કર્મચારી લાભ ખર્ચ	૧૭	૩૨૩૮૩૬૨	૩૧૭૬૩૦૨
ફાઈનાન્સ ખર્ચ	૧૮	૭૮૮૮૬	૦
ઘસારા ખર્ચ	૮	૩૩૮૫૭૨	૧૧૮૨૮૩
અન્ય ખર્ચ	૧૯	૧૧૫૬૪૭૫૧	૫૩૮૭૬૮૮
કુલ ખર્ચ		૧૫૨૨૩૫૭૧	૮૬૮૩૨૮૪
૩. કરવેરા પહેલાનો નફો		૮૦૩૮૩૬૨૬૧	૧૦૮૩૩૪૮૪૨૭
૪. કરવેરા ખર્ચ			
(ક) ચાલુ વેરા		૭૪૭૫૧૨૮૭	૧૨૩૧૪૬૨૧૩
(ખ) ચાલુવેરા (અગાઉના વર્ષોને લગતા)		૩૨૨૧૭૩	૧૧૧૦૮૦
(બ) વિલંબિત કરવેરા (મિલકતો અને જવાબદારીઓ)		૨૫૮૦૩૬	(૧૪૩૬૩૮)
૫. વર્ષ દરમિયાનનો નફો (૩-૪)		૮૨૮૦૨૦૮૩૭	૮૬૮૮૪૮૪૮૬
૬. પ્રત્યેક શેર દીઠ આવક			
દાર્શનિક કિંમત રૂ. ૧૦ પ્રત્યેક			
મૂળ કિંમત (રૂ.માં)		૦.૮૦	૦.૮૩
ઘટાડેલ કિંમત રૂ.માં)		૦.૮૦	૦.૮૩

મહત્વના હિસાબી નિયમો તથા હિસાબી નોંધ

૧ થી ૩૧

સાથે બીડેલ અહેવાલ મુજબ

જે. પી. શાહ એન્ડ કું.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વતી,

રજીસ્ટ્રેશન નંબર : ૧૦૮૬૧૨W

(સી.એ. નિરવ જે. શાહ)

પાર્ટનર

સભ્ય નંબર : ૧૦૭૭૧૭

સ્થળ : અમદાવાદ

તારીખ : ૨૮-૧૦-૨૦૧૬

નિયામક મંડળ અને તેમના વતી

ગુજરાત સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ લીમિટેડ

વહીવટી સંચાલક | સંચાલક | કંપની સચિવ | મુખ્ય નાણાકિય અધિકારી

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૨૮-૧૦-૨૦૧૬



૩૧ માર્ચ, ૨૦૧૬ના રોજના રોકડ લેવડ-દેવડની નોંધ (સ્ટેન્ડઅલોન)

રકમ રૂપિયામાં

વિગત	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૬ ના રોજ	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૫ ના રોજ
અ. રોકડનો વ્યવહાર		
કરવેરા પહેલાનો નફો	૮૦૩,૮૩૬,૨૬૧.૦૦	૧,૦૮૩,૩૪૮,૪૨૬.૫૨
ગ્રોજસ્ટમેન્ટ ફોર :		
વધુ સમય સુધી રાખવી જરૂરી નથી એવી જવાબદારીઓ / જોગવાઈઓ	૦.૦૦	-૧,૦૬૦,૮૩૬.૦૦
ઘસારો	૩૩૮,૫૭૨.૦૦	૧૧૮,૨૮૩.૦૦
વધુ સમય સુધી રાખવી જરૂરી નથી એવી જવાબદારીઓ / જોગવાઈઓ	૦.૦૦	૦.૦૦
મિલકતના વેચાણનો નફો કે નુકશાન	૦.૦૦	-૪૮૭.૭૦
રોકાણ વેચાણ ઉપર નફો નુકશાન	૦.૦૦	-૨૩૮,૭૧૭,૭૩૫.૨૪
કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો કાર્યકારી નફો		
ગ્રેજ્યુઈટી અને રીટાયરમેન્ટ બેનીફીટની જોગવાઈ		
કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો કાર્યકારી નફો	૮૦૪,૧૭૫,૮૩૩.૦૦	૮૫૨,૬૮૮,૫૪૦.૫૮
કાર્યશીલ મૂડીમાં ફેરફાર		
અન્ય ચાલુ મિલકતમાં વધારો / ઘટાડો	-૨૪,૨૦૩,૮૦૩.૦૦	૬૫,૬૩૬,૮૪૦.૦૦
અન્ય સ્થાયી મિલકત	૨૮,૭૮૩.૦૦	
લોન અને પેશગી (વધારો / ઘટાડો)	-૭૮૦,૧૮૦,૮૫૫.૦૦	૨,૬૪૨,૨૮૩,૨૪૦.૩૬
ચાલુ જવાબદારીઓ (વધારો / ઘટાડો)	૬૮૭,૧૦૫.૦૦	-૨,૧૬૫,૮૩૫.૦૦
રોકડ વ્યવહારો	-૮૦૩,૬૬૭,૭૭૦.૦૦	૨,૭૦૫,૭૫૪,૧૪૫.૩૬
પ્રત્યક્ષ કરવેરાની ચૂકવણી	-૭૫,૦૭૩,૪૬૦.૦૦	-૧૨૩,૨૫૭,૨૮૩.૦૦
ધંધાની કાર્યકારી પ્રવૃત્તિમાં વપરાયેલ ચોખ્ખી રોકડ	૨૫,૪૩૪,૬૦૩.૦૦	૩,૪૩૫,૧૮૬,૩૮૨.૮૪
બ. રોકાણ ઉપરનો રોકડ વ્યવહાર		
સ્થાયી મિલકતોના વેચાણમાંથી	૦.૦૦	૨૧,૨૦૦.૦૦
સ્થાયી મિલકતોના રોકાણમાંથી	૦.૦૦	૨૫૦,૬૭૧,૮૭૮.૦૦
સ્થાયી રોકાણોની ખરીદી	-૧,૨૦૫,૩૮૦.૦૦	-૨૬૩,૧૬૧.૦૦
સ્થાયી મિલકતની ખરીદીનો ઘસારો	૦.૦૦	૦.૦૦
રોકાણોની ખરીદી	-૨૫,૧૮૩,૨૦૦.૦૦	-૮૫,૬૧૨,૨૨૦.૦૦
મુકેલ / ઉપાડેલ ઈન્ટરકોર્પોરેટ ડીપોઝીટ		
રોકાણની પ્રવૃત્તિ દ્વારા ઉત્પન્ન થયેલ ચોખ્ખી રોકડની આવક	-૨૬,૩૮૮,૫૮૦.૦૦	૧૬૪,૮૧૭,૬૮૭.૦૦
ક. ધિરાણના વ્યવહાર દ્વારા ઉત્પન્ન થયેલ રોકડ આવક		
તારણ વગરની લોનનો વ્યવહાર	૫૪૮,૫૦૦,૦૦૦.૦૦	-૩,૬૮૫,૮૩૮,૦૦૦.૦૦
શેર/અરજીઓનો વ્યવહાર	૦.૦૦	૦.૦૦
ધિરાણના વ્યવહાર દ્વારા ઉત્પન્ન રોકડની આવક	૫૪૮,૫૦૦,૦૦૦.૦૦	-૩,૬૮૫,૮૩૮,૦૦૦.૦૦
ચોખ્ખો રોકડમાં વધારો/ઘટાડો (અ+બ+ક)	૫૪૭,૫૩૬,૦૧૩.૦૦	-૮૫,૮૩૪,૮૧૦.૦૬
એકંદરે રોકડમાં વધારો વર્ષની શરૂઆતમાં	૪,૮૨૨,૦૨૩.૮૪	૮૦,૭૫૬,૮૩૪.૦૦
એકંદરે રોકડમાં વધારો વર્ષના અંતે	૫૫૨,૪૬૧,૬૮૦.૮૪	૪,૮૨૨,૦૨૩.૮૪

નોંધ :

- કંપની ઈન્વેસ્ટમેન્ટ કંપની હોવાથી રોકાણોના ખરીદ-વેચાણને “રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓ” નો ભાગ ગણવામાં આવેલ છે અને આ રોકાણો પર વર્ષ દરમિયાન મેળવેલ વ્યાજ / ડિવિડન્ડને “સંચાલન પ્રવૃત્તિઓ રોકડ પ્રવાહ” નો ભાગ ગણવામાં આવેલ છે.
- રોકડ અને રોકડ સમકક્ષમાં પાકા સરવૈયા મુજબની રોકડ અને બેન્ક સિલક તેમજ ૩ મહિના કે તેથી ઓછા સમય માટે મૂકવામાં આવેલ ઈન્ટરકોર્પોરેટ ડીપોઝીટનો સમાવેશ થાય છે.
- જ્યાં જરૂર પડી હોય ત્યાં પાછલા વર્ષની રકમોને રી-ગ્રુપ કરવામાં આવેલ છે.

સાથે બીડેલ અહેવાલ મુજબ
જે. પી. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વતી,
રજીસ્ટ્રેશન નંબર : ૧૦૮૬૧૨W
(સી.એ. નિરવ જે. શાહ)
પાર્ટનર
સભ્ય નંબર : ૧૦૭૭૧૭
સ્થળ : અમદાવાદ
તારીખ : ૨૮-૧૦-૨૦૧૬

નિયામક મંડળ અને તેમના વતી
ગુજરાત સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ લીમિટેડ

વહીવટી સંચાલક | સંચાલક | કંપની સચિવ | મુખ્ય નાણાકીય અધિકારી

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૨૮-૧૦-૨૦૧૬



૩૧-૩-૨૦૧૬ ના રોજ પુરા થતા વર્ષના નાણાંકિય પત્રકોના ભાગરૂપ અનુસૂચિઓ (સ્ટેન્ડઅલોન)

૧. મહત્વની હિસાબી નીતિઓ

૧.૧ નાણાંકિય પત્રકો તૈયાર કરવાની પદ્ધતિ :

હિસાબો લખવા માટે ભારતમાં સામાન્ય રીતે સ્વીકૃત કરાયેલા (GAAP) ની જોગવાઈ અનુસાર ઐતિહાસિક પડતર કિંમતે એકુઅલ ધોરણોનો ઉપયોગ કરેલ છે.

હિસાબી નીતિઓ સતત અનુસરવામાં આવી છે. સિવાય કે નવા હિસાબી ધોરણો શરૂઆતમાં સ્વિકારાયા હોય અથવા અહીં ઉપયોગમાં લેવામાં આવેલ હિસાબી નીતિઓ અંગેના હિસાબી ધોરણોમાં સુધારો કરવામાં આવ્યો હોય. હિસાબો લખવા માટે કંપનીએ એકુઅલ પદ્ધતિ સ્વીકારી છે અને હિસાબો કંપની ચાલુ રહેવાની છે તેમ સમજીને રાખવામાં આવેલ છે.

નાણાંકિય પત્રકો તૈયાર કરતી વખતે જે હિસાબી નીતિઓ તૈયાર કરવામાં આવી છે તે પાછલા વર્ષે જે હિસાબી નીતિઓ અપનાવેલી તેની સાથે સુસંગત છે સિવાય કે નીચે મુજબની હિસાબી નીતિઓમાં થયેલ ફેરફાર.

૧.૨ અંદાજનો ઉપયોગ :

ભારતમાં સામાન્ય રીતે સ્વીકૃત કરાયેલ એકાઉન્ટીંગ સિદ્ધાંતો (GAAP) સાથે સુસંગતતા માટે વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે સંચાલન, એવા ચુકાદાઓ, અંદાજો અને ધારણાઓ ધ્યાને લેવી જોઈએ જે રીપોર્ટીંગ સમયગાળાના અંતે આવકનો જથ્થો, ખર્ચ, અસ્ક્યામતો, જવાબદારીઓ અને આકસ્મિક જવાબદારીઓની જાહેરાતને અસર કરે. જોકે આવા અંદાજો એ સંચાલનની વર્તમાન ઘટનાઓ અને કાર્યોના શ્રેષ્ઠ જ્ઞાન પર આધારિત છે. આ પૂર્વ ધારણાઓ અને અંદાજ અંગે અનિશ્ચિતતા ભવિષ્યમાં જવાબદારીઓની રકમ ભૌતિક વ્યવસ્થા સ્વરૂપે આગળ લઈ જવામાં પરિણમી શકે છે.

૧.૩ આવક માન્યતા :

કંપનીનો ડિવિડન્ડ મેળવવાનો હક પ્રસ્થાપિત થાય અને આવું ડિવિડન્ડ જાહેર કરવામાં આવેલ હોય ત્યારે આ ડિવિડન્ડની આવક હિસાબમાં નોંધવામાં આવે છે. મળવાની બાકી અને પ્રવર્તમાન દરને ધ્યાને લઈ વ્યાજની આવક સમય પ્રમાણસરના ધોરણે સ્વિકૃત કરવામાં આવેલ છે.

૧.૪ સ્થાયી અસ્ક્યામત :

સ્થાયી અસ્ક્યામતો સંપાદિત કિંમતમાંથી ઘટતી જતી બાકી પદ્ધતિથી ગણેલ સંચિત ઘસારો બાદ કરી દર્શાવવામાં આવે છે. પડતર કિંમતમાં ખરીદ કિંમત અને આવી મિલકતને ચાલુ સ્થિતિમાં લાવવાના ખર્ચનો સમાવેશ થાય છે.

૧.૫ ઘસારો :

કંપની અધિનિયમ, ૨૦૧૩ ના પરિશિષ્ટ ૨ માં દર્શાવેલી રીત અને દર મુજબ ઘટતી જતી પદ્ધતિથી સ્થાયી અસ્ક્યામતો પર ઘસારો ગણવામાં આવેલ છે.

૧.૬ સ્થાયી અસ્ક્યામતોમાં ઘટાડો/નુકશાન :

(એ) કંપનીની અસ્ક્યામતોની બિન ઉપયોગીતાની સંભાવના અંગે જોગવાઈ કરવામાં આવે છે. જો આવી સંભાવના ઉદ્ભવે તો આવી અસ્ક્યામતના વેચાણ દ્વારા મળતી આવકનો અંદાજ કાઢવામાં આવે છે. અસ્ક્યામત બિન-ઉપયોગી થતાં નુકશાનને ત્યારે જ સ્વિકારવામાં આવે છે, જ્યારે અસ્ક્યામતની ચોપડા ઉપરની કિંમતે તેના વેચાણ દ્વારા મળી શકનાર રકમ કરતાં વધુ હોય.

(બી) અસ્ક્યામતની બિન ઉપયોગીતાના નુકશાનની અગાઉના વર્ષની જોગવાઈ ત્યારે જ પરત કરવામાં આવે છે જ્યારે તેવું જણાય છે અસ્ક્યામતના બિનઉપયોગીતાના અંદાજમાં ઘટાડો થયો છે કે તેના સંજોગો હવે અસ્તિત્વમાં નથી.

૧.૭ રોકાણો :

રોકાણો લાંબા ગાળાના છે અને તે મેળવેલી કિંમતે દર્શાવેલ છે. રોકાણોની કિંમત હંગામી ન હોય તેવા ઘટાડા માટેની જોગવાઈ હિસાબોમાં કરવામાં આવેલ છે.

૧.૮ કર્મચારીને લાભો :

(૧) ટુંકા ગાળાના કર્મચારીઓને મળવાપાત્ર લાભ ખર્ચ તરીકે ડિસ્કાઉન્ટ કર્યા વગર જે વર્ષે કર્મચારીએ સેવા આપી હોય તે જ વર્ષના નફા-નુકશાન ખાતે ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે.



(૨) કર્મચારીની સેવા સમાપ્ત થયા બાદ મળવાપાત્ર લાભ :

(અ) આ મળવાપાત્ર લાભમાં ગ્રેજ્યુઈટી તથા રજા-પગારની ચૂકવણીનો સમાવેશ થાય છે. કર્મચારીએ જે વર્ષમાં સેવા આપેલી હોય તે વર્ષમાં નફો-નુકશાન ખાતે કર્મચારીની સેવાઓ સમાપ્ત થયા બાદ તેમને મળવાપાત્ર લાભોની જોગવાઈ કરવામાં આવે છે. આ ખર્ચની એકચ્યુઅલ આકારણી વર્તમાન કિંમત મુજબ વર્ષાંતે કરવામાં આવે છે. જે કંપની એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ રૂલ્સ, ૨૦૦૬ ના એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ ૧૫ મુજબ સંલગ્ન છે.

(બ) કંપનીએ અલગ ભવિષ્યનિષિ ટ્રસ્ટની રચના કરેલ છે. કર્મચારીને ચૂકવેલ, ચૂકવવાપાત્ર થતી રકમની વર્ષના નફા-નુકશાન ખાતામાં જોગવાઈ કરવામાં આવે છે. કંપનીની જવાબદારી છે કે જો ટ્રસ્ટનાં રોકાણો ઉપર થતી આવક સરકાર દ્વારા જાહેર કરેલ વ્યાજ કરતાં ઓછી હોય તો કંપનીને તેટલો તફાવત ચૂકવવો પડે.

કર્મચારીની નોકરીની મુદત બાદ મળવાપાત્ર લાભ અંગેના ચડત (accrual) નફા અથવા નુકશાનની જોગવાઈ નફા-નુકશાનને કરવામાં આવે છે.

૧.૯ કરવેરા :

(અ) આવકવેરાની જોગવાઈ ચાલુ વર્ષની કરપાત્ર આવક ઉપર આવકવેરા કાયદા ૧૯૬૧ તેમજ તેના અંતર્ગત નિયમો મુજબ કરવામાં આવે છે.

(બ) વિલંબીત કરની મૂડી/જવાબદારીની ઓળખ પ્રવર્તમાન કરતા ધોરણ મુજબ ચોપડાના નફા અને કરપાત્ર આવકના સમયના તફાવત ઉપર આધારિત છે. વિલંબીત કર મુડીની ઓળખ ત્યારે જ કરવામાં આવે છે. કે જ્યારે તે સુનિશ્ચિત હોય કે ભવિષ્યમાં મળનાર કરપાત્ર આવક પુરતી હોય કે જેની સામે વિલંબીત કર મુડી મેળવી શકાય. આવા સંજોગોમાં જ્યારે કંપની પાસે આગળ ખેંચેલી કરપાત્ર નુકશાન હોય તેની સામે તેટલી જ વિલંબીત કરમુડીની આકારણી કરવામાં આવે છે કે જ્યારે તે સુનિશ્ચિત હોય તે ભવિષ્યની કરપાત્ર આવક ઉપલબ્ધ કરવાની શક્યતા છે તેવી પુરી ખાત્રી હોય.

૧.૧૦ શેર દીઠ કમાણી :

શેરદીઠ કમાણીના હિસાબી ધોરણ ૨૦ મુજબ, કંપનીનો મુળભૂત અને હળવી શેરદીઠ કમાણીનો અહેવાલ મળે છે. મુળભૂત રીતે શેરદીઠ કમાણી એ વર્ષ દરમિયાનના ચોખ્ખા નફાને વર્ષ દરમિયાન બાકી ભારિત સરેરાશ ઈક્વિટી શેરોની સંખ્યા વડે ભાગતાં મળતી સંખ્યા છે.

૧.૧૧ આકસ્મિક જવાબદારીની જોગવાઈ :

આકસ્મિક જવાબદારીની જોગવાઈ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે વર્તમાન જવાબદારી ભૂતકાળના કાર્યને ઉદ્ભવેલી હોય, એવી બની શકે તેવી જવાબદારી ચૂકવવા માટે નાણાંકિય પ્રવાહ બહાર જતો હોય. આવી જવાબદારીનું વર્તમાન મુલ્ય બેલેન્સશીટના દિવસે ઉચ્ચતમ અંદાજ મુજબ નક્કી કરવામાં આવે છે. આવા અંદાજો દરેક બેલેન્સ શીટના દિવસે તપાસવામાં આવે છે અને વર્તમાન અંદાજ મુજબ સુધારવામાં આવે છે. આકસ્મિક જવાબદારીઓ જો કોઈ હોય તો તે “નોંધ” સ્વરૂપે દર્શાવવામાં આવે છે.



સરવૈયાના ભાગરૂપે અનુસૂચિઓ (સ્ટેન્ડઅલોન)

રકમ રૂપિયામાં

ક્રમ	વિગત	૩૧-૩-૨૦૧૬ ના રોજ	૩૧-૩-૨૦૧૫ ના રોજ
૨ -	શેરમૂડી		
અ	કંપની બે પ્રકારની શેરમૂડી ઈક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેરમૂડી નીચે મુજબ ધરાવે છે : અધિકૃત : ૨૮૫,૦૦,૦૦,૦૦૦ ઈક્વિટી શેર (પ્રત્યેક રૂા. ૧૦ના) ૧,૫૦,૦૦,૦૦૦ પ્રેફરન્સ શેર (પ્રત્યેક રૂા. ૧૦૦ ના) કુલ ઈસ્યુ કરેલ, ભરપાઈ કરેલ અને વસુલ આવેલ મુડી ૧૦૪,૨૭,૬૯,૦૭૦ ઈક્વિટી શેર્સ (પ્રત્યેક રૂા. ૧૦ ના) કુલ	૨૮૫૦૦૦૦૦૦૦૦ ૧૫૦૦૦૦૦૦૦૦ ૩૦૦૦૦૦૦૦૦૦૦ ૧૦૪૨૭૬૯૦૭૦૦ ૧૦૪૨૭૬૯૦૭૦૦	૨૮૫૦૦૦૦૦૦૦૦૦ ૧૫૦૦૦૦૦૦૦૦૦ ૩૦૦૦૦૦૦૦૦૦૦૦ ૧૦૪૨૭૬૯૦૭૦૦ ૧૦૪૨૭૬૯૦૭૦૦
	ધારણ કરનાર ૧. ગુજરાતના રાજ્યપાલ (૧૦૦% ભંડોળ) અગાઉના વર્ષનું ૧૦૦% શેર ભંડોળ બાકી રહેલા શેરોની હિસાબી મેળવણી		
બ.	વિગત	ઈક્વિટી શેર (સંખ્યા)	
	અ. વર્ષની શરૂઆતના શેર્સ	૧૦૪૨૭૬૯૦૭૦	૧૦૪૨૭૬૯૦૭૦
	બ. વર્ષ દરમિયાન ઈસ્યુ કરેલ	૦	૦
	ક. બાદ : બાય બેક (પુનઃખરીદેલ) શેર્સ	૦	૦
	ડ. વર્ષના અંતે શેરની સંખ્યા (અ + બ - ક)	૧૦૪૨૭૬૯૦૭૦	૧૦૪૨૭૬૯૦૭૦
	ક. મુડી પરત અને ડિવીડન્ડ અંગેના ઈક્વિટી શેર હોલ્ડરોના અધિકારો (૧) ઈક્વિટી શેર ધારકોના અધિકારો, ડિવીડન્ડ અને મૂડી પરત કંપનીની બાકી રહેલ મિલકતો બાબતે બધા શેરધારકો સમાન હશે. (૨) ઈક્વિટી શેર ધારકો સમયાંતરે જાહેર કરાતા ડિવીડન્ડ માટે હક્કદાર બનશે અને કંપનીની મીટીંગમાં પ્રત્યેક શેરદીઠ એક મત આપવાને હક્કદાર બનશે		
ડ.	૫% થી વધુ હોલ્ડીંગ ધરાવનાર શેર હોલ્ડરની વિગત		
	શેર હોલ્ડરનું નામ	ઈક્વિટી શેર (સંખ્યા)	
	૧. ગુજરાતના રાજ્યપાલ (૧૦૦% હોલ્ડિંગ)	૧૦૪૨૭૬૯૦૭૦	૧૦૪૨૭૬૯૦૭૦



સરવૈયાના ભાગરૂપે અનુસૂચિઓ (સ્ટેન્ડઅલોન)

રકમ રૂપિયામાં

ક્રમ	વિગત	૩૧-૩-૨૦૧૬ ના રોજ	૩૧-૩-૨૦૧૫ ના રોજ
૩.	અનામત અને પુરાંત		
	વધારો : નફા અને નુકસાનના પત્રક મુજબ બાકી પાકા સરવૈયા મુજબ	૫૮૮૫૭૧૪૧૩૧	૫૦૨૫૭૭૦૩૩૭
	બાદ કંપની ધારા ૨૦૧૩ અનુસૂચિ ૨ મુજબ ઘસારો	૦	૪૭૦૨
	વધારો : વર્ષ દરમિયાન નફો	૮૨૮૦૨૦૮૩૭	૮૬૮૮૪૮૪૮૬
	કુલ (અ)	૬૮૨૪૭૩૪૮૬૮	૫૮૮૫૭૧૪૧૩૧
	મુડી પરત અનામતમાં ગત વર્ષના પાકા સરવૈયા મુજબ	૫૨૦૦૦૦૦૦૦	૫૨૦૦૦૦૦૦૦
	કુલ (બ)	૫૨૦૦૦૦૦૦૦	૫૨૦૦૦૦૦૦૦
	કુલ અનામત અને વધારો	૭૩૪૪૭૩૪૮૬૮	૬૫૧૫૭૧૪૧૩૧
૪.	લાંબાગાળા ઋણ - તારણ વગરના		
	રાજ્ય સરકાર પાસેથી લીધેલ લોન (ગર્વમેન્ટ ઓફ ગુજરાત)	૮૭૮૮૫૦૦૦૦૦	૮૨૫૦૦૦૦૦૦૦
	કુલ	૮૭૮૮૫૦૦૦૦૦	૮૨૫૦૦૦૦૦૦૦
૫.	લાંબાગાળાની જોગવાઈઓ		
	(અ) કર્મચારી લાભ અંગેની જોગવાઈઓ		
	(૧) ગ્રેજ્યુઈટીની જોગવાઈ	૫૩૨૭૩૭	૪૭૬૫૭૫
	(૨) રજાનું રોકડમાં રૂપાંતર અંગેની જોગવાઈ	૨૮૬૮૨૭	૨૫૭૮૨૮
	(૩) અન્ય કર્મચારી લાભ અંગેની જોગવાઈ	૦	૬૫૩૭૮
	કુલ	૮૨૯૬૬૪	૭૯૯૮૮૧
	વેપારી દેવુ		
	ખર્ચ / સેવા અંગેના લેણદારો	૦	૦
	કુલ	૦	૦
	સુક્ષ્મ નાના અને મધ્યમ એકમો વિકાસ ધારો - ૨૦૦૬ હેઠળ પશ્ચાત્તરનો સમાવેશ થાય તેવી કોઈ રકમ નથી		;
૬.	અન્ય ચાલુ જવાબદારીઓ		
	અન્ય ચુકવવા પાત્ર	૧૧૬૪૮૩૦	૪૬૭૮૨૫
	કુલ	૧૧૬૪૮૩૦	૪૬૭૮૨૫
૭.	ટૂંકા ગાળાની જોગવાઈઓ		
	(૧) ગ્રેજ્યુઈટી માટેની જોગવાઈ	૧૫૮૪૭	૧૪૪૬૮
	(૨) રજાનું રોકડમાં રૂપાંતર અંગેની જોગવાઈ	૧૧૫૩૫	૮૨૫૮
	કુલ	૨૭૩૮૨	૨૩૭૨૮



સરવૈયાના ભાગરૂપે અનુસૂચિઓ (સ્ટેન્ડઅલોન)

૮. ભૌતિક મિલકતો

૨૩મ ડિપ્રિયમાં

વિગત	મિલકત (ખરીદ કિંમત)				ઘસારો				ચોખ્ખી મિલકત	
	૩૧ માર્ચ ૨૦૧૫ ની સ્થિતિ	વર્ષ દરમિયાન વધારો	વર્ષ દરમિયાન વેચાણ નિકાલ	૩૧ માર્ચ ૨૦૧૬ ની સ્થિતિ	૩૧ માર્ચ ૨૦૧૫ ની સ્થિતિ	વર્ષ દરમિયાન વધારો	હવાલો	૩૧ માર્ચ ૨૦૧૬ ની સ્થિતિ	નફા નુકશાન ખાતામાં વધારાની સીલક પર નોંધાયેલ ઘસારો	૩૧ માર્ચ ૨૦૧૬ ની સ્થિતિ
ફર્નિચર અને ફિક્સર્સ	૫૧૫,૭૬૯.૫૫	૦.૦૦	૦.૦૦	૫૧૫,૭૬૯.૫૫	૪૯૭,૦૨૩.૩૯	૦.૦૦	૦.૦૦	૪૯૭,૦૨૩.૩૯	૬૫૫.૦૦	૧૮,૭૪૬.૧૬
વાહનો	૫૦૭,૫૩૫.૦૨	૧,૨૦૫,૩૯૦.૦૦	૦.૦૦	૧,૭૧૨,૯૨૫.૦૨	૪૮૨,૧૫૭.૮૦	૨૬૪,૩૪૭.૦૦	૦.૦૦	૭૪૬,૫૦૪.૮૦	૦.૦૦	૯૬૬,૪૨૦.૨૨
ઓફિસ સામગ્રી	૧૫૮,૨૨૬.૦૦	૦.૦૦	૦.૦૦	૧૫૮,૨૨૬.૦૦	૮૦,૯૨૨.૨૨	૧૬,૮૮૮.૦૦	૦.૦૦	૯૭,૮૧૦.૨૨	૪,૦૪૭.૦૦	૭૭,૩૦૩.૭૮
કોમ્પ્યુટર	૩૧૭,૦૦૩.૦૦	૦.૦૦	૦.૦૦	૩૧૭,૦૦૩.૦૦	૨૧૧,૩૭૪.૩૧	૫૮,૩૩૭.૦૦	૦.૦૦	૨૬૯,૭૧૧.૩૧	૦.૦૦	૧૦૫,૬૨૮.૬૯
કુલ	૧,૪૯૮,૫૩૩.૫૭	૧,૨૦૫,૩૯૦.૦૦	૦.૦૦	૨,૭૦૩,૯૨૩.૫૭	૧,૨૭૧,૪૭૭.૭૨	૩૩૮,૫૭૨.૦૦	૦.૦૦	૧,૬૧૧,૦૪૯.૭૨	૪,૭૦૨.૦૦	૨૨૭,૦૫૫.૮૫
આગળનું વર્ષ	૨,૨૩૫,૦૮૧.૫૭	૨૬૩,૧૬૧.૦૦	૯૯૯,૭૨૩.૦૦	૧,૪૮૮,૫૩૩.૫૭	૨,૧૩૧,૨૧૫.૪૨	૧૧૮,૨૮૩.૦૦	૯૭૯,૦૨૦.૭૦	૧,૨૭૧,૪૭૭.૭૨	૪,૭૦૨.૦૦	૧૦૩,૮૮૦.૧૫

ધંધાકીય જોડાણો કે અન્ય કોઈ વ્યવસ્થા હેતુ કંપનીની મિલકતો ભાડાપટ્ટે આપવામાં આવેલ નથી અને આવી રીતે ધારણ કરાયેલ નથી.

૩૧ માર્ચ ૨૦૧૬ થી અગાઉના પાંચ વર્ષ દરમિયાન મુડી ઘટાડા કે પુનઃમુલ્યાંકન હેતુ કંપનીની કોઈપણ મિલકત માંડી વાળવામાં આવેલ નથી.



સરવેચના તમાગરૂપે અનુસૂચિઓ (સ્ટેન્ડઅલોન)

રકમ રૂપિયામાં

	શેર્સની સંખ્યા		ચોપડે કિંમત રકમ રૂ.	
	૩૧-૩-૨૦૧૬ ના રોજ	૩૧-૩-૨૦૧૫ ના રોજ	૩૧-૩-૨૦૧૬ ના રોજ	૩૧-૩-૨૦૧૫ ના રોજ
૯. લાંબી મુદતના રોકાણો લાંબી મુદત - વેપાર રોકાણ (મૂળ કિંમતે) (જ્યાં ઉલ્લેખ કર્યો નથી ત્યાં ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત રૂ. ૧૦ છે)				
અ. બજાર યાદીમાં હોય તેવા ઇક્વિટી શેર્સ ૧. ઇક્વિટી શેર્સ - સ્ટ્રેટેજિક રોકાણ ગુજરાત નર્મદાવેલી ફર્ટી. કું. લિ. ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. (મૂળ કિંમત રૂ. ૨) ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિ. ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કું. લિ. ટોરેન્ટ પાવર લિ. ગુજરાત લીઝ ફાઈનાન્સ લિ.	૩૩૨૨૭૫૪૬ ૧૫૦૭૯૯૯૦૫ ૧૫૩૨૯૩૭૩ ૩૫૨૪૧૫ ૪૬૮૭૧૬૨૧ ૧૩૨૮૧૨૫	૩૩૨૨૭૫૪૬ ૧૫૦૭૯૯૯૦૫ ૧૫૩૨૯૩૭૩ ૩૭૫૦૦ ૪૬૮૭૧૬૨૧ ૧૩૨૮૧૨૫	૧૩૫૩૧૫૩૧૭૫ ૨૫૨૩૭૯૬૧૭૨ ૧૭૩૩૧૫૨૫૦૫ ૨૬૩૮૩૮૨૫ ૧૭૮૮૫૯૨૬૦ ૭૧૪૯૨૨૦૯	૧૩૫૩૧૫૩૧૭૫ ૨૫૨૩૭૯૬૧૭૨ ૧૭૩૩૧૫૨૫૦૫ ૧૧૯૦૬૨૫ ૧૭૮૮૫૯૨૬૦ ૭૧૪૯૨૨૦૯
કુલ (૧)			૫૮૮૬૮૩૭૧૪૫	૫૮૬૧૬૪૩૯૪૫
૨. ઇક્વિટી શેર્સ - બિન સ્ટ્રેટેજિક રોકાણ દીગ્ગમ લિ. અતુલ પ્રોડક્ટ્સ લિ. બાટલીબોય એન્ડ કંપની લિ. (દાર્શનિક કિંમત રૂ. ૫ દરેકની) જી.એસ.એલ. (ઈન્ડીયા) લિ. ગુજરાત રાજ્ય નાણાંકીય નિગમ સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ લિ. (દાર્શનિક કિંમત રૂ. ૧ દરેકની) બેંક ઓફ બરોડા (દાર્શનિક કિંમત રૂ. ૨ દરેકની)	૧૨૩૪૭૪૪ ૧૩૦૫૯૪ ૩૮૮૯૫ ૧૫૭૧૪૦ ૯૩૫૬૦૦ ૫૦૫૨૬૫ ૨૫૦૦૦૦	૧૨૩૪૭૪૪ ૧૩૦૫૯૪ ૩૮૮૯૫ ૧૫૭૧૪૦ ૯૩૫૬૦૦ ૫૦૫૨૬૫ ૨૫૦૦૦૦	૧૮૮૦૨૬૯૬૯ ૧૪૦૯૬૧૨૯ ૧૦૨૫૮૭૬ ૧૫૭૧૪૦૦ ૧૮૭૧૨૦૦૦ ૯૨૮૭૨૮૭ ૧૧૦૧૨૫૦૦	૧૮૮૦૨૬૯૬૯ ૧૪૦૯૬૧૨૯ ૧૦૨૫૮૭૬ ૧૫૭૧૪૦૦ ૧૮૭૧૨૦૦૦ ૯૨૮૭૨૮૭ ૧૧૦૧૨૫૦૦
કુલ (૨)			૨૪૩૭૩૨૧૬૦	૨૪૩૭૩૨૧૬૦
કુલ (૧ + ૨)			૬૧૩૦૫૬૯૩૦૬	૬૧૦૫૦૧૫૦૬



સરવૈયાના ભાગરૂપે અનુસૂચિઓ (સ્ટેન્ડઅલોન)

રકમ રૂપિયામાં

	શેર્સની સંખ્યા		ચોપડે કિંમત રકમ રૂ.	
	૩૧-૩-૨૦૧૬ ના રોજ	૩૧-૩-૨૦૧૫ ના રોજ	૩૧-૩-૨૦૧૬ ના રોજ	૩૧-૩-૨૦૧૫ ના રોજ
અનુસૂચિ ૯. (ચાલુ) રોકાણો				
(બ) બજારયાદીમાં ન હોય તેવા રોકાણો				
(૧) ઈકિવટી શેર્સ નોન - સ્ટ્રેટેજીક રોકાણ કામા હોટલ્સ લિ.	૫૩૪૦	૫૩૪૦	૭૨૭૦૦	૭૨૭૦૦
ગુજરાત સ્ટેટ મશીન ટુલ્સ કું. લી. (દાર્શનિક કિંમત રૂ. ૧ દરેકની)	૧૮૨૮૦૫૦	૧૮૨૮૦૫૦	૨૦૦૦૦	૨૦૦૦૦
ગુજરાત સ્ટેટ ટ્રાન્સ રિસીવર્સ લી.	૧૨૦૦૦	૧૨૦૦૦	૧૦૦૦	૧૦૦૦
કુલ (૧)			૮૩૭૦૦	૮૩૭૦૦
(૨) ઈકિવટી શેર્સ - સ્ટ્રેટેજીક રોકાણો ભાવનગર એનર્જી. કોર્પોરેશન લિ. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પો. લી. (દાર્શનિક કિંમત રૂ. ૧ દરેકની)	૧૪૩૫૮૩૮૦૦	૧૪૩૫૮૩૮૦૦	૧૪૩૫૮૩૮૦૦૦	૧૪૩૫૮૩૮૦૦૦
	૧૮૨૫૮૨૪૪૧	૧૮૨૫૮૨૪૪૧	૧૫૫૮૮૮૮૭૭૨૬	૧૫૫૮૮૮૮૭૭૨૬
કુલ (૨)			૧૭૦૩૫૮૨૬૭૨૬	૧૭૦૩૫૮૨૬૭૨૬
કુલ (બ) (૧ + ૨)			૧૭૦૩૫૮૨૦૪૨૬	૧૭૦૩૫૮૨૦૪૨૬
કુલ (અ + બ)			૨૩૧૬૬૪૮૮૭૩૨	૨૩૧૪૧૨૮૬૫૩૨
બાદ :				
રોકાણોની કિંમતમાં ઘટાડાની જોગવાઈ				
રોકાણોની કુલ ચોપડે કિંમત			૨૮૦૮૨૨૧૫૪	૨૮૦૮૨૨૧૫૪
બજાર યાદીમાં હોય તેવા			૨૨૮૮૫૫૬૭૫૭૮	૨૨૮૬૦૩૭૪૩૭૮
રોકાણોની કુલ બજાર કિંમત			૨૬૪૭૪૫૮૭૩૫૩	૨૫૬૧૩૪૬૪૧૦૧



સરવૈયાના ભાગરૂપે અનુસૂચિઓ (સ્ટેન્ડઅલોન)

	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૬ ના રોજ	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૫ ના રોજ
૧૦. વિલંબિત કર - મિલકતો		
હિસાબી ધોરણ - ૨૨ “એકાઉન્ટીંગ ફોર ટેક્સ ઓન ઈન્કમ” અનુસાર અને કંપનીઓના (હિસાબી ધોરણ) નિયમ ૨૦૦૬ ની સૂચના અનુસાર કંપનીએ વિલંબીત કર અંગેની જોગવાઈ શરૂ કરેલ છે. હિસાબી ધોરણોની જોગવાઈઓનું પાલન અને સામાન્ય હાપણના આધારે કંપનીએ ઉપર મુજબના વિલંબીત કર (મિલકત / વિલંબીત કર (દેવા) ની જોગવાઈ શરૂ કરેલ છે.		
વિલંબીત કર મિલકત - ઘસારો	૭૦૨૨૨	૨૮૮૮૪
સંચિત ખર્ચ ચૂકવણી પર કપાતને પાત્ર	૨૮૬૬૦૭	૭૮૮૮૮
ચોખ્ખો વિલંબીત કર મિલકત	૩૬૬૮૨૯	૧૦૮૭૮૩
૧૧. લાંબાગાળાની લોન અને પેશગીઓ		
(અ) એડવાન્સ આવકવેરો (ચાલુ વર્ષની ચોખ્ખી જોગવાઈ રૂા. ૭,૪૭,૫૧,૨૮૭/- લાખ) આગલા વર્ષના રૂા. ૧૨,૩૧,૪૬,૨૧૩/- લાખ)	૩૮૭૬૮૬૩૮.૦૦	૮૮૫૩૪૩૦૬.૦૦
(બ) અન્ય લોન અને પેશગીઓ (બ્રીજ લોન) શંકાસ્પદ	૨૫૦૦૦૦૦.૦૦	૨૫૦૦૦૦૦.૦૦
બાદ : અન્ય શંકાસ્પદ લોન અને પેશગીની જોગવાઈ	૨૫૦૦૦૦૦.૦૦	૨૫૦૦૦૦૦.૦૦
કુલ	૩૮૭૬૮૬૩૮.૦૦	૮૮૫૩૪૩૦૬.૦૦
૧૨. રોકડ અને બેંક સિલક		
(૧) હાથ પર રોકડ	૧૧૮૧૬.૦૦	૭૦૦૩.૫૦
(૨) ચાલુખાતામાં બેંકમાં રોકડ :	૫૫૦૪૦૬૧૮૮.૮૪	૩૭૧૩૪૫.૪૪
જીએસએફસી પાસે ડિપોઝીટ	૨૦૪૩૬૭૫.૦૦	૪૫૪૩૬૭૫.૦૦
કુલ	૫૫૨૪૬૧૬૮૦.૮૪	૪૮૨૨૦૨૩.૮૪



સરવૈયાના ભાગરૂપે અનુસૂચિઓ (સ્ટેન્ડઅલોન)

રકમ લાખમાં

	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૬ ના રોજ	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૫ ના રોજ
૧૩. ટૂંકગાળાની લોન અને પેશગીઓ		
(અ) સિક્યોરીટી ડીપોઝીટ - સુરક્ષિત સારા ગણવામાં આવે તે	૧૨૬૩૨૧૫.૦૦	૪૦૦૦.૦૦
(બ) લોન અને પેશગી કર્મચારીઓને - સુરક્ષિત સારા ગણવામાં આવે તે		
(ક) અગાઉની ચૂકવેલ ખર્ચ - બીન તારણવાળા - સુરક્ષિત સારા ગણવામાં આવે તે	૨૮૫૭.૦૦	૨૮૮૪.૦૦
(ડ) સરકારી સત્તાધિકારીઓ પાસે સિલક / બેલેન્સ		
(૧) ફીન્જ બેનેફીટ ટેક્સ - રીફંડ	૪૦૨૬.૦૦	૪૦૨૬.૦૦
(૨) આવક વેરા રીફંડ	૦.૦૦	૭૪૬૭૧૭.૦૦
(ઈ) ઈન્ટર-કોર્પોરેટ ડીપોઝીટ બીન તારણવાળા-સુરક્ષિત સારા ગણવામાં આવે તે ગુજરાત રાજ્ય નાણાંકિય સેવા લીમિટેડ	૨૮૬૧૮૨૩૩૮૪.૦૦	૨૧૩૨૩૮૦૨૩૨.૦૦
કુલ	૨૮૬૩૦૮૩૪૮૨.૦૦	૨૧૩૩૧૩૭૮૬૮.૦૦
૧૪. અન્ય ચાલુ અસ્કયામતો		
રોકાણ ઉપરનું જમા થયેલ વ્યાજ	૧૩૦૬૦૦૨૪૪.૦૦	૧૦૬૩૮૬૪૪૧.૦૦
કુલ	૧૩૦૬૦૦૨૪૪.૦૦	૧૦૬૩૮૬૪૪૧.૦૦
૧૫. સંચાલનમાંથી મળેલ આવકની વિગતો		
(અ) રોકાણોમાંથી આવક		
(૧) ડીવીડન્ડ	૬૮૫૪૮૧૨૮૮.૫૦	૫૦૫૩૦૭૧૭૧.૦૦
(૨) રોકાણો પર વ્યાજ	૨૨૨૫૬૭૬૪૨.૦૦	૩૫૫૮૫૬૩૭૧.૦૦
કુલ	૯૦૮૦૪૮૮૩૧.૫૦	૮૬૧૨૬૩૫૪૨.૦૦
૧૬. અન્ય આવક		
૧. લાંબા ગાળાના રોકાણોની આગળ ખેંચેલી રકમના હવાલા આગળ ખેંચેલી રકમના ઘટાડાને ઉલટાવવો.	૦.૦૦	૧૦૬૦૮૩૫.૫૮
૨. રોકાણોના વેચાણો ઉપર નફો	૦.૦૦	૨૩૮૭૧૭૭૩૫.૨૪
૩. અસ્કયામતોના વેચાણ ઉપર નફો	૦.૦૦	૪૮૭.૭૦
૪. CPF ટ્રસ્ટના બાકી ચૂકવણાના હવાલા	૧૦૬૦૬૬.૦૦	૦.૦૦
૫. ઈન્કમેટેક્સ રીફંડ ઉપરનું વ્યાજ	૧૦૮૮૪૮૩૪.૦૦	૦.૦૦
કુલ	૧૧૦૦૦૮૦૦.૦૦	૨૪૦૭૭૮૧૬૮.૫૨



સરવૈયાના ભાગરૂપે અનુસૂચિઓ (સ્ટેન્ડઅલોન)

રકમ રૂપિયામાં

	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૬ ના રોજ	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૫ ના રોજ
૧૭. કર્મચારીઓના લાભાર્થે ખર્ચ		
(૧) પગાર	૨૭૯૧૦૫૪.૦૦	૨૭૧૮૨૮૫.૦૦
(૨) પ્રોવિડન્ટ ફંડ અને અન્ય ફંડમાં ફાળો	૪૪૮૩૦૮.૦૦	૪૫૮૦૦૭.૦૦
કુલ	૩૨૩૯૩૬૨.૦૦	૩૧૭૬૩૦૨.૦૦
૧૮. ફાઈનાન્સ ખર્ચ		
(૧) લોન ઉપરના વ્યાજનો ખર્ચ	૦.૦૦	૦.૦૦
(૨) આવકવેરા વિભાગને ચુકવેલ વ્યાજ ખર્ચ	૭૯૮૮૬.૦૦	૦.૦૦
કુલ	૭૯૮૮૬.૦૦	૦.૦૦
૧૯. અન્ય ખર્ચ		
પાવર અને બળતણ ખર્ચ	૧૧૦૦૮૪.૦૦	૭૩૪૨૫.૦૦
ઓફીસ ભાડુ	૨૨૯૭૭૫૬.૦૦	૪૭૮૫૦૦.૦૦
રીપેર્સ અને મેઈન્ટેનન્સ	૦.૦૦	૧૦૧૨૮.૦૦
વીમો	૫૧૬૪.૦૦	૫૪૫૬.૦૦
દર અને કરવેરા	૭૪૪૦૩.૦૦	૮૦૦૬૦.૦૦
માહિતી સંચાર ખર્ચ	૪૬૪૧૩.૦૦	૨૬૪૪૮.૦૦
પ્રવાસ અને વાહન ખર્ચ	૧૩૬૧૬૩.૦૦	૧૦૬૨૩૭.૦૦
પ્રિન્ટીંગ અને સ્ટેશનરી ખર્ચ	૮૨૧૭૫.૫૦	૬૯૩૪૫.૦૦
કાનૂની અને વ્યવસાયી ખર્ચ	૩૧૨૬૫૭.૦૦	૮૬૫૮૭.૦૦
ઓડીટરને ચુકવણી	૮૩૮૭૪.૦૦	૮૮૩૧૫.૦૦
સ્ટેમ્પ ડ્યુટી ખર્ચ	૧૪૫૬૦૦.૦૦	૦.૦૦
સર્વિસ ટેક્સ	૨૮૧૫૭.૦૦	૦.૦૦
પરચુરણ ખર્ચ	૮૨૮૦૫૦.૦૦	૧૫૨૫૪૨.૦૦
જાહેરાત ખર્ચ	૦.૦૦	૧૦૨૦.૦૦
અગાઉના સમયગાળાનો ખર્ચ	૦.૦૦	૦.૦૦
કોર્પોરેટ સામાજિક જવાબદારીઓનો ખર્ચ	૭૩૬૦૪૦૪.૦૦	૪૧૮૮૬૩૬.૦૦
રજીસ્ટ્રેશન ફી	૪૨૮૫૦.૦૦	૦.૦૦
કુલ	૧૧૫૬૪૭૫૦.૫૦	૫૩૯૭૬૮૮.૦૦



સરવૈયાના ભાગરૂપે અનુસૂચિઓ (સ્ટેન્ડઅલોન)

૨૦. આ માત્ર મૂડીરોકાણ કંપની હોવાથી, કંપની અધિનિયમ ૨૦૧૩ ના પરિશિષ્ટ ૩ ના પેરા નં. ૪(એ) અને (બી) ની જોગવાઈઓ લાગુ પડતી નથી.
૨૧. કંપની એક્ટ, ૨૦૧૩ મુજબ બાકી રહેલી અસ્કયામતોના ઉપયોગી વર્ષો ગણી ઘસારો ડબલ્યુ ડી. વી પ્રમાણે ગણવામાં આવેલ છે.
૨૨. સેગમેન્ટ રીપોર્ટીંગ :
કંપની એક જ બીઝનેસ સેગમેન્ટમાં કાર્યરત છે. તેથી એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ “એ.એસ. ૧૭ સેગમેન્ટ રીપોર્ટીંગ” મુજબ અલગ ડિસ્ક્લોઝર કરવાનું રહેતું નથી.
૨૩. કંપની હિસાબી ધોરણો નિયમ, ૨૦૦૬ (કંપનીઝ એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ રૂલ્સ, ૨૦૦૬)ની જોગવાઈઓ પ્રમાણે હિસાબી ધોરણ “એએસ ૧૮” હેઠળ સંબંધિત પાર્ટી સાથેના વ્યવહારોનું ડિસ્ક્લોઝર નીચે મુજબ છે.
(અ) કંપની રાજ્ય સરકાર દ્વારા નિયંત્રિત એકમ હોવાથી એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ એ.એસ. ૧૮ મુજબ અન્ય રાજ્ય દ્વારા નિયંત્રિત એકમ સાથે થયેલ વ્યવહાર જણાવવાની જરૂર રહેતી નથી.
(બ) કી મેનેજરીયલ પર્સોનલ (KMP) સાથે કંપનીએ વ્યવહારો કરેલ નથી.
૨૪. કર્મચારીઓના લાભો :
કર્મચારીઓના લાભો કંપની (એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ) નિયમ, ૨૦૦૬ મુજબ એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ ૧૫ “એમ્પ્લોઈઝ બેનિફીટ” ને લગતી માહિતી નીચે મુજબ છે.
(અ) વર્તમાન જવાબદારીઓના મૂલ્યમાં વધઘટ (૩૧મી માર્ચ ૨૦૧૬ ની સ્થિતિએ) (રકમ રૂપિયા)

વિગત	ગ્રેયુઈટી માર્ચ ૩૧, ૨૦૧૬	ગ્રેયુઈટી માર્ચ ૩૧, ૨૦૧૫	રજાનો પગાર માર્ચ ૩૧, ૨૦૧૬	રજાનો પગાર માર્ચ ૩૧, ૨૦૧૫
વર્ષની શરૂઆતમાં જવાબદારી	૪૯૧૦૪૪	૩,૪૮,૩૫૫	૨૬૭૧૮૭	૧૭૮૯૨૮
સર્વિસ કોસ્ટ	૪૬,૮૪૭	૨૨,૨૦૬	૨૨,૭૧૧	૨૦,૦૩૪
વ્યાજ ખર્ચ	૩૭,૭૩૭	૩૧,૧૮૭	૨૦,૪૭૮	૧૫,૮૨૧
એકુઅલ (ગેઈન) લોસ ઓન ઓબ્લીગેશન	(૨૭૦૪૪)	૮૮,૨૮૬	(૧૮૧૫)	૫૨,૪૦૪
બેનીફીટ પેઈડ/ચુકવેલ લાભ	૦	૦	૦	૦
વર્ષને અંતે જવાબદારીની હાલની કિંમત	૫૪૮,૫૮૪	૪,૮૧,૦૪૪	૩૦૮,૪૬૨	૨૬૭,૧૮૭

- (બ) ગ્રેયુઈટીની જોગવાઈ કરવામાં આવેલ નથી તેથી તેને લગતી અસ્કયામતોની વિગત આપવામાં આવેલ નથી.
(ક) સરવૈયામાં જોગવાઈ કરવામાં આવેલી રકમ. (રકમ રૂપિયા)

વિગત	ગ્રેયુઈટી માર્ચ ૩૧, ૨૦૧૬	ગ્રેયુઈટી માર્ચ ૩૧, ૨૦૧૫	રજાનો પગાર માર્ચ ૩૧, ૨૦૧૬	રજાનો પગાર માર્ચ ૩૧, ૨૦૧૫
વર્ષને અંતેની જવાબદારીની હાલની કિંમત	૫૪૮,૫૮૪	૪,૮૧,૦૪૪	૩,૦૮,૪૬૨	૨,૬૭,૧૮૭
વર્ષને અંતે પ્લાન અસ્કયામતોની ફેર કિંમત	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
નવી અસ્કયામતો/(જવાબદારી) બેલેન્સશીટમાં દર્શાવ્યા મુજબ	૫૪૮,૫૮૪	૪૮૧,૦૪૪	૩૦૮,૪૬૨	૨,૬૭,૧૮૭



(ડ) નફા-નુકશાન ખાતામાં જોગવાઈ કરવામાં આવેલી રકમ :

(રકમ રૂપિયામાં)

વિગત	ગ્રેયુઈટી માર્ચ ૩૧, ૨૦૧૬	ગ્રેયુઈટી માર્ચ ૩૧, ૨૦૧૫	રજાનો પગાર માર્ચ ૩૧, ૨૦૧૬	રજાનો પગાર માર્ચ ૩૧, ૨૦૧૫
કરન્ટ સર્વિસ કોસ્ટ	૪૬,૮૪૭	૨૨,૨૦૬	૨૨,૭૧૧	૨૦,૦૩૪
વ્યાજ ખર્ચ	૩૭,૭૩૭	૩૧,૧૮૭	૨૦,૪૭૮	૧૫,૮૨૧
૨૦૧૪-૧૫ના વર્ષ દરમિયાન નેટ એક્યુઅલ (ગેઈન)/લોસ	(૨૭૦૪૪)	૮૮,૨૮૬	(૧૮૧૫)	૫૨,૪૦૪
નફા-નુકશાન ખાતામાં દર્શાવેલ ખર્ચ	૫૭,૫૪૦	૧૪૨,૬૮૮	૪૧,૨૭૫	૮૮,૨૫૯

(ઈ) માન્યતાઓ :

(રકમ રૂપિયામાં)

વિગત	ગ્રેયુઈટી માર્ચ ૩૧, ૨૦૧૬	ગ્રેયુઈટી માર્ચ ૩૧, ૨૦૧૫	રજાનો પગાર માર્ચ ૩૧, ૨૦૧૬	રજાનો પગાર માર્ચ ૩૧, ૨૦૧૫
મોર્ટાલીટી ટેબલ (એલ.આઈ.સી.)	૨૦૦૬-૦૮ (અંતિમ)	૧૯૯૪-૯૬ (અંતિમ)	૨૦૦૬-૦૮ (અંતિમ)	૧૯૯૪-૯૬ (અંતિમ)
ડિસ્કાઉન્ટ રેટ/વળતરનો દર	૭.૬%	૭.૮%	૭.૬%	૭.૮%
વળતરના લેવલમાં વધારાનો દર	૫.૦%	૫.૦%	૫.૦%	૫.૦%
પ્લાસ અસ્કયામતો ઉપર વળતરનો દર	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી

૨૫. એક્યુરિયલ વેલ્યુમાં પગારની વૃદ્ધિમાં ગણતરી કરતી વખતે ફુગાવો, સિનિયોરીટી, પ્રશમોશન અને બીજાં પરિબળો જેવાં કે, એમ્પ્લોયમેન્ટ માર્કેટમાં ડિમાન્ડ-સપ્લાયની ગણતરી કરવામાં આવેલ છે. આ અંગેની માહિતી એક્યુરિએ પ્રમાણિત કરેલ છે.

એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ ૧૫ (રીવાઈઝ્ડ ૨૦૦૫) ની માર્ગદર્શિકા જે ઈન્સ્ટીટ્યુટ ઓફ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાએ નિર્દિષ્ટ કરેલ છે. તેમાં કંપની દ્વારા સ્થાપિત કર્મચારી ભવિષ્યનિષિ ફંડને નિયુક્ત લાભ તરીકે ગણવામાં આવે છે. કારણ કે કંપનીને વર્ષને અંતે લઘુત્તમ વળતર રળવાનું હોય છે. કોઈ પણ પ્રકારની ખાદ્ય (નુકશાન)ની જોગવાઈ ના કરી હોય તેવું બન્યું નથી. તે અને રૂ. ૪૦૬૮૮ (ગત વર્ષે રૂ. ૬૮૦૮૫ ખર્ચ તરીકે) કંપનીની પ્રોવિડન્ડ ફંડની હેઠળ “વધારાની રકમની જોગવાઈ” તરીકે નફા-નુકશાન ખાતામાં જમા કરેલ છે.

૨૬. રોકડ અને રોકડ સમકક્ષ :

રોકડ પ્રવાહ પત્રકના હેતુ માટે રોકડ સમકક્ષ એટલે બેંકમાં રહેલ રોકડ અને હાથ પરની રોકડ તેમજ જી.એસ.એફ.એસ.માં જમા લીક્વીડ ડિપોઝીટનો સમાવેશ કરેલ છે.

૨૭. ઓડિટર્સનું મહેનતાણુ

(રકમ રૂપિયામાં)

વિગત	૨૦૧૫-૧૬	૨૦૧૪-૧૫
કાયદાકિય ઓડિટ પેટે	૧૭૪૨૧.૦૦	૧૬૮૫૪.૦૦
ટેક્સ ઓડિટ ફી પેટે	૧૪૫૧૮.૦૦	૧૪૦૪૫.૦૦
આંતિક ઓડિટ ફી પેટે	૨૮૬૨૫.૦૦	૨૮૦૮૦.૦૦
ઈ.પી.એફ. ટ્રસ્ટ ઓડિટ ફી પેટે	૨૮૬૩.૦૦	૧૧૨૩૬.૦૦
સેક્રેટરીયલ ઓડિટ ફી પેટે	૨૩૩૧૦.૦૦	૨૮૦૮૦.૦૦



૨૮. શેર ઉપરની આવક	૨૦૧૫-૧૬	૨૦૧૪-૧૫
આપેલા સમયગાળાનો નફો/ખોટ	૮૨૮૦૨૦૮૩૭	૮૬૮૮૪૮૪૮૬
વેઈટેડ એવરેજ મુજબ શેરની સંખ્યા (ફેસ વેલ્યુ રૂા. ૧૦ પ્રતિ શેર)		
શેર ઉપરની આવક (મૂળ/ઘટાડેલ)	૧૦૪૨૭૬૮૦૭૦	૧૦૪૨૭૬૮૦૭૦
(મૂળકિંમત રૂા. ૧૦ પ્રતિશેર)	૦.૮૦	૦.૮૩

૨૯. કન્ટીજન્ટ જવાબદારી :

આકારણી વર્ષ ૨૦૦૧-૦૨, ૨૦૦૪-૦૫, ૨૦૦૬-૦૭, ૨૦૧૦-૨૦૧૧, ૨૦૧૧-૧૨, ૨૦૧૨-૧૩, ૨૦૧૩-૧૪ ના આવક વેરાની ચૂકવણી વિવાદાસ્પદ હોવાથી દેવા ખાતે ઉધારેલ નથી. કંપની અપીલમાં ગયેલ છે અને આજની તારીખે કંપનીનાં નાણાંકિય પત્રકોમાં કંપની સામે કોઈ રકમની ડિમાન્ડ બાકી નથી.

૩૦. અગાઉના નાણાંકિય વર્ષની રકમો ચાલુ વર્ષના કલાસીફિકેશન/ડિસ્ક્લોઝરની જરૂરિયાત મુજબ રીચુપ/રીકાસ્ટ/રીકલાસીફાય અને રીએરેન્જ કરવામાં આવી છે.

૩૧. ભાવનગર એનર્જી કંપની લીમિટેડ (BECT) ના પ્રમોટર તરીકે કંપનીએ સ્પોન્સર્સ સપોર્ટ એગ્રીમેન્ટ (SSA) કરેલ છે અને આ (એગ્રીમેન્ટ) કરાર હેઠળ, પ્રોત્સાહકો (પ્રમોટર્સ) લેવડ-દેવડની અંતિમ તારીખ સુધી એ તારીખ કે જ્યારે SSA હેઠળનું બધું ઋણ બિનશરતે અને રદબાતલ ન થઈ શકે તે રીતે લેણદારોના સંપૂર્ણ સંતોષ સાથે ચુકવાઈ જાય. સંપૂર્ણપણે તેમનું શેરહોલ્ડીંગ વેચી શકશે નહીં / નિકાલ કરી શકશે નહીં કે જેને લીધે તેમનું શેરહોલ્ડીંગ ઘટીને ૫૧%ની નીચે પરિણમે.

સાથે બીડેલ અહેવાલ મુજબ
જે. પી. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વતી,
રજીસ્ટ્રેશન નંબર : ૧૦૮૬૧૨W
(સી.એ. નિરવ જે. શાહ)
પાર્ટનર
સભ્ય નંબર : ૧૦૭૭૧૭
સ્થળ : અમદાવાદ
તારીખ : ૨૮-૧૦-૨૦૧૬

નિયામક મંડળ અને તેમના વતી
ગુજરાત સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ લીમિટેડ

વહીવટી સંચાલક | સંચાલક | કંપની સચિવ | મુખ્ય નાણાકિય અધિકારી

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૨૮-૧૦-૨૦૧૬



એકત્રિત નાણાકિય પત્રકો ઉપર સ્વતંત્ર ઓડિટરનો અહેવાલ

ગુજરાત રાજ્ય મૂડીરોકાણ લિમિટેડ ના

સભાસદો જોગ

એકત્રિત નાણાકિય પત્રકો પરનો અહેવાલ

અમે ગુજરાત રાજ્ય મૂડીરોકાણ લિમિટેડ (રોકાણકાર કંપની) ના સંલગ્ન એકત્રિત નાણાકિય પત્રકોનું અને તેની સહયોગી કંપનીઓ (સંયુક્ત રીતે “કંપની” કે “ગ્રુપ” તરીકે નિર્દેશીત) ના ૩૧ માર્ચ ૨૦૧૬ ના રોજ રોજના સરવૈયા, નફાનુકશાનના એકત્રિત પત્રકો, જે તે તારીખે પુરા થતા વર્ષનો રોકડ પ્રવાહ, એકાઉન્ટીંગ પોલીસી (નીતિઓ) નો મહત્વનો સંક્ષિપ્ત સારાંશ અને અન્ય ખુલાસાત્મક માહિતી (હવેથી “એકત્રિત નાણાકિય પત્રકો” તરીકે ઉલ્લેખ) નું ઓડિટ કરેલ છે.

એકત્રિત નાણાકિય પત્રકો માટે સંચાલક મંડળીની જવાબદારી

કંપની અધિનિયમ ૨૦૧૩ ની કલમ (હવેથી “અધિનિયમ” તરીકે ઉલ્લેખ કરેલ) ને કંપનીના (એકાઉન્ટ્સ) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૭ ની સાથે વાંચતા કરેલી જોગવાઈઓ હેઠળ, કંપનીનું નિયામક મંડળ એકત્રિત નાણાકિય પત્રકો કે જે કંપનીની સાચી કામગીરી, કંપનીની સાચી નાણાકિય સ્થિતિ અને સાચો રોકડ પ્રવાહ દર્શાવતા હોય એ રીતે તૈયાર કરવા માટે જવાબદાર છે. કંપનીનું નિયામક મંડળ, અધિનિયમની જોગવાઈઓ અનુસાર સંપૂર્ણ એકાઉન્ટીંગ રેકૉર્ડ રાખવા માટે પણ જવાબદાર છે જેથી કંપનીની અસ્કયામતોનું રક્ષણ થઈ શકે અને ઠગાઈ જેવી અન્ય ગેરરીતિઓને રોકી શકાય., નિયામક મંડળ કંપનીની યોગ્ય હિસાબી નીતિઓને પસંદ કરવા અને તેનું અમલીકરણ કરવા, અને સંપૂર્ણ આંતરિક નાણાકિય નિયંત્રણો ગોઠવવાં કે જેથી એકાઉન્ટીંગ રેકૉર્ડ અસરકારક અને પરિપૂર્ણતાપૂર્વક કામગીરી કરે જેવી બાબતો માટે પણ જવાબદાર છે. નિયામક મંડળ, નાણાકિય પત્રકો તૈયાર કરવા માટે અને એવી રીતે રજૂ કરવા માટે પણ જવાબદાર છે કે જે ઠગાઈ કે એવી અન્ય ગેરરીતિઓ કે અન્ય કોઈ કારણોસર કરવામાં આવેલ ખોટું નિવેદન, જેવી બાબતોથી મુક્ત હોય અને કંપનીનું યોગ્ય અને વ્યાજબી ચિત્ર રજૂ કરી શકે અને જેનાથી કંપનીના નિયામકોને એકત્રિત નાણાકિય પત્રકો તૈયાર કરવામાં મદદરૂપ થઈ શકે.

ઓડિટરની જવાબદારી

અમારી જવાબદારી, એકત્રિત નાણાકિય પત્રકોના ઓડિટને આધારે અમારો અભિપ્રાય આપવાની છે. ઓડિટની કામગીરી દરમિયાન અમે, અધિનિયમ અને તેની હેઠળના નિયમોમાં દર્શાવેલ જોગવાઈઓ અનુસાર એકાઉન્ટીંગ અને ઓડિટીંગના ધારાધોરણો અને સમાવેશ કરવા લાયક અન્ય બાબતો પણ ધ્યાનમાં લીધેલ છે.

અમે અધિનિયમની કલમ ૧૪૩ (૧૦) હેઠળના (સ્ટાન્ડર્ડ ઓફ એકાઉન્ટીંગ) એકાઉન્ટીંગના ધારાધોરણ પ્રમાણે ઓડિટ હાથ પર ધરેલ છે. આ સ્ટાન્ડર્ડ હેઠળ અમારી એ ફરજ છે કે કંપનીના એકત્રિત નાણાકિય પત્રકો કોઈ પણ ખોટી માહિતી રજૂ ન કરે અને અમે એની પણ ખાત્રી આપીએ કે કંપનીની નિતિમત્તા વિષયક જરૂરિયાતો, આયોજન અને કાર્યપદ્ધતિ યોગ્ય છે.

ઓડિટમાં કાર્યદક્ષતા પ્રણાલીનો પણ સમાવેશ થાય છે કે જે ધ્વારા અમે આવકો અને તેની એકત્રિત નાણાકિય પત્રકોમાં ઘટસ્ફોટ/જાહેરાતના પુરાવા મેળવી શકીએ. આ કાર્યપદ્ધતિની પસંદગી ઓડિટરના ચુકાદા (જજમેન્ટ) ને આધારે કરવામાં આવે છે. કે જેમાં ઠગાઈ કે અન્ય કારણોસર કરવામાં આવેલા ગેરનિવેદનો જેવાં જોખમોના મુલ્યાંકનનો પણ સમાવેશ થઈ જાય છે. ઓડિટર કંપનીના આંતરિક નાણાકિય નિયંત્રણ કે જે કંપનીના એકત્રિત નાણાકિય પત્રકો કે જે કંપનીનું યોગ્ય અને વ્યાજબી ચિત્ર રજૂ કરતા હોય તે માટે જરૂરી છે. તેને ધ્યાનમાં લઈને ઓડિટ પ્રક્રિયાનું સંજોગો અનુસાર આયોજન કરે છે. ઓડિટમાં કંપનીના નિયામક મંડળે રજૂ કરેલા એકત્રિત નાણાકિય પત્રકો, (એકાઉન્ટીંગ પોલીસીઓ) હિસાબી નિતિઓની યોગ્યતા કે જેનો ઉપયોગ હિસાબો અંદાજો બાંધવા માટે થાય છે જેવી બાબતોનું યોગ્ય મુલ્યાંકન કરવું વગેરેનો પણ સમાવેશ થાય છે.

અમે માનીએ છીએ કે એકત્રિત નાણાકિય પત્રકો તૈયાર કરવામાં અમે અમારો અભિપ્રાય આપવા માટે પૂરતા અને યોગ્ય પુરાવાઓ મેળવાય છે.

અભિપ્રાય :

અમારા અભિપ્રાય પ્રમાણે અને અમને આપેલી માહિતી અને ખુલાસોઓને આધારે ઉપરોક્ત નાણાકિય પત્રકો અધિનિયમ હેઠળ જરૂરી માહિતી પૂરી પાડે છે અને સર્વ સ્વીકૃત એકાઉન્ટીંગ પોલીસીઓના અનુસંધાને જરૂરી કંપનીનું સાચું અને સાદું



ચિત્ર રજૂ કરે છે અને ૩૧ માર્ચ ૨૦૧૬ની સ્થિતિએ કંપનીના સંયુક્ત નફાનું અને સંયુક્ત રોક પ્રવાહનો સારો અને સાચો દેખાવ રજૂ કરે છે.

જરૂરીયાતો અને અન્ય કાનુની બાબતો ઉપર અહેવાલ :

અધિનિયમની કલમ ૧૪૩ની પેટા-કલમ ૩ની જરૂરિયાત હેઠળ અમે લાગૂ પડતી મર્યાદા સુધી જણાવીએ છીએ કે

- (અ) અમે અમારા શ્રેષ્ઠ જ્ઞાન અને માન્યતા અનુસાર, ઉપરોક્ત એકત્રિત નાણાકીય પત્રકોના ઓડિટ માટે જરૂરી તમામ માહિતી અને ખુલાસાઓ અમારા સંપૂર્ણ જ્ઞાન અને માન્યતા અનુસાર મેળવ્યા છે.
- (બ) અમારા મતે, ઉપરોક્ત નાણાકીય પત્રકો તૈયાર કરવા માટે જરૂરી યોગ્ય બુક્સ ઓફ એકાઉન્ટ્સ રાખવામાં આવેલ છે જે અમારા સદરહુ બુક્સના પરીક્ષણ ઉપરથી ફલિત થાય છે.
- (ક) એકત્રિત નાણાકીય પત્રકો તૈયાર કરવા માટે જરૂરી બુક્સ ઓફ એકાઉન્ટ અને આ રિપોર્ટ સાથે રજૂ કરવામાં આવેલ એકત્રિત સરવૈયું, એકત્રિત નફા-નુકસાન પત્રક અને એકત્રિત રોકડ પ્રવાહનું પત્રક એકબીજા સાથે મેળ ખાય છે.
- (ડ) અમારા અભિપ્રાય પ્રમાણે, ઉપરોક્ત એકત્રિત નાણાકીય પત્રકો, અધિનિયમની કલમ ૧૩૩ની સાથે કંપનીના (એકાઉન્ટ્સ) નિયમો, ૨૦૧૪ના નિયમ ૭ વાંચતાં તેમાં નિર્દેશિત એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ સાથે મેળ ખાય છે / અનુસરે છે.
- (ઈ) ૩૧મી માર્ચ ૨૦૧૬ના રોજ કંપનીના નિયામક મંડળ દ્વારા રેકર્ડ ઉપર લેવાયેલ અને કંપનીના નિયામકો પાસેથી જ મેળવેલ રજૂઆતોને આધારે અને ભારતની તેની સહયોગી કંપનીઓના સરકારી ઓડિટરોએ આપેલ રિપોર્ટને આધારે, કોઈપણ ગ્રુપ કંપનીના ડાયરેક્ટર, ૩૧ માર્ચ ૨૦૧૬ની સ્થિતિએ, કંપની અધિનિયમની કલમ ૧૬૪ની પેટા કલમ-૨ હેઠળની જોગવાઈઓ અનુસાર જે તે કંપનીના નિયામક તરીકે નિમણૂક પામવા માટે ગેરલાયક ઠરેલ નથી.
- (એફ) કંપનીના આંતરિક નાણાકીય નિયંત્રણ, તેની પરિપૂર્ણતા અને કાર્યકારી અસરકારકતા માટે અમારું અલગ પરિશિષ્ટ 'એ' અને
- (જી) કંપનીના (ઓડિટ અને એકાઉન્ટ્સ) નિયમો, ૨૦૧૪ના નિયમ ૧૧ની જોગવાઈઓ અનુસાર કંપનીના ઓડિટ રિપોર્ટમાં સમાવવા યોગ્ય અન્ય બાબતો વિશે અમારા મતે અને અમારી પ્રાપ્ત શ્રેષ્ઠ માહિતી અને અમને આપવામાં આવેલ ખુલાસાઓને આધારે
 - (૧) એકત્રિત નાણાકીય પત્રકો, બાકી કાનુની દાવાઓની, ગ્રુપ કંપનીની એકત્રિત નાણાકીય સ્થિતિ ઉપર પડતી અસર દર્શાવે છે. એકત્રિત નાણાકીય પત્રકોની નોંધ ૨૯ જુઓ.
 - (૨) ગ્રુપ પાસે એવા કોઈ લાંબા ગાળાના કરારો કે અન્ય કોઈ કરારો નથી જેનાથી ગ્રુપને કોઈ વાસ્તવિક નુકસાન થાય.
 - (૩) "ઈન્વેસ્ટર્સ એજ્યુકેશન પ્રોટેક્શન ફન્ડ"માં તબદીલ કરવા પાત્ર રકમને તબદીલ કરવામાં વિલંબ કરવામાં આવેલ નથી.

જે.પી.શાહ એન્ડ કું. વતી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
એફ.આર.એન. : ૧૦૮૬૧૨W
(સી.એ. નિરવ જે. શાહ)
ભાગીદાર
મેમ્બરશીપ નં. ૧૦૭૭૧૭

સ્થળ : અમદાવાદ
તા. ૨૮/૧૦/૨૦૧૬



ઓડિટરના રિપોર્ટનું પરિશિષ્ટ - એ

કંપની અધિનિયમ, ૨૦૧૩ (અધિનિયમ)ની કલમ ૧૪૩ની પેટા કલમ ૩ હેઠળ કંપનીના આંતરિક નાણાકીય નિયંત્રણનો અહેવાલ

અમે ગુજરાત રાજ્ય મૂડીરોકાણ લિમિટેડ કંપનીના ૩૧ માર્ચ ૨૦૧૬ના રોજ પુરા થતા વર્ષના એકત્રિત નાણાકીય પત્રકોનું ઓડિટ કરવાની સાથે સાથે અમે સદરહુ કંપની અને તેની ભારતમાં નોંધાયેલી સહયોગી કંપનીઓના નાણાકીય અહેવાલો ઉપરના આંતરિક નાણાકીય નિયંત્રણનું પણ ઓડિટ કર્યું છે.

આંતરિક નાણાકીય નિયંત્રણ માટે સંચાલન (મંડળ)ની જવાબદારી :

ભારતની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થા દ્વારા પ્રસ્થાપિત નાણાકીય અહેવાલ ઉપરના આંતરિક નાણાકીય નિયંત્રણ વિષયક ઓડિટની માર્ગદર્શક નોંધમાં જણાવ્યા પ્રમાણેનાં જરૂરી પરિબળોને ધ્યાનમાં લઈ કંપનીના નિયામકો, કંપનીના નાણાકીય અહેવાલો ઉપરના આંતરિક નાણાકીય નિયંત્રણને પ્રસ્થાપિત કરવા અને તેનું અમલીકરણ કરવા માટે જવાબદાર છે. આ જવાબદારીઓમાં આંતરિક નાણાકીય નિયંત્રણની રચના, અમલીકરણ અને નિભાવનો પણ સમાવેશ થાય છે. સાથે સાથે, આ નિયંત્રણ કંપનીની નીતિઓ અને અસ્ક્યામતોનું રક્ષણ કરવામાં અને સક્ષમ રીતે ધંધો કરવામાં અને ઠગાઈ તથા અન્ય પ્રકારની ગેરરીતિઓ શોધી કાઢવામાં અને તેને અટકાવવામાં તથા એકાઉન્ટીંગ રેકૉર્ડની પરિપૂર્ણતા અને આધારભૂત નાણાકીય માહિતી સમયસર તૈયાર થાય તેમાં મદદરૂપ થાય એ બાબત જોવાની પણ છે.

ઓડિટરની જવાબદારી :

અમારી જવાબદારી કંપનીના નાણાકીય અહેવાલ ઉપર આંતરિક નાણાકીય નિયંત્રણ અંગે અમારો ઓડિટ આધારિત અભિપ્રાય આપવાની છે. અમે ભારતની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થા દ્વારા પ્રસ્થાપિત માર્ગદર્શક નોંધમાં જણાવ્યા પ્રમાણેના નાણાકીય અહેવાલો ઉપરના આંતરિક નાણાકીય નિયંત્રણ અંગેના ધારાધોરણોને આધારે ઓડિટ કરીએ છીએ અને ઓડિટનાં આ ધારાધોરણો કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૪૩(૧૦) નીચે દર્શાવવામાં આવેલ છે. આ ધારાધોરણ અને માર્ગદર્શક નોંધ અન્વયે અમે કંપનીની નીતિવિષયક જરૂરિયાતો, આયોજન વગેરે બાબતે ઓડિટની કામગીરી કરીએ છીએ કે જેનાથી, કંપનીના નાણાકીય અહેવાલો ઉપરનું આંતરિક નાણાકીય નિયંત્રણ યોગ્ય રીતે કાર્યવાહી કરે છે અને વાસ્તવિક રીતે અસરકારક છે તેની યોગ્ય ખાતરી આપી શકાય. અમણા ઓડિટમાં કામગીરીની એવી પ્રક્રિયાનો સમાવેશ થાય છે કે જેનાથી નાણાકીય અહેવાલો ઉપરના આંતરિક નાણાકીય નિયંત્રણની પરિપૂર્ણતા અને અસરકારકતા જાણી શકાય. નાણાકીય અહેવાલો ઉપરના આંતરિક નાણાકીય નિયંત્રણના ઓડિટમાં અમે એ પણ અંદાજ કાઢીએ છીએ કે કંપનીમાં કોઈ વાસ્તવિક નબળાઈ છે અને જોખમી પરિબળોનું મુલ્યાંકન કરીને આંતરિક નાણાકીય નિયંત્રણની અસરકારકતાનું પણ મુલ્યાંકન કરીએ છીએ. આ માટે સ્વીકારેલ/પસંદ કરેલી કાર્ય પદ્ધતિ ઓડિટરના ન્યયીક નિર્ણય ઉપર આધારિત હોય છે કે જેમાં ઠગાઈ કે અન્ય ગેરરીતિઓ જેવાં પરિબળોને લીધે, નાણાકીય પત્રકોમાં કોઈ ખોટી રજુઆત તો નથી થઈને જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. અમે માનીએ છીએ કે અમે એકત્રિત કરેલા ઓડિટ પુરાવા પુરતા અને યોગ્ય છે એ સાબિત કરવા માટે કે જે કંપનીના નાણાકીય અહેવાલો ઉપરના આંતરિક નાણાકીય નિયંત્રણને જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડે છે.

નાણાકીય અહેવાલો ઉપરના આંતરિક નાણાકીય નિયંત્રણનો અર્થ :-

સર્વસ્વીકૃત એકાઉન્ટીંગ સિદ્ધાંતોના અનુસંધાને, કંપનીના નાણાકીય અહેવાલો ઉપર આંતરિક નાણાકીય નિયંત્રણ એ, નાણાકીય અહેવાલો અને નાણાકીય પત્રકો તૈયાર કરવા માટે યોગ્ય ભરોસો પૂરો પાડવા માટેની એક પ્રક્રિયા છે. કંપનીના નાણાકીય અહેવાલો ઉપર આંતરિક નાણાકીય નિયંત્રણમાં આ નીતિઓ અને પ્રણાલીઓનો સમાવેશ થાય છે. (૧) જરૂરી વિસ્તાર, ચોકસાઈ અને કંપનીનો અસ્ક્યામતોનો નિકાલ તેમજ અન્ય વ્યવહારોની એવી રીતે નોંધણી કરવી કે જેથી નાણાકીય પત્રકો તૈયાર કરવામાં સુગમતા રહે (૨) જરૂરી ખાત્રી પૂરી પાડી શકાય કે નાણાકીય અહેવાલો સ્વિકૃત નાણાકીય સિદ્ધાંતો મુજબ તૈયાર કરવામાં આવ્યા છે. અને કંપનીની આવકો અને જાવકો માત્ર સંચાલક મંડળ અને નિયામકશ્રીની મંજૂરીથી જ કરવામાં આવે અને (૩) કંપનીની એવી અસ્ક્યામતો કે જેની નાણાકીય પત્રકો ઉપર વાસ્તવિક વિપરીત અસર થતી હોય તેની અસ્ક્યામતોનું અનઅધિકૃત અધિગ્રહણ, ઉપયોગ અને નિકાલ જેવી બાબતોને સમયસર શોધી કાઢી તેને



અટકાવવા માટેની જરૂરી ખાતરી પૂરી પાડવી.

નાણાકીય અહેવાલો ઉપરના આંતરિક નાણાકીય નિયંત્રણની અંગભૂત મર્યાદાઓ :

નાણાકીય અહેવાલો ઉપરના આંતરિક નાણાકીય નિયંત્રણમાં રહેલી કેટલીક અંગભૂત મર્યાદાઓ જેવી કે, પ્રતિસ્પર્ધાઓ વચ્ચેના પ્રપંચ અથવા અયોગ્ય સંચાલન નિયંત્રણ ઉપર વધુ ઘેરી અસર કરે તેવી શક્યતા હોય છે. ઠગાઈ કે કોઈ અન્ય કારણસર થયેલી ભૂલને લીધે અસરકારક ખોટો અહેવાલ/વિધાન થાય છે જેને શોધી શકાતો નથી. આ ઉપરાંત નાણાકીય અહેવાલો પરના આંતરિક નાણાકીય નિયંત્રણને ભવિષ્યની દૃષ્ટિએ મુલ્યાંકિત કરી ઉજાગર કરવું એમાં ઘણાં જોખમ છે. જેમ કે ભવિષ્યની પરિસ્થિતિમાં ફેરફાર, અથવા નીતિવિષયક બાબતો અને પ્રણાલીઓમાં બગાડ થવો.

અભિપ્રાય :

અમારા અભિપ્રાય મુજબ રોકાણકાર કંપની અને તેની સહયોગી કંપનીઓ કે જે ભારતમાં પ્રસ્થાપિત થયેલી છે. પાસે નાણાકીય અહેવાલો ઉપરનું આંતરિક નાણાકીય નિયંત્રણ પૂરતા અને યોગ્ય પ્રમાણમાં છે જે ૩૧ માર્ચ ૨૦૧૬ની સ્થિતિએ સંપૂર્ણ અસરકારક રીતે કાર્યરત છે. જે ભારતની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થા દ્વારા પ્રમાણિત નાણાકીય અહેવાલો ઉપરના આંતરિક નાણાકીય નિયંત્રણ માટેની માર્ગદર્શક નોંધમાં જણાવેલ જરૂરી અંગભૂત ભાગો ઉપર આધારિત છે.

સ્થળ : અમદાવાદ
તા. ૨૮/૧૦/૨૦૧૬

જે.પી.શાહ એન્ડ કું. વતી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
એફ.આર.એન. : ૧૦૮૬૧૨W
(સી.એ. નિરવ જે. શાહ)
ભાગીદાર
મેમ્બરશીપ નં. ૧૦૭૭૧૭



તા. ૩૧મી માર્ચ, ૨૦૧૬ના રોજનું પાકુ સરવૈયું (એકત્રિત)

રકમ રૂપિયામાં

વિગત	અનુસૂચિ	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૬ ના રોજ	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૫ ના રોજ
૧. શેર મૂડી અને જવાબદારીઓ			
૧. સભાસદોનું ભંડોળ			
(ક) શેર મૂડી	૨	૧૦૪૨૭૬૮૦૭૦૦	૧૦૪૨૭૬૮૦૭૦૦
(ખ) અનામત અને વધારો	૩	૨૮૬૧૬૮૦૮૨૩૬	૨૫૬૩૦૦૧૫૬૩૧
સભાસદોનું ભંડોળ		૩૮૦૪૪૫૮૮૮૩૬	૩૬૦૫૭૭૦૬૩૩૧
૨. શેર અરજીના નાણાં			
(ફાળવણી બાકી)		૦	૦
૩. સ્થાયી જવાબદારીઓ			
(ક) લાંબાગાળાનું ઋણ	૪	૮૭૮૮૫૦૦૦૦૦	૮૨૫૦૦૦૦૦૦૦
(ખ) લાંબાગાળાની જોગવાઈ	૫	૮૨૮૬૬૪	૭૯૮૮૮૧
સ્થાયી જવાબદારીઓ		૮૭૯૮૩૨૮૬૬૪	૮૨૫૦૭૯૮૮૮૧
૪. ચાલુ જવાબદારીઓ			
(ક) ટ્રેડ પેયેબલ્સ		૦.૦૦	૦.૦૦
(ખ) અન્ય ચાલુ જવાબદારીઓ	૬	૧૧૬૪૮૩૦	૪૬૭૮૨૫
(ગ) ટૂંકા ગાળાની જોગવાઈ	૭	૨૭૩૮૨	૨૭૭૨૮
ચાલુ જવાબદારીઓ		૧૧૮૨૩૧૨	૪૮૧૫૫૩
કુલ		૪૭૮૪૫૧૨૧૮૧૩	૪૪૩૦૮૮૮૭૭૬૫
૨. મિલકતો :			
૧. સ્થાયી અસ્કયામતો			
(ક) સ્થિર મિલકતો			
(૧) દૃશ્યમ મિલકતો	૮	૧૦૮૮૧૭૨	૨૨૨૩૫૪
(૨) ઈન્ટેન્જીબલ મિલકતો		૦	૦
(ખ) સ્થાયી રોકાણો	૯	૪૪૧૫૭૭૪૧૮૪૭	૪૧૮૭૪૬૭૫૮૭૮
(ગ) વિલંબિત વેરાની અસ્કયામત	૧૦	૩૬૬૮૨૮	૧૦૮૭૮૩
(ઘ) લાંબાગાળાની લોન અને પેશગીઓ	૧૧	૩૮૭૬૮૬૩૮	૮૮૫૩૪૩૦૬
સ્થાયી મિલકતો		૪૪૧૮૮૮૬૬૪૮૬	૪૨૦૬૪૫૪૧૩૩૧
૨. ચાલુ મિલકતો			
(ક) રોકડ અને તેની સમકક્ષ	૧૨	૫૫૨૪૬૧૬૮૧	૪૮૨૨૦૨૪
(ખ) ટૂંકાગાળાની લોન અને પેશગીઓ	૧૩	૨૮૬૩૦૮૩૪૮૨	૨૧૩૩૧૩૭૮૬૮
(ગ) અન્ય ચાલુ મિલકતો	૧૪	૧૩૦૬૦૦૨૪૪	૧૦૬૩૮૬૪૪૧
ચાલુ મિલકત		૩૬૪૬૧૫૫૪૨૭	૨૨૪૪૪૫૬૪૩૪
કુલ		૪૭૮૪૫૧૨૧૮૧૩	૪૪૩૦૮૮૮૭૭૬૫

મહત્વના હિસાબી નિયમો તથા હિસાબી નોંધ
સાથે બીડેલ અહેવાલ મુજબ
જે. પી. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વતી,
રજીસ્ટ્રેશન નંબર : ૧૦૮૬૧૨W
(સી. એ. નિરવ જે. શાહ)
પાર્ટનર
સભ્ય નંબર : ૧૦૭૭૧૭
સ્થળ : અમદાવાદ
તારીખ : ૨૮-૧૦-૨૦૧૬

૧ થી ૩૧

નિયામક મંડળ અને તેમના વતી
ગુજરાત સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ લીમિટેડ

વહીવટી સંચાલક | સંચાલક | કંપની સચિવ | મુખ્ય નાણાકિય અધિકારી

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૨૮-૧૦-૨૦૧૬



તા. ૩૧મી માર્ચ, ૨૦૧૬ના રોજ પુરા થતા વર્ષ માટે નફા નુકસાન ખાતુ (અકત્રિત)

રકમ રૂપિયામાં

વિગત	અનુસૂચિ	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૬ ના રોજ પૂરા થતા વર્ષ માટે	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૫ ના રોજ પૂરા થતા વર્ષ માટે
૧. આવક :			
કામગીરીમાંથી આવક	૧૫	૫૦૭૩૧૬૮૬૨	૩૮૨૦૪૮૮૨૮
અન્ય આવક	૧૬	૧૧૦૦૦૮૦૦	૨૪૦૭૭૮૧૬૮
કુલ આવક		૫૧૮૩૧૭૮૬૨	૬૨૨૮૨૮૯૯૬
૨. ખર્ચ			
કર્મચારી લાભ ખર્ચ	૧૭	૩૨૩૮૩૬૨	૩૧૭૬૩૦૨
ફાઈનાન્સ ખર્ચ	૧૮	૭૮૮૮૬	૦
ઘસારા ખર્ચ	૮	૩૩૮૫૭૨	૧૧૮૨૮૩
અન્ય ખર્ચ	૧૯	૧૧૫૬૪૭૫૧	૫૩૮૭૬૮૮
કુલ ખર્ચ		૧૫૨૨૩૫૭૧	૮૬૮૩૨૮૪
૩. કરવેરા પહેલાનો નફો		૫૦૩૦૮૪૨૮૧	૬૧૪૧૩૫૭૧૪
૪. કરવેરા ખર્ચ			
(ક) ચાલુ વેરા		૭૪૭૫૧૨૮૭	૧૨૩૧૪૬૨૧૩
(ખ) ચાલુવેરા (અગાઉના વર્ષની જોગવાઈના)		૩૨૨૧૭૩	૧૧૧૦૮૦
(ખ) વિલંબિત કરવેરા		૨૫૮૦૩૬	૧૪૩૬૩૮
૫. સહયોગી કંપનીઓનો નફામાં ભાગ		૨૫૫૮૬૧૪૭૩૮	૮૨૮૨૮૫૭૪૫
૬. વર્ષ દરમિયાનનો નફો (૩-૪)		૨૮૮૬૮૮૩૬૦૬	૧૩૧૮૦૩૦૫૨૭
૬. પ્રત્યેક શેર દીઠ આવક			
દાર્શનિક કિંમત રૂ. ૧૦ પ્રત્યેક			
મૂળ કિંમત (રૂ.માં)		૨.૮૬	૧.૨૬
ઘટાડેલ કિંમત રૂ.માં)		૨.૮૬	૧.૨૬

મહત્વના હિસાબી નિયમો તથા હિસાબી નોંધ
સાથે બીડેલ અહેવાલ મુજબ
જે. પી. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વતી,
રજીસ્ટ્રેશન નંબર : ૧૦૮૬૧૨W
(સી.એ. નિરવ જે. શાહ)
પાર્ટનર
સત્ય નંબર : ૧૦૭૭૧૭
સ્થળ : અમદાવાદ
તારીખ : ૨૮-૧૦-૨૦૧૬

૧ થી ૩૩

નિયામક મંડળ અને તેમના વતી
ગુજરાત સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ લીમિટેડ

વહીવટી સંચાલક | સંચાલક | કંપની સચિવ | મુખ્ય નાણાકીય અધિકારી

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૨૮-૧૦-૨૦૧૬



૩૧ માર્ચ, ૨૦૧૬ના રોજના રોકડ લેવડ-દેવડની નોંધ (એકત્રિત)

રકમ રૂપિયામાં

વિગત	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૬ ના રોજ	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૫ ના રોજ
અ. રોકડનો વ્યવહાર કરવેરા પહેલાનો નફો એડજસ્ટમેન્ટ ફોર : વધુ સમય સુધી રાખવી જરૂરી નથી એવી જવાબદારીઓ / જોગવાઈઓ ઘસારો વધુ સમય સુધી રાખવી જરૂરી નથી એવી જવાબદારીઓ / જોગવાઈઓ મિલકતના વેચાણનો નફો કે નુકશાન રોકાણ વેચાણ ઉપર નફો નુકશાન ગ્રેજ્યુઈટી અને રીટાયરમેન્ટ બેનીફીટની જોગવાઈ કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો કાર્યકારી નફો કાર્યશીલ મૂડીમાં ફેરફાર અન્ય ચાલુ મિલકતમાં વધારો / ઘટાડો અન્ય સ્થાયી મિલકત લોન અને પેશગી (વધારો / ઘટાડો) ચાલુ જવાબદારીઓ (વધારો / ઘટાડો) રોકડ વ્યવહારો પ્રત્યક્ષ કરવેરાની ચૂકવણી સહભાગી કંપનીઓનું મળેલ ડિવિડંડ ધંધાની કાર્યકારી પ્રવૃત્તિમાં વપરાયેલ ચોખ્ખી રોકડ	૫૦૩,૦૮૪,૨૮૧.૦૦ ૦.૦૦ ૩૩૮,૫૭૨.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૫૦૩,૪૩૩,૮૬૩.૦૦ -૨૪,૨૦૩,૮૦૩.૦૦ -૭૮૦,૧૮૦,૮૫૫.૦૦ ૭૩૦,૫૪૨.૦૦ -૮૦૩,૬૬૪,૧૧૬.૦૦ -૭૫,૦૭૩,૪૬૦.૦૦ ૪૦૦,૭૪૧,૮૭૦.૦૦ ૨૫,૪૩૮,૨૫૭.૦૦	૬૧૪,૧૩૫,૭૧૩.૫૨ -૧,૦૬૦,૮૩૬.૦૦ ૧૧૮,૨૮૩.૦૦ ૦.૦૦ -૪૮૭.૭૦ -૨૩૮,૭૧૭,૭૩૫.૨૪ ૩૭૩,૪૭૫,૮૨૭.૫૮ ૬૫,૬૩૬,૮૪૦.૦૦ ૨,૬૪૨,૨૮૩,૨૪૦.૩૬ -૨,૧૬૫,૮૩૫.૦૦ ૨,૭૦૫,૭૫૪,૧૪૫.૩૬ -૧૨૩,૨૫૭,૨૮૩.૦૦ ૪૭૮,૨૧૩,૭૧૩.૦૦ ૩,૪૩૫,૧૮૬,૩૮૨.૮૪
બ. રોકાણ ઉપરનો રોકડ વ્યવહાર સ્થાયી મિલકતોના વેચાણમાંથી સ્થાયી મિલકતોના રોકાણમાંથી સ્થાયી રોકાણોની ખરીદી સ્થાયી મિલકતની ખરીદીનો ઘસારો રોકાણોની ખરીદી મુકેલ / ઉપાડેલ ઈન્ટરકોર્પોરેટ ડીપોઝીટ રોકાણની પ્રવૃત્તિ દ્વારા ઉત્પન્ન થયેલ ચોખ્ખી રોકડની આવક	૦.૦૦ ૦.૦૦ -૧,૨૦૫,૩૮૦.૦૦ ૦.૦૦ -૨૫,૧૮૩,૨૦૦.૦૦ -૨૬,૩૮૮,૫૮૦.૦૦	૨૧,૨૦૦.૦ ૨૫૦,૬૭૧,૮૭૮.૦૦ -૨૬૩,૧૬૧.૦૦ ૦.૦૦ -૮૫,૬૧૨,૨૨૦.૦૦ ૧૬૪,૮૧૭,૬૮૭.૦૦
ક. ધિરાણના વ્યવહાર દ્વારા ઉત્પન્ન થયેલ રોકડ આવક તારણ વગરની લોનનો વ્યવહાર શેર/અરજીઓનો વ્યવહાર ધિરાણના વ્યવહાર દ્વારા ઉત્પન્ન રોકડની આવક ચોખ્ખો રોકડમાં વધારો/ઘટાડો (અ+બ+ક) એકંદરે રોકડમાં વધારો વર્ષની શરૂઆતમાં એકંદરે રોકડમાં વધારો વર્ષના અંતે	૫૪૮,૫૦૦,૦૦૦.૦૦ ૫૪૮,૫૦૦,૦૦૦.૦૦ ૫૪૭,૫૩૮,૬૬૭.૦૦ ૪,૮૨૨,૦૨૩.૮૪ ૫૫૨,૪૬૧,૬૮૦.૮૪	-૩,૬૮૫,૮૩૮,૦૦૦.૦૦ -૩,૬૮૫,૮૩૮,૦૦૦.૦૦ -૮૫,૮૩૪,૮૧૦.૦૬ ૮૦,૭૫૬,૮૩૪.૦૦ ૪,૮૨૨,૦૨૩.૮૪

નોંધ :

- કંપની ઈન્વેસ્ટમેન્ટ કંપની હોવાથી રોકાણોના ખરીદ-વેચાણને “રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓ” નો ભાગ ગણવામાં આવેલ છે અને આ રોકાણો પર વર્ષ દરમિયાન મેળવેલ વ્યાજ / ડિવિડન્ડને “સંચાલન પ્રવૃત્તિઓ રોકડ પ્રવાહ” નો ભાગ ગણવામાં આવેલ છે.
- રોકડ અને રોકડ સમકક્ષમાં પાકા સરવૈયા મુજબની રોકડ અને બેન્ક સિલક તેમજ ઉ મહિના કે તેથી ઓછા સમય માટે મૂકવામાં આવેલ ઈન્ટરકોર્પોરેટ ડીપોઝીટનો સમાવેશ થાય છે.
- જ્યાં જરૂર પડી હોય ત્યાં પાછલા વર્ષની રકમોને રી-સુપ કરવામાં આવેલ છે.

સાથે બીડેલ અહેવાલ મુજબ
જે. પી. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વતી,
રજીસ્ટ્રેશન નંબર : ૧૦૮૬૧૨W
(સી.એ. નિરવ જે. શાહ)
પાર્ટનર
સભ્ય નંબર : ૧૦૭૭૧૭
સ્થળ : અમદાવાદ
તારીખ : ૨૮-૧૦-૨૦૧૬

નિયામક મંડળ અને તેમના વતી
ગુજરાત સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ લીમિટેડ

વહીવટી સંચાલક | સંચાલક | કંપની સચિવ | મુખ્ય નાણાકિય અધિકારી

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૨૮-૧૦-૨૦૧૬



ફોર્મ એઓસી-૧

(કલમ ૧૨૮ની પેટાકલમ (૩) ને કંપનીના (એકાઉન્ટ્સ) નિયમો, ૨૦૧૪ના નિયમ-૫ને સાથે વાંચવાની જોગવાઈઓ અનુસાર)

પેટાકંપનીઓ, સહયોગી કંપનીઓ અને સંયુક્ત સાહસોના નાણાકીય પત્રક ઉપરના ધ્યાનપ્રદ મુદ્દાઓનું પત્રક ભાગ-૧ પેટાકંપનીઓ

ગુજરાત રાજ્ય મૂડી રોકાણ લિમિટેડ કંપનીને કોઈ પેટા કંપની ન હોવાથી ભાગ-૧ ભરવાની જરૂર નથી.

ભાગ-૨ સહયોગી કંપનીઓ અને સંયુક્ત સાહસો

કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૨૮(૩) હેઠળની જોગવાઈઓ અનુસાર સહયોગી કંપનીઓ અને સંયુક્ત સાહસોનું પત્રક)

રકમ રૂપિયામાં

		સહયોગી કંપનીનાં નામ		
		જીએસએફસી	જીએનએફસી	જીએસીએલ
૧.	ઓડિટ થયેલા છેલ્લા સરવૈયાની તારીખ	૩૧/૩/૨૦૧૬	૩૧/૩/૨૦૧૬	૩૧/૩/૨૦૧૬
૨.	સહયોગી કંપની અથવા સંયુક્ત સાહસ જોડાવાની કે હસ્તગત કર્યાની તારીખ	૨૧/૮/૧૯૮૦	૧૭/૮/૧૯૮૧	૦૫/૮/૨૦૧૩
૩.	વર્ષાંતે કંપનીએ ધારણ કરેલ સહયોગી કંપનીના શેરની સંખ્યા	૧૫,૦૭,૮૮,૮૦૫	૩,૩૨,૨૭,૫૪૬	૧,૫૩,૨૮,૩૭૩
	સહયોગી કંપનીમાં રોકાણનું મુલ્ય	૨૫,૨૩૭.૮૬	૧૩,૫૩૧.૫૩	૧૭,૩૩૧.૫૩
	રોકાણની ટકાવારી	૩૭.૮૪	૨૧.૩૮	૨૦.૮૭
૪.	આવા નોંધપાત્ર પ્રભાવનું વર્ણન	શેરધારણ કરીને	શેરધારણ કરીને	શેરધારણ કરીને
૫.	સહયોગી કંપની/સંયુક્ત સાહસ એકીકરણ ન થવાનું કારણ	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી
૬.	છેલ્લા ઓડિટ થયેલા સરવૈયા મુજબ શેરહોલ્ડીંગ લીધે પ્રાપ્ત ચોખ્ખી મિલકતો	૪,૭૩,૮૦૫.૦૦	૫૭,૦૫૨.૨૬	૨,૨૬,૩૮૩.૩૮
૭.	વર્ષ દરમિયાન નફો/નુકસાન			
	(૧) એકત્રીકરણ ગણેલ	૧૪,૬૫૪.૩૧	૬,૩૦૫.૫૮	૬,૩૮૪.૭૪
	(૨) એકત્રીકરણમાં ન ગણેલ			

જે. પી. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વતી,
રજીસ્ટ્રેશન નંબર : ૧૦૮૬૧૨W
(સી.એ. નિરવ જે. શાહ)
પાર્ટનર
સભ્ય નંબર : ૧૦૭૭૧૭
સ્થળ : અમદાવાદ
તારીખ : ૨૮-૧૦-૨૦૧૬

નિયામક મંડળ અને તેમના વતી
ગુજરાત સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ લીમિટેડ

વહીવટી સંચાલક | સંચાલક | કંપની સચિવ | મુખ્ય નાણાકીય અધિકારી

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૨૮-૧૦-૨૦૧૬



૩૧-૩-૨૦૧૬ ના રોજ પુરા થતા વર્ષના નાણાકીય પત્રકોના ભાગરૂપ અનુસૂચિઓ

૧. મહત્વની હિસાબી નીતિઓ
સંયુક્ત માહિતી :-

ગુજરાત રાજ્ય મૂડીરોકાણ લિમિટેડ એ સંપૂર્ણપણે ગુજરાત સરકારની પબ્લિક લિમિટેડ કંપની તરીકે તા. ૨૮/૧૧/૧૯૮૮ના રોજ સમાવિષ્ટ, સ્થાઈ અને ભારતમાં નોંધાયેલી કંપની છે. સંયુક્ત નાણાકીય પત્રકો કંપની અને તેની સહયોગી કંપનીઓ જેવી કે ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઈઝર્સ કંપની લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ અને ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડને લાગુ પડે છે.

સહયોગી કંપનીમાં રોકાણનો સારાંશ

ક્રમ નં.	સહયોગી કંપનીનું નામ	ધારણ કરેલ શેરની સંખ્યા	ધારણ કરેલ શેરની ટકાવારી	ઓડિટ થયેલ છેલ્લા સરવૈયાની તારીખ
૧.	ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ	૧૫,૦૭,૯૯,૯૦૫	૩૭.૮૪ (૩૭.૮૪)	૩૧.૩.૨૦૧૬
૨.	ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઈઝર્સ કંપની લિમિટેડ	૩,૩૨,૨૭,૫૪૬ (૩,૩૨,૨૭,૫૪૬)	૨૧.૩૯ (૨૧.૩૯)	૩૧.૩.૨૦૧૬
૩.	ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ	૧,૫૭,૨૯,૩૭૩ (૧,૫૩,૨૯,૩૭૩)	૨૦.૮૭ (૨૦.૮૭)	૩૧.૩.૨૦૧૬

પ્રમોટર્સના શેર હોલ્ડીંગમાં અંદરો અંદર બદલાવ થવાથી, વર્ષ ૨૦૧૫-૧૬ BECL કંપની સહયોગી કંપની તરીકે રદબાતલ થઈ છે. છતાં રોકાણની સુધારેલી પેટર્ન પ્રમાણે GSIL એ BECLના ૨૩.૪૬% કે જેનું મુલ્ય રૂા. ૫૪.૮૫ કરોડ છે. તેનું વધારાનું રોકાણ તા. ૨૮.૪.૨૦૧૬ના રોજ એટલે કે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં કરેલ છે.

૧.૧ નાણાકીય પત્રકો તૈયાર કરવાનો પાયો (બેસીસ)

સંયુક્ત નાણાકીય પત્રકો સર્વ સ્વીકૃત એકાઉન્ટીંગ પ્રિન્સિપલ્સને આધારે ઐતિહાસિક કોસ્ટ કન્વેન્શનને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવે છે. આ સંયુક્ત નાણાકીય પત્રકો તૈયાર કરવામાં કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૩૩ને કંપનીના (એકાઉન્ટ્સ) નિયમો, ૨૦૧૪ના નિયમ ૭ સાથે વાંચતાં દર્શાવેલ ફરજિયાત એકાઉન્ટીંગનાં ધારાધોરણો લાગુ પાડવામાં આવે છે.

નોંધો અને અગત્યની એકાઉન્ટીંગ પોલિસીઓનો હેતુ, સંયુક્ત નાણાકીય પત્રકોને વધુ સારી રીતે સમજવા માટેના માર્ગદર્શક તરીકેનો હોય છે. જેના અનુસંધાને શ્રુપે જરૂરી તમામ નોંધો અને નીતિઓ જાહેર કરેલી હોય છે.

૧.૨ એકત્રીકરણના સિદ્ધાંતો :

આ સંયુક્ત નાણાકીય પત્રકની સાથેની અગત્યની એકાઉન્ટીંગ પોલીસીઓ અને નોંધોનો હેતુ માહિતી જાહેર કરવાના એક સાધન તરીકેનો હોય છે. જે શ્રુપની સંયુક્ત સ્થિતિની સારી સમજ માટે માર્ગદર્શક બની રહે છે. આ હેતુની જાણકારી માટે માત્ર એવી પોલીસીઓ અને નોંધો વ્યક્તિગત નાણાકીય પત્રકમાંથી જાહેર કરવામાં આવે છે જે જરૂરી જાહેરાતને જ ઉજાગર કરે. એક જ પ્રકારના અને અન્ય ગણતરીઓનો અભાવ, એમાંની કેટલીક બાબતોને બાકાત કરવા પ્રેરે છે જે વહીવટકર્તાઓના અભિપ્રાય પ્રમાણે જો વ્યક્તિગત નાણાકીય પત્રકોમાં વધુ સારી રીતે જોઈ સમજ શકાય છે.

સંયુક્ત નાણાકીય પત્રકો નીચેના આધારે તૈયાર કરવામાં આવે છે.

(એ) સહયોગી કંપનીઓનું એકત્રીકરણનું નાણાકીય પત્રક કંપનીની રિપોર્ટીંગ તારીખ પ્રમાણે જ તૈયાર કરવામાં આવે છે. એટલે ૩૧ માર્ચ ૨૦૧૬ના પુરા થતા વર્ષાંતે.

(બી) સંયુક્ત નાણાકીય પત્રકમાં “ઈક્વિટી પદ્ધતિ” પ્રમાણે ગણેલો સહયોગી કંપનીઓના નફા/નુકસાનનો ફાળો સામેલ કરવામાં આવે છે. આ નફો/નુકસાન રોકાણોની કિંમતમાંથી ઉમેરવામાં/બાદ કરવામાં આવે છે.



(સી) સહયોગી કંપનીમાં રોકાણો અને સહયોગી કંપનીના શેરધારણ કરતી વખતની ચોખ્ખી અસ્ક્યામતોના તફાવતને સંયુક્ત નાણાકીય પત્રકમાં ગુડવીલ તરીકે અથવા કેપીટલ રિઝર્વ તરીકે દર્શાવવામાં આવે છે.

૧.૩ અંદાજોનો ઉપયોગ :

GAAPની જરૂરિયાત પ્રમાણ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં સંચાલક મંડળો અંદાજો બાંધવા, ન્યાયોમિત નિર્ણયો લેવા અને એવી ધારણાઓ કરવી જે રિપોર્ટિંગ સમયના અંતે કંપનીની આવકો, ખર્ચા, અસ્ક્યામતો, જવાબદારીઓ અને સંભવિત જવાબદારીઓને જાહેર કરવામાં અસર કરે. જો કે આ ધારણાઓ સંચાલક મંડળની તાજેતરના બનાવો અને કાર્યવાહી જેવી બાબતોની જાણકારી ઉપર આધારિત હોય છે. આવી ધારણાઓ અને અંદાજોની અચોક્કસતા, અસ્ક્યામતો અને જવાબદારીઓની ભવિષ્યની કિંમતોમાં મહત્વના એડજસ્ટમેન્ટમાં પરિણમે છે.

૧.૪ આવક માન્યતા :

કંપનીનો ડિવીડન્ડ મેળવવાનો હક્ક પ્રસ્થાપિત થાય અને આવું ડિવીડન્ડ જાહેર કરવામાં આવેલ હોય ત્યારે આ ડિવીડન્ડની આવક હિસાબમાં નોંધવામાં આવે છે. મળવાની બાકી અને પ્રવર્તમાનદરને ધ્યાને લઈ વ્યાજની આવક સમય પ્રમાણસરના ધોરણે સ્વીકૃત કરવામાં આવેલ છે.

૧.૫ સ્થાયી અસ્ક્યામત :

સ્થાયી અસ્ક્યામતો સંપાદિત કિંમતમાંથી ઘટતી જતી બાકી પદ્ધતિથી ગણેલ સંચિત ઘસારો બાદ કરી દર્શાવવામાં આવે છે. પડતર કિંમતમાં ખરીદ કિંમત અને આવી મિલકતને ચાલુ સ્થિતિમાં લાવવાના ખર્ચનો સમાવેશ થાય છે.

૧.૬ ઘસારો :

કંપની અધિનિયમ, ૨૦૧૩ ના પરિશિષ્ટ ૨ માં દર્શાવેલી રીત અને દર મુજબ ઘટતી જતી પદ્ધતિથી સ્થાયી અસ્ક્યામતો પર ઘસારો ગણવામાં આવેલ છે.

૧.૭ સ્થાયી અસ્ક્યામતોમાં ઘટાડો/નુકશાન :

- (એ) કંપનીની અસ્ક્યામતોની બિન ઉપયોગીતાની સંભાવના અંગે જોગવાઈ કરવામાં આવે છે. જો આવી સંભાવના ઉદ્ભવે તો આવી અસ્ક્યામતના વેચાણ દ્વારા મળતી આવકનો અંદાજ કાઢવામાં આવે છે. અસ્ક્યામત બિન-ઉપયોગી થતાં નુકશાનને ત્યારે જ સ્વિકારવામાં આવે છે, જ્યારે અસ્ક્યામતની ચોપડા ઉપરની કિંમતે તેના વેચાણ દ્વારા મળી શકનાર રકમ કરતાં વધુ હોય.
- (બી) અસ્ક્યામતની બિન ઉપયોગીતાના નુકશાનની અગાઉના વર્ષની જોગવાઈ ત્યારે જ પરત કરવામાં આવે છે જ્યારે તેવું જણાય છે અસ્ક્યામતના બિનઉપયોગીતાના અંદાજમાં ઘટાડો થયો છે કે તેના સંજોગો હવે અસ્તિત્વમાં નથી.

૧.૮ રોકાણો :

રોકાણો લાંબા ગાળાના છે અને તે મેળવેલી કિંમતે દર્શાવેલ છે. રોકાણોની કિંમત હંગામી ન હોય તેવા ઘટાડા માટેની જોગવાઈ હિસાબોમાં કરવામાં આવેલ છે.

૧.૯ કર્મચારીને લાભો :

- (૧) હુંકા ગાળાના કર્મચારીઓને મળવાપાત્ર લાભ ખર્ચ તરીકે ડિસ્કાઉન્ટ કર્યા વગર જે વર્ષે કર્મચારીએ સેવા આપી હોય તે જ વર્ષના નફા-નુકશાન ખાતે ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે.
- (૨) કર્મચારીની સેવા સમાપ્ત થયા બાદ મળવાપાત્ર લાભ :
- (અ) આ મળવાપાત્ર લાભમાં ગ્રેજ્યુઈટી તથા રજા-પગારની ચૂકવણીનો સમાવેશ થાય છે. કર્મચારીએ જે વર્ષમાં સેવા આપેલી હોય તે વર્ષમાં નફો-નુકશાન ખાતે કર્મચારીની સેવાઓ સમાપ્ત થયા બાદ તેમને મળવાપાત્ર લાભોની જોગવાઈ કરવામાં આવે છે. આ ખર્ચની એકચ્યુઅલ આકારણી વર્તમાન કિંમત મુજબ વર્ષાંતે કરવામાં આવે છે. જે કંપની એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ રૂલ્સ, ૨૦૦૬ ના એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ૧૫ મુજબ સંલગ્ન છે.



(બ) કંપનીએ અલગ ભવિષ્યનિધિ ટ્રસ્ટની રચના કરેલ છે. કર્મચારીને ચૂકવેલ, ચૂકવવાપાત્ર થતી રકમની વર્ષના નફા-નુકશાન ખાતામાં જોગવાઈ કરવામાં આવે છે. કંપનીની જવાબદારી છે કે જો ટ્રસ્ટનાં રોકાણો ઉપર થતી આવક સરકાર દ્વારા જાહેર કરેલ વ્યાજ કરતાં ઓછી હોય તો કંપનીને તેટલો તફાવત ચૂકવવો પડે.

કર્મચારીની નોકરીની મુદત બાદ મળવાપાત્ર લાભ અંગેના અકુઅલ (accrual) નફા અથવા નુકશાનની જોગવાઈ નફા-નુકશાનને કરવામાં આવે છે.

૧.૧૦ કરવેરા :

(અ) આવકવેરાની જોગવાઈ ચાલુ વર્ષની કરપાત્ર આવક ઉપર આવકવેરા કાયદા ૧૯૬૧ તેમજ તેના અંતર્ગત નિયમો મુજબ કરવામાં આવે છે.

(બ) વિલંબીત કરની મૂડી/જવાબદારીની ઓળખ પ્રવર્તમાન કરતા ધોરણ મુજબ ચોપડાના નફા અને કરપાત્ર આવકના સમયના તફાવત ઉપર આધારિત છે. વિલંબીત કર મુડીની ઓળખ ત્યારે જ કરવામાં આવે છે. કે જ્યારે તે સુનિશ્ચિત હોય કે ભવિષ્યમાં મળનાર કરપાત્ર આવક પુરતી હોય કે જેની સામે વિલંબીત કર મુડી મેળવી શકાય. આવા સંજોગોમાં જ્યારે કંપની પાસે આગળ ખેંચેલી કરપાત્ર નુકશાન હોય તેની સામે તેટલી જ વિલંબીત કરમુડીની આકારણી કરવામાં આવે છે કે જ્યારે તે સુનિશ્ચિત હોય તે ભવિષ્યની કરપાત્ર આવક ઉપલબ્ધ કરવાની શક્યતા છે તેવી પુરી ખાત્રી હોય.

૧.૧૧ શેર દીઠ કમાણી :

શેરદીઠ કમાણીના હિસાબી ધોરણ ૨૦ મુજબ, કંપનીનો મુળભૂત અને હળવી શેરદીઠ કમાણીનો અહેવાલ મળે છે. મુળભૂત રીતે શેરદીઠ કમાણી એ વર્ષ દરમિયાનના ચોખ્ખા નફાને વર્ષ દરમિયાન બાકી ભારિત સરેરાશ ઈક્વિટી શેરોની સંખ્યા વડે ભાગતાં મળતી સંખ્યા છે.

૧.૧૨ આકસ્મિક જવાબદારીની જોગવાઈ :

આકસ્મિક જોગવાઈ જવાબદારીની જોગવાઈ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે વર્તમાન જવાબદારી ભૂતકાળના કાર્યને ઉદ્ભવેલી હોય, એવી બની શકે તેવી જવાબદારી ચૂકવવા માટે નાણાંકિય પ્રવાહ બહાર જતો હોય. આવી જવાબદારીનું વર્તમાન મુલ્ય બેલેન્સશીટના દિવસે ઉચ્ચતમ અંદાજ મુજબ નક્કી કરવામાં આવે છે. આવા અંદાજો દરેક બેલેન્સ શીટના દિવસે તપાસવામાં આવે છે અને વર્તમાન અંદાજ મુજબ સુધારવામાં આવે છે.

આકસ્મિક જવાબદારીઓ જો કોઈ હોય તો તે “નોંધ” સ્વરૂપે દર્શાવવામાં આવે છે.

આકસ્મિક રોકાણો ગણવામાં કે નાણાંકિય અનુસૂચિમાં દર્શાવવામાં આવતા નથી.



સરવૈયાના ભાગરૂપે અનુસૂચિઓ (એકત્રિત)

રકમ રૂપિયામાં

ક્રમ	વિગત	૩૧-૩-૨૦૧૬ ના રોજ	૩૧-૩-૨૦૧૫ ના રોજ
સરવૈયાના ભાગરૂપે અનુસૂચિઓ			
૨ -	શેરમૂડી		
અ	કંપની બે પ્રકારની શેરમૂડી ઈક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેરમૂડી નીચે મુજબ ધરાવે છે : અધિકૃત : ૨૮૫,૦૦,૦૦,૦૦૦ ઈક્વિટી શેર (પ્રત્યેક રૂા. ૧૦ના) ૧,૫૦,૦૦,૦૦૦ પ્રેફરન્સ શેર (પ્રત્યેક રૂા. ૧૦૦ ના) કુલ ઈસ્યુ કરેલ, ભરપાઈ કરેલ અને વસુલ આવેલ મુડી ૧૦૪,૨૭,૬૮,૦૭૦ ઈક્વિટી શેર્સ (પ્રત્યેક રૂા. ૧૦ ના) કુલ	૨૮૫૦૦૦૦૦૦૦૦ ૧૫૦૦૦૦૦૦૦૦ ૩૦૦૦૦૦૦૦૦૦૦ ૧૦૪૨૭૬૮૦૭૦૦ ૧૦૪૨૭૬૮૦૭૦૦	૨૮૫૦૦૦૦૦૦૦૦૦ ૧૫૦૦૦૦૦૦૦૦૦ ૩૦૦૦૦૦૦૦૦૦૦૦ ૧૦૪૨૭૬૮૦૭૦૦ ૧૦૪૨૭૬૮૦૭૦૦
ધારણ કરનાર ૧. ગુજરાતના રાજ્યપાલ (૧૦૦% ભંડોળ) અગાઉના વર્ષનું ૧૦૦% શેર ભંડોળ બાકી રહેલા શેરોની હિસાબી મેળવણી			
બ.	વિગત	ઈક્વિટી શેર (સંખ્યા)	
અ.	વર્ષની શરૂઆતના શેર્સ	૧૦૪૨૭૬૮૦૭૦	૧૦૪૨૭૬૮૦૭૦
બ.	વર્ષ દરમિયાન ઈસ્યુ કરેલ	૦	૦
ક.	બાદ : બાય બેક (પુનઃખરીદેલ) શેર્સ	૦	૦
ડ	વર્ષના અંતે શેરની સંખ્યા (અ + બ - ક)	૧૦૪૨૭૬૮૦૭૦	૧૦૪૨૭૬૮૦૭૦
ક.	મુડી પરત અને ડિવીડન્ડ અંગેના ઈક્વિટી શેર હોલ્ડરોના અધિકારો (૧) ઈક્વિટી શેર ધારકોના અધિકારો, ડિવીડન્ડ અને મૂડી પરત કંપનીની બાકી રહેલ મિલકતો બાબતે બધા શેરધારકો સમાન હશે. (૨) ઈક્વિટી શેર ધારકો સમયાંતરે જાહેર કરાતા ડિવીડન્ડ માટે હક્કદાર બનશે અને કંપનીની મીટીંગમાં પ્રત્યેક શેરદીઠ એક મત આપવાને હક્કદાર બનશે		
ડ.	૫% થી વધુ હોલ્ડીંગ ધરાવનાર શેર હોલ્ડરની વિગત		
	શેર હોલ્ડરનું નામ	ઈક્વિટી શેર (સંખ્યા)	
	૧. ગુજરાતના રાજ્યપાલ (૧૦૦% હોલ્ડીંગ)	૧૦૪૨૭૬૮૦૭૦	૧૦૪૨૭૬૮૦૭૦



સરવૈયાના ભાગરૂપે અનુસૂચિઓ (એકત્રિત)

રકમ રૂપિયામાં

ક્રમ	વિગત	૩૧-૩-૨૦૧૬ ના રોજ	૩૧-૩-૨૦૧૫ ના રોજ
૩.	અનામત અને પુરાંત		
	વધારો : નફા અને નુકસાનના પત્રક મુજબ બાકી પાકા સરવૈયા મુજબ બાદ કંપની ધારા ૨૦૧૩ અનુસૂચિ ૨ મુજબ ધસારો કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ વાસ્તવિક સ્થાઈ અસ્ક્યામતો જેના બાકી વપરાશી સમય શૂન્ય છે. વધારો : વર્ષ દરમિયાન નફો કુલ (અ)	૨૫૧૧૦૦૧૫૬૩૦ ૦ ૦ ૨૮૮૬૮૮૩૬૦૬ ૨૮૦૮૬૮૦૮૨૩૬	૫૦૨૫૭૭૦૩૩૭ ૪૭૦૨ 18765219468 ૧૩૧૮૦૩૦૫૨૭ ૨૫૧૧૦૦૧૫૬૩૦
	મુડી પરત અનામતમાં ગત વર્ષના પાકા સરવૈયા મુજબ કુલ (બ)	૫૨૦૦૦૦૦૦૦ ૫૨૦૦૦૦૦૦૦	૫૨૦૦૦૦૦૦૦ ૫૨૦૦૦૦૦૦૦
	કુલ અનામત અને વધારો (અ+બ)	૨૮૬૧૬૮૦૮૨૩૬	૨૫૬૩૦૦૧૫૬૩૦
૪.	લાંબાગાળા ઋણ - તારણ વગરના		
	રાજ્ય સરકાર પાસેથી લીધેલ લોન (ગર્વમેન્ટ ઓફ ગુજરાત) કુલ	૮૭૮૮૫૦૦૦૦૦ ૮૭૮૮૫૦૦૦૦૦	૮૨૫૦૦૦૦૦૦૦ ૮૨૫૦૦૦૦૦૦૦
૫.	લાંબાગાળાની જોગવાઈઓ		
	(અ) કર્મચારી લાભ અંગેની જોગવાઈઓ (૧) ગ્રેજ્યુઈટીની જોગવાઈ (૨) રજાનું રોકડમાં રૂપાંતર અંગેની જોગવાઈ (૩) અન્ય કર્મચારી લાભ અંગેની જોગવાઈ કુલ	૫૩૨૭૩૭ ૨૮૬૮૨૭ ૦ ૮૨૮૬૬૪	૪૭૬૫૭૫ ૨૫૭૮૨૮ ૬૫૩૭૮ ૭૮૮૮૮૧
	વેપારી દેવું ખર્ચ / સેવા અંગેના લેણદારો કુલ	૦ ૦	૦ ૦
	સુક્ષ્મ નાના અને મધ્યમ એકમો વિકાસ ધારો - ૨૦૦૬ હેઠળ પક્ષકારનો સમાવેશ થાય તેવી કોઈ રકમ નથી		
૬.	અન્ય ચાલુ જવાબદારીઓ		
	અન્ય ચુકવવા પાત્ર કુલ	૧૧૬૪૮૩૦ ૧૧૬૪૮૩૦	૪૬૭૮૨૫ ૪૬૭૮૨૫
૭.	ટૂંકા ગાળાની જોગવાઈઓ		
	(૧) ગ્રેજ્યુઈટી માટેની જોગવાઈ (૨) રજાનું રોકડમાં રૂપાંતર અંગેની જોગવાઈ કુલ	૧૫૮૪૭ ૧૧૫૩૫ ૨૭૩૮૨	૧૪૪૬૮ ૮૨૫૮ ૨૩૭૨૮



સરવૈયાના ભાગરૂપે અનુસૂચિઓ (એકત્રિત)

૮. ભૌતિક મિલકતો

રકમ રૂપિયમાં

વિગત	મિલકત (બરીદ કિંમત)				ધસારો				ચોખ્ખી મિલકત		
	૩૧ માર્ચ ૨૦૧૫ ની સ્થિતિ	વર્ષ દરમિયાન વધારો	વર્ષ દરમિયાન વેચાણ નિકાલ	૩૧ માર્ચ ૨૦૧૬ ની સ્થિતિ	૩૧ માર્ચ ૨૦૧૫ ની સ્થિતિ	વર્ષ દરમિયાન વધારો	હવાલો	૩૧ માર્ચ ૨૦૧૬ ની સ્થિતિ	નફા નુકશાન ખાતામાં વધારાની સીલક પર નોંધાયેલ ધસારો	૩૧ માર્ચ ૨૦૧૬ ની સ્થિતિ	૩૧ માર્ચ ૨૦૧૫ ની સ્થિતિ
ફર્નિચર અને ફિક્સર્સ	૫૧૫,૭૬૮.૫૫	૦.૦૦	૦.૦૦	૫૧૫,૭૬૮.૫૫	૪૮૭,૦૨૩.૩૯	૦.૦૦	૦.૦૦	૪૮૭,૦૨૩.૩૯	૬૫૫.૦૦	૧૮,૦૮૧.૧૬	૧૮,૭૪૬.૧૬
વાહનો	૫૦૭,૫૩૫.૦૨	૧,૨૦૫,૩૦૦.૦૦	૦.૦૦	૧,૭૧૨,૮૨૫.૦૨	૪૮૨,૧૫૭.૮૦	૨૬૪,૩૪૭.૦૦	૦.૦૦	૭૪૬,૫૦૪.૮૦	૦.૦૦	૯૪૬,૪૨૦.૨૨	૨૫,૩૭૭.૨૨
ઓફિસ સામગ્રી	૧૧૪,૨૨૬.૦૦	૦.૦૦	૦.૦૦	૧૧૪,૨૨૬.૦૦	૮૦,૯૨૨.૨૨	૧૬,૮૮૮.૦૦	૦.૦૦	૯૭,૮૧૦.૨૨	૪,૦૪૭.૦૦	૫૬,૩૬૮.૭૮	૭૭,૩૦૩.૭૮
કોમ્પ્યુટર	૩૧૭,૦૦૩.૦૦	૦.૦૦	૦.૦૦	૩૧૭,૦૦૩.૦૦	૨૧૧,૩૭૪.૩૧	૫૮,૩૩૭.૦૦	૦.૦૦	૨૬૯,૭૧૧.૩૧	૦.૦૦	૪૭,૨૮૧.૬૯	૧૦૫,૬૨૮.૬૯
કુલ	૧,૪૮૮,૫૩૩.૫૭	૧,૨૦૫,૩૦૦.૦૦	૦.૦૦	૨,૭૦૩,૮૨૩.૫૭	૧,૨૭૧,૪૭૭.૭૨	૩૩૯,૫૭૨.૦૦	૦.૦૦	૧,૬૧૧,૦૪૮.૭૨	૪,૭૦૨.૦૦	૧,૦૮૮,૧૭૧.૮૫	૨૨૭,૦૫૫.૮૫
આગળનું વર્ષ	૨,૨૩૫,૦૮૫.૫૭	૨૬૩,૧૬૧.૦૦	૯૯૯,૭૨૩.૦૦	૧,૪૮૮,૫૩૩.૫૭	૨,૧૩૧,૨૧૫.૪૨	૧૧૯,૨૮૩.૦૦	૯૭૯,૦૨૦.૭૦	૧,૨૭૧,૪૭૭.૭૨	૪,૭૦૨.૦૦	૨૨૨,૩૫૩.૮૫	૧૦૩,૮૮૦.૧૫

ધંધાકીય જોડાણો કે અન્ય કોઈ વ્યવસ્થા હેતુ કંપનીની મિલકતો ભાડાપટ્ટે આપવામાં આવેલ નથી અને આવી રીતે ધારણ કરાયેલ નથી.

૩૧ માર્ચ ૨૦૧૬ થી અગાઉના પાંચ વર્ષ દરમિયાન મુડી ઘટાડા કે પુનઃમુલ્યાંકન હેતુ કંપનીની કોઈપણ મિલકત માંડી વાળવામાં આવેલ નથી.



સરવૈયાના ભાગરૂપે અનુસૂચિઓ (એકત્રિત)

રકમ રૂપિયામાં

	શેર્સની સંખ્યા		ચોપડે કિંમત રકમ રૂ.	
	૩૧-૩-૨૦૧૬ ના રોજ	૩૧-૩-૨૦૧૫ ના રોજ	૩૧-૩-૨૦૧૬ ના રોજ	૩૧-૩-૨૦૧૫ ના રોજ
૯. લાંબી મુદતના રોકાણો લાંબી મુદત - વેપાર રોકાણ (મૂળ કિંમતે) (જ્યાં ઉલ્લેખ કર્યો નથી ત્યાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત રૂ. ૧૦ છે)				
અ. બજાર યાદીમાં હોય તેવા ઈક્વિટી શેર્સ				
૧. ઈક્વિટી શેર્સ - સ્ટ્રેટેજીક રોકાણ				
ગુજરાત નર્મદાવેલી ફર્ટી. કું. લિ.	૩૩૨૨૭૫૪૬	૩૩૨૨૭૫૪૬	૫૭૨૧૦૫૬૦૮૨	૫૦૮૦૪૮૮૦૮૨
ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિ. (મૂળ કિંમત રૂ. ૨)	૧૫૦૭૯૯૮૦૫	૧૫૦૭૯૯૮૦૫	૧૮૩૮૪૮૫૦૪૧૧	૧૭૨૬૧૨૭૮૭૫૩
અન્ય રોકાણો				
ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિ.	૧૫૩૨૮૩૭૩	૧૫૩૨૮૩૭૩	૨૭૬૬૨૬૮૬૨૮	૨૩૭૨૬૨૬૫૧૭
ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કું. લિ.	૩૫૨૪૧૫	૩૭૫૦૦	૨૬૩૮૩૮૨૫	૧૧૮૦૬૨૫
ટોરેન્ટ પાવર લિ.	૪૬૮૭૧૬૨૧	૪૬૮૭૧૬૨૧	૧૭૮૮૫૮૨૬૦	૧૭૮૮૫૮૨૬૦
ગુજરાત લીઝ ફાઈનાન્સ લિ.	૧૩૨૮૧૨૫	૧૩૨૮૧૨૫	૭૧૪૮૨૨૦૮	૭૧૪૮૨૨૦૮
કુલ (૧)			૨૭૧૫૮૦૧૧૪૧૪	૨૪૮૭૫૮૪૫૪૪૫
૨. ઈક્વિટી શેર્સ - બિન સ્ટ્રેટેજીક રોકાણ				
દીગજામ લિ.	૧૨૩૪૭૪૪	૧૨૩૪૭૪૪	૧૮૮૦૨૬૮૬૮	૧૮૮૦૨૬૮૬૮
અતુલ પ્રોડક્ટ્સ લિ.	૧૩૦૫૮૪	૧૩૦૫૮૪	૧૪૦૮૬૧૨૮	૧૪૦૮૬૧૨૮
બાટલીબોય એન્ડ કંપની લિ. (દાર્શનિક કિંમત રૂ. ૫ દરેકની)	૩૮૮૮૫	૩૮૮૮૫	૧૦૨૫૮૭૬	૧૦૨૫૮૭૬
જી.એસ.એલ. (ઈન્ડીયા) લિ.	૧૫૭૧૪૦	૧૫૭૧૪૦	૧૫૭૧૪૦૦	૧૫૭૧૪૦૦
ગુજરાત રાજ્ય નાણાંકીય નિગમ	૮૩૫૬૦૦	૮૩૫૬૦૦	૧૮૭૧૨૦૦૦	૧૮૭૧૨૦૦૦
સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ લિ. (દાર્શનિક કિંમત રૂ. ૧ દરેકની)	૫૦૫૨૬૫	૫૦૫૨૬૫	૮૨૮૭૨૮૭	૮૨૮૭૨૮૭
બેંક ઓફ બરોડા (દાર્શનિક કિંમત રૂ. ૨ દરેકની)	૨૫૦૦૦૦	૨૫૦૦૦૦	૧૧૦૧૨૫૦૦	૧૧૦૧૨૫૦૦
કુલ (૨)			૨૪૩૭૩૨૧૬૦	૨૪૩૭૩૨૧૬૦
કુલ (૧ + ૨)			૨૭૪૦૨૭૪૩૫૭૫	૨૫૨૧૯૬૭૭૬૦૬



સરવૈયાના ભાગરૂપે અનુસૂચિઓ (એકત્રિત)

રકમ રૂપિયામાં

	શેર્સની સંખ્યા		ચોપડે કિંમત રકમ રૂ.	
	૩૧-૩-૨૦૧૬ ના રોજ	૩૧-૩-૨૦૧૫ ના રોજ	૩૧-૩-૨૦૧૬ ના રોજ	૩૧-૩-૨૦૧૫ ના રોજ
અનુસૂચિ ૯. (ચાલુ) રોકાણો				
(બ) બજારયાદીમાં ન હોય તેવા રોકાણો				
(૧) ઈકિવટી શેર્સ નોન - સ્ટ્રેટેજીક રોકાણો				
કામા હોટલ્સ લિ.	૫૩૪૦	૫૩૪૦	૭૨૭૦૦	૭૨૭૦૦
ગુજરાત સ્ટેટ મશીન ટુલ્સ કું. લી.	૧૮૨૮૦૫૦	૧૮૨૮૦૫૦	૨૦૦૦૦	૨૦૦૦૦
(દાર્શનિક કિંમત રૂ. ૧ દરેકની)	૧૨૦૦૦	૧૨૦૦૦	૧૦૦૦	૧૦૦૦
ગુજરાત સ્ટેટ ટ્રાન્સ રિસીવર્સ લી.				
કુલ (૧)			૮૩૭૦૦	૮૩૭૦૦
(૨) ઈકિવટી શેર્સ - સ્ટ્રેટેજીક રોકાણો				
ભાવનગર એનર્જી. કોર્પોરેશન લિ.	૧૪૩૫૮૩૮૦૦	૧૪૩૫૮૩૮૦૦	૧૪૩૫૮૩૮૦૦૦	૧૪૩૫૮૩૮૦૦૦
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પો. લી.	૧૮૨૫૮૨૪૪૧	૧૮૨૫૮૨૪૪૧	૧૫૫૮૮૮૮૭૭૨૬	૧૫૫૮૮૮૮૭૭૨૬
(દાર્શનિક કિંમત રૂ. ૧ દરેકની)			૧૭૦૩૫૮૨૬૭૨૬	૧૭૦૩૫૮૨૬૭૨૬
કુલ (૨)			૧૭૦૩૫૮૨૦૪૨૬	૧૭૦૩૫૮૨૦૪૨૬
કુલ (બ) (૧ + ૨)			૪૪૪૩૮૬૬૪૦૦૧	૪૨૨૫૫૫૮૦૩૨
કુલ (અ + બ)				
બાદ :				
રોકાણોની કિંમતમાં ઘટાડાની જોગવાઈ			૨૮૦૮૨૨૧૫૪	૨૮૦૮૨૨૧૫૪
રોકાણોની કુલ ચોપડે કિંમત			૪૪૧૫૭૭૪૧૮૪૭	૪૧૮૭૪૬૭૫૮૭૮
બજાર યાદીમાં હોય તેવા			૨૬૪૭૪૫૮૭૩૫૩	૨૫૬૧૩૪૬૪૧૦૧
રોકાણોની કુલ બજાર કિંમત				



સરવૈયાના ભાગરૂપે અનુસૂચિઓ (એકત્રિત)

રકમ રૂપિયામાં

	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૬ ના રોજ	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૫ ના રોજ
૧૦. વિલંબિત કર - મિલકતો હિસાબી ધોરણ - ૨૨ “એકાઉન્ટીંગ ફોર ટેક્સ ઓન ઈન્કમ” અનુસાર અને કંપનીઓના (હિસાબી ધોરણ) નિયમ ૨૦૦૬ ની સૂચના અનુસાર કંપનીએ વિલંબિત કર અંગેની જોગવાઈ શરૂ કરેલ છે. હિસાબી ધોરણોની જોગવાઈઓનું પાલન અને સામાન્ય ડહાપણના આધારે કંપનીએ ઉપર મુજબના વિલંબિત કર (મિલકત / વિલંબિત કર (દેવા) ની જોગવાઈ શરૂ કરેલ છે. વિલંબિત કર મિલકત - ઘસારો સંચિત ખર્ચ ચૂકવણી પર કપાતને પાત્ર ચોખ્ખો વિલંબિત કર મિલકત	 ૭૦૨૨૨ ૨૮૬૬૦૬ ૩૬૬૮૨૮	 ૨૮૮૮૪ ૭૮૮૮૮ ૧૦૮૭૮૩
૧૧. લાંબાગાળાની લોન અને પેશગીઓ (અ) એડવાન્સ આવકવેરો (ચાલુ વર્ષની ચોખ્ખી જોગવાઈ રૂ. ૭,૮૩,૭૫,૩૬૧/-) આગલા વર્ષના રૂ. ૧૨,૩૧,૪૬,૨૧૩/-) (બ) અન્ય લોન અને પેશગીઓ (ખ્રીજ લોન) શંકાસ્પદ બાદ : અન્ય શંકાસ્પદ લોન અને પેશગીની જોગવાઈ કુલ	 ૩૮૭૬૮૬૩૮.૦૦ ૨૫૦૦૦૦૦.૦૦ ૨૫૦૦૦૦૦.૦૦ ૩૮૭૬૮૬૩૮.૦૦	 ૮૮૫૩૪૩૦૬.૦૦ ૨૫૦૦૦૦૦.૦૦ ૨૫૦૦૦૦૦.૦૦ ૮૮૫૩૪૩૦૬.૦૦
૧૨. રોકડ અને બેંક સિલક (૧) હાથ પર રોકડ (૨) ચાલુખાતામાં બેંકમાં રોકડ : જીએસએફસી પાસે ડિપોઝીટ કુલ	 ૧૧૮૧૬.૦૦ ૫૫૦૪૦૬૧૮૮.૮૪ ૨૦૪૩૬૭૫.૦૦ ૫૫૨૪૬૧૬૮૦.૮૪	 ૭૦૦૩.૫૦ ૩૭૧૩૪૫.૪૪ ૪૫૪૩૬૭૫.૦૦ ૪૮૨૨૦૨૩.૮૪



સરવૈયાના ભાગરૂપે અનુસૂચિઓ (એકત્રિત)

રકમ રૂપિયામાં

	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૬ ના રોજ	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૫ ના રોજ
૧૩. ટૂંકાગાળાની લોન અને પેશગીઓ		
(અ) સિક્યોરીટી ડીપોઝીટ - સુરક્ષિત સારા ગણવામાં આવે તે	૧૨૬૩૨૧૫.૦૦	૪૦૦૦.૦૦
(બ) લોન અને પેશગી કર્મચારીઓને - સુરક્ષિત સારા ગણવામાં આવે તે		
(ક) અગાઉની ચૂકવેલ ખર્ચ - બીન તારણવાળા - સુરક્ષિત સારા ગણવામાં આવે તે	૨૮૫૭.૦૦	૨૮૮૪.૦૦
(ડ) સરકારી સત્તાધિકારીઓ પાસે સિલક / બેલેન્સ		
(૧) ફ્રીન્જ બેનેફીટ ટેક્સ - રીફંડ	૪૦૨૬.૦૦	૪૦૨૬.૦૦
(૨) આવક વેરા રીફંડ	૦.૦૦	૭૪૬૭૧૭.૦૦
(ઈ) ઈન્ટર-કોર્પોરેટ ડીપોઝીટ બીન તારણવાળા-સુરક્ષિત સારા ગણવામાં આવે તે ગુજરાત રાજ્ય નાણાંકિય સેવા લીમીટેડ	૨૮૬૧૮૨૩૩૮૪.૦૦	૨૧૩૨૩૮૦૨૩૨.૦૦
કુલ	૨૮૬૩૦૮૩૪૮૨.૦૦	૨૧૩૩૧૩૭૮૬૮.૦૦
૧૪. અન્ય ચાલુ અસ્કયામતો		
રોકાણ ઉપરનું જમા થયેલ વ્યાજ	૧૩૦૬૦૦૨૪૪.૦૦	૧૦૬૩૮૬૪૪૧.૦૦
કુલ	૧૩૦૬૦૦૨૪૪.૦૦	૧૦૬૩૮૬૪૪૧.૦૦
૧૫. સંચાલનમાંથી મળેલ આવકની વિગતો		
(અ) રોકાણોમાંથી આવક		
(૧) ડીવીડન્ડ	૨૮૪૭૪૮૩૧૮.૫૦	૨૬૦૮૩૪૫૮.૦૦
(૨) રોકાણો પર વ્યાજ	૨૨૨૫૬૭૬૪૨.૦૦	૩૫૫૮૫૬૩૭૧.૦૦
કુલ	૫૦૭૩૧૬૮૬૧.૫૦	૩૮૨૦૪૮૮૨૮.૦૦
૧૬. અન્ય આવક		
૧. લાંબા ગાળાના રોકાણોની આગળ ખેંચેલી રકમના હવાલા આગળ ખેંચેલી રકમના ઘટાડાને ઉલટાવવો.	૦.૦૦	૧૦૬૦૮૩૫.૫૮
૨. રોકાણોના વેચાણો ઉપર નફો	૦.૦૦	૨૩૮૭૧૭૭૩૫.૨૪
૩. અસ્કયામતોના વેચાણ ઉપર નફો	૦.૦૦	૪૮૭.૭૦
૪. CPF ટ્રસ્ટના બાકી ચૂકવણાના હવાલા	૧૦૬૦૬૬.૦૦	૦.૦૦
૫. ઈન્કમેટેક્સ રીફંડ ઉપરનું વ્યાજ	૧૦૮૮૪૮૩૪.૦૦	૦.૦૦
કુલ	૧૧૦૦૦૮૦૦.૦૦	૨૪૦૭૭૮૧૬૮.૫૨



સરવૈયાના ભાગરૂપે અનુસૂચિઓ (એકત્રિત)

રકમ રૂપિયામાં

	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૬ ના રોજ	(રકમ રૂ.) ૩૧-૩-૨૦૧૫ ના રોજ
૧૭. કર્મચારીઓના લાભાર્થે ખર્ચ		
(૧) પગાર	૨૭૯૧૦૫૪.૦૦	૨૭૧૮૨૮૫.૦૦
(૨) પ્રોવિડન્ટ ફંડ અને અન્ય ફંડમાં ફાળો	૪૪૮૩૦૮.૦૦	૪૫૮૦૦૭.૦૦
કુલ	૩૨૩૯૩૬૨.૦૦	૩૧૭૬૩૦૨.૦૦
૧૮. ફાઈનાન્સ ખર્ચ		
(૧) લોન ઉપરના વ્યાજનો ખર્ચ	૦.૦૦	૦.૦૦
(૨) આવકવેરા વિભાગને ચુકવેલ વ્યાજ ખર્ચ	૭૯૮૮૬.૦૦	૦.૦૦
કુલ	૭૯૮૮૬.૦૦	૦.૦૦
૧૯. અન્ય ખર્ચ		
પાવર અને બળતણ ખર્ચ	૧૧૦૦૮૪.૦૦	૭૩૪૨૫.૦૦
ઓફીસ ભાડુ	૨૨૮૭૭૫૬.૦૦	૪૭૮૫૦૦.૦૦
રીપેર્સ અને મેઈન્ટેનન્સ	૦.૦૦	૧૦૧૨૮.૦૦
વીમો	૫૧૬૪.૦૦	૫૪૫૬.૦૦
દર અને કરવેરા	૭૪૪૦૩.૦૦	૮૦૦૬૦.૦૦
માહિતી સંચાર ખર્ચ	૪૬૪૧૩.૦૦	૨૬૪૪૮.૦૦
પ્રવાસ અને વાહન ખર્ચ	૧૩૬૧૬૩.૦૦	૧૦૬૨૩૭.૦૦
પ્રિન્ટીંગ અને સ્ટેશનરી ખર્ચ	૮૨૧૭૫.૫૦	૬૮૩૪૫.૦૦
કાનૂની અને વ્યવસાયી ખર્ચ	૩૧૨૬૫૭.૦૦	૮૬૫૮૭.૦૦
ઓડીટરને ચુકવણી	૮૩૮૭૪.૦૦	૮૮૩૧૫.૦૦
સ્ટેમ્પ ડ્યુટી ખર્ચ	૧૪૫૬૦૦.૦૦	૦.૦૦
સર્વિસ ટેક્ષ (આરસીએમ)	૨૮૧૫૭.૦૦	૦.૦૦
પરચુરણ ખર્ચ	૮૨૮૦૫૦.૦૦	૧૫૨૫૪૨.૦૦
જાહેરાત ખર્ચ	૦.૦૦	૧૦૨૦.૦૦
અગાઉના સમયગાળાનો ખર્ચ	૦.૦૦	૦.૦૦
કોર્પોરેટ સામાજિક જવાબદારીઓનો ખર્ચ	૭૩૬૦૪૦૪.૦૦	૪૧૮૮૬૩૬.૦૦
રજીસ્ટ્રેશન ફી	૪૨૮૫૦.૦૦	૦.૦૦
કુલ	૧૧૫૬૪૭૫૦.૫૦	૫૩૯૭૬૮૮.૦૦



સરવૈયાના ભાગરૂપે અનુસૂચિઓ (એકત્રિત)

૨૦. આ માત્ર મૂડીરોકાણ કંપની હોવાથી, કંપની અધિનિયમ ૨૦૧૩ ના પરિશિષ્ટ ૩ ના પેરા નં. ૪(એ) અને (બી) ની જોગવાઈઓ લાગુ પડતી નથી.
૨૧. કંપની એક્ટ, ૨૦૧૩ મુજબ બાકી રહેલી અસ્ક્યામતોના ઉપયોગી વર્ષો ગણી ઘસારો ડબલ્યુ ડી. વી પ્રમાણે ગણવામાં આવેલ છે.
૨૨. સેગમેન્ટ રીપોર્ટીંગ :
કંપની એક જ બીઝનેસ સેગમેન્ટમાં કાર્યરત છે. તેથી એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ “એસ.એસ. ૧૭ સેગમેન્ટ રીપોર્ટીંગ” મુજબ અલગ ડિસ્ક્લોઝર કરવાનું રહેતું નથી.
૨૩. કંપની હિસાબી ધોરણો નિયમ, ૨૦૦૬ (કંપનીઝ એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ રૂલ્સ, ૨૦૦૬)ની જોગવાઈઓ પ્રમાણે હિસાબી ધોરણ “એસ ૧૮” હેઠળ સંબંધિત પાર્ટી સાથેના વ્યવહારોનું ડિસ્ક્લોઝર નીચે મુજબ છે.
(અ) કંપની રાજ્ય સરકાર દ્વારા નિયંત્રિત એકમ હોવાથી એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ એ.એસ. ૧૮ મુજબ અન્ય રાજ્ય દ્વારા નિયંત્રિત એકમ સાથે થયેલ વ્યવહાર જણાવવાની જરૂર રહેતી નથી.
(બ) કી મેનેજરીયલ પર્સોનલ (KMP) સાથે કંપનીએ વ્યવહારો કરેલ નથી.
૨૪. કર્મચારીઓના લાભો :
કર્મચારીઓના લાભો કંપની (એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ) નિયમ, ૨૦૦૬ મુજબ એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ ૧૫ “એમ્પ્લોઈઝ બેનિફિટ” ને લગતી માહિતી નીચે મુજબ છે.
(અ) વર્તમાન જવાબદારીઓના મૂલ્યમાં વધઘટ (૩૧મી માર્ચ ૨૦૧૬ ની સ્થિતિએ) (રકમ રૂપિયા)

વિગત	ગ્રેયુઈટી માર્ચ ૩૧, ૨૦૧૬	ગ્રેયુઈટી માર્ચ ૩૧, ૨૦૧૫	રજાનો પગાર માર્ચ ૩૧, ૨૦૧૬	રજાનો પગાર માર્ચ ૩૧, ૨૦૧૫
વર્ષની શરૂઆતમાં જવાબદારી	૪૯૧૦૪૪	૩,૪૮,૩૫૫	૨૬૭૧૮૭	૧૭૮૮૨૮
વર્તમાન સેવા પડતર	૪૬,૮૪૭	૨૨,૨૦૬	૨૨,૭૧૧	૨૦,૦૩૪
વ્યાજ ખર્ચ	૩૭,૭૩૭	૩૧,૧૮૭	૨૦,૪૭૮	૧૫,૮૨૧
એક્યુરલ (ગેઈન) લોસ ઓન ઓબ્લીગેશન્સ	(૨૭૦૪૪)	૮૮,૨૮૬	(૧૮૧૫)	૫૨,૪૦૪
ચુકવવાપાત્ર લાભ	૦	૦	૦	૦
વર્ષને અંતે જવાબદારીની હાલની કિંમત	૫૪૮,૫૮૪	૪,૮૧,૦૪૪	૩૦૮,૪૬૨	૨૬૭,૧૮૭

(બ) ગ્રેયુઈટી પ્લાન ફંડેડ નથી તેથી તેને લગતી અસ્ક્યામતોની વિગત આપવામાં આવેલ નથી.

(ક) સરવૈયામાં જોગવાઈ કરવામાં આવેલી રકમ.

(રકમ રૂપિયા)

વિગત	ગ્રેયુઈટી માર્ચ ૩૧, ૨૦૧૬	ગ્રેયુઈટી માર્ચ ૩૧, ૨૦૧૫	રજાનો પગાર માર્ચ ૩૧, ૨૦૧૬	રજાનો પગાર માર્ચ ૩૧, ૨૦૧૫
વર્ષને અંતેની જવાબદારીની હાલની કિંમત	૫૪૮,૫૮૪	૪,૮૧,૦૪૪	૩૦૮,૪૬૨	૨,૬૭,૧૮૭
વર્ષને અંતે પ્લાન અસ્ક્યામતોની ફેર કિંમત	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય
નવી અસ્ક્યામતો/(જવાબદારી) બેલેન્સશીટમાં દર્શાવ્યા મુજબ	૫૪૮,૫૮૪	૪૮૧,૦૪૪	૩૦૮,૪૬૨	૨,૬૭,૧૮૭



(ડ) નફા-નુકશાન ખાતામાં જોગવાઈ કરવામાં આવેલી રકમ :

(રકમ રૂપિયામાં)

વિગત	ગ્રેયુઈટી માર્ચ ૩૧, ૨૦૧૬	ગ્રેયુઈટી માર્ચ ૩૧, ૨૦૧૫	રજાનો પગાર માર્ચ ૩૧, ૨૦૧૬	રજાનો પગાર માર્ચ ૩૧, ૨૦૧૫
કરન્ટ સર્વિસ કોસ્ટ	૪૬,૮૪૭	૨૨,૨૦૬	૨૨,૭૧૧	૨૦,૦૩૪
વ્યાજ ખર્ચ	૩૭,૭૩૭	૩૧,૧૮૭	૨૦,૪૭૮	૧૫,૮૨૧
૨૦૧૫-૧૬ના વર્ષ દરમિયાન નેટ એક્યુઅલ (ગેઈન)/લોસ	(૨૭૦૪૪)	૮૮,૨૮૬	(૧૮૧૫)	૫૨,૪૦૪
નફા-નુકશાન ખાતામાં દર્શાવેલ ખર્ચ	૫૭,૫૪૦	૧૪૨,૬૮૮	૪૧,૨૭૫	૮૮,૨૫૯

(ઈ) માન્યતાઓ :

(રકમ રૂપિયામાં)

વિગત	ગ્રેયુઈટી માર્ચ ૩૧, ૨૦૧૬	ગ્રેયુઈટી માર્ચ ૩૧, ૨૦૧૫	રજાનો પગાર માર્ચ ૩૧, ૨૦૧૬	રજાનો પગાર માર્ચ ૩૧, ૨૦૧૫
મોર્ટાલીટી ટેબલ (એલ.આઈ.સી.)	૨૦૦૬-૦૮ (અંતિમ)	૧૯૯૪-૯૬ (અંતિમ)	૨૦૦૬-૦૮ (અંતિમ)	૧૯૯૪-૯૬ (અંતિમ)
ડિસ્કાઉન્ટ રેટ/વળતરનો દર	૭.૬%	૭.૮%	૭.૬%	૭.૮%
વળતરના લેવલમાં વધારાનો દર	૫.૦%	૫.૦%	૫.૦%	૫.૦%
પ્લાન અસ્કયામતો ઉપર વળતરનો દર	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી

૨૫. એક્યુરિયલ વેલ્યુમાં પગારની વૃદ્ધિમાં ગણતરી કરતી વખતે ફુગાવો, સિનિયોરીટી, પ્રશમોશન અને બીજાં પરિબળો જેવાં કે, એમ્પ્લોયમેન્ટ માર્કેટમાં ડિમાન્ડ-સપ્લાયની ગણતરી કરવામાં આવેલ છે. આ અંગેની માહિતી એક્યુરિએ પ્રમાણિત કરેલ છે.

એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ ૧૫ (રીવાઈઝ્ડ ૨૦૦૫) ની માર્ગદર્શિકા જે ઈન્સ્ટીટ્યુટ ઓફ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાએ નિર્દિષ્ટ કરેલ છે. તેમાં કંપની દ્વારા સ્થાપિત કર્મચારી ભવિષ્યનિધિ ફંડને નિયુક્ત લાભ તરીકે ગણવામાં આવે છે. કારણ કે કંપનીને વર્ષને અંતે લઘુત્તમ વળતર રજવાનું હોય છે. કોઈ પણ પ્રકારની ખાદ્ય (નુકશાન)ની જોગવાઈ ના કરી હોય તેવું બન્યું નથી. અને રૂ. ૪૦૬૮૮/- (ગત વર્ષે રૂ. ૬૮૦૮૫/- ખર્ચ તરીકે) કંપનીના પ્રોવિડન્ટ ફંડ હેઠળ “વધારાની રકમની જોગવાઈ” તરીકે નફા-નુકશાન ખાતામાં જમા કરેલ છે.

૨૬. રોકડ અને રોકડ સમકક્ષ :

રોકડ પ્રવાહ પત્રકના હેતુ માટે રોકડ સમકક્ષ એટલે બેંકમાં રહેલ રોકડ અને હાથ પરની રોકડ તેમજ જી.એસ.એસ.એસ.માં લિક્વીડ ડિપોઝીટનો સમાવેશ કરેલ છે.



૨૭. ઓડિટર્સનું મહેનતાણુ	(રકમ રૂપિયામાં)	
વિગત	૨૦૧૫-૧૬	૨૦૧૪-૧૫
(એ) ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઈઝર્સ લિમિટેડ	૮૬,૩૮,૭૭,૮૫૫	૮૬,૩૮,૭૭,૮૫૫
ઉમેરો : સહયોગી કંપનીઓ હસ્તગત કરવાથી થયેલી પાઘડી (શાખ)માં વધારો	૪૮,૮૨,૭૫,૩૨૦	૪૮,૮૨,૭૫,૩૨૦
ઉમેરો : એકત્રિત રિઝર્વ/નફાનો ફાળો	૩૭૩૭૩૪૪૮૦૭	૫૦૪૮૭૬૮૩૧૮
ઉમેરો : ચાલુ વર્ષનો નફો	૬૩૦૫૫૮૦૦૦	-૧૧૮૬૧૨૭૦૦૦
બાદ : ચાલુ વર્ષ દરમિયાન મળેલ ડિવિડન્ડ	૦	૧૧૬૨૮૬૪૧૧
રોકાણોનું એકત્રિત મુલ્ય	૫૭૨૧૦૫૬૦૮૨	૫૦૮૦૪૮૮૦૮૨
સહયોગી કંપનીઓના નફામાં ચાલુ વર્ષનો હિસ્સો જેમાં અપવાદરૂપે સમાવિષ્ટ વિગત રૂ. શૂન્ય	૨૬૮૮૨૨૭૬૧૨૧	—
(બી) ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમીકલ્સ લિમિટેડ	૩૩૫૦૨૦૬૫૧૩	૩૩૫૦૨૦૬૫૧૩
બાદ : સહયોગી કંપની હસ્તગત કરવાથી ઉદ્ભવેલ કેપીટલ રીઝર્વ	-૮૨૬૪૧૦૩૪૧	-૮૨૬૪૧૦૩૪૧
ઉમેરો : એકત્રિત અનામત (રીઝર્વ) નફાનો ફાળો	૧૪૭૩૭૪૮૨૫૮૧	૧૩૪૮૦૧૮૭૪૧૪
ઉમેરો : ચાલુ વર્ષનો નફો	૧૪૬૫૪૩૧૪૪૮	૧૫૪૮૮૮૪૮૭૭
બાદ ચાલુ વર્ષ દરમિયાન મળેલ ડિવિડન્ડ	૩૩૧૭૫૮૭૮૧	૭૦૧૫૮૮૮૧૦
રોકાણોનું એકત્રિત મુલ્ય	૧૮૩૮૪૮૫૦૪૧૧	૧૭૨૬૧૨૭૮૭૮૩
(સી) ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ લિમિટેડ	૩૭૮૧૪૮૪૧૪૪	૩૭૮૧૪૮૪૧૪૪
બાદ : સહયોગી કંપનીએ હસ્તગત કરવાથી ઉદ્ભવેલ કેપીટલ રીઝર્વ	-૨૦૫૮૩૪૧૬૩૮	-૨૦૫૮૩૪૧૬૩૮
ઉમેરો : એકત્રિત અનામત (રિઝર્વ/નફાનો ફાળો)	૬૩૮૪૭૪૦૧૧.૮	૨૨૫૨૫૩૭૩૬.૨
ઉમેરો : ચાલુ વર્ષનો નફો	૪૬૨૬૨૫૨૮૦	૪૭૫૫૩૭૭૬૭.૭
બાદ : ચાલુ વર્ષ દરમિયાન મળેલ ડિવિડન્ડ	૬૮૮૮૨૧૭૮	૬૧૩૧૭૪૮૨
રોકાણોનું એકત્રિત મુલ્ય	૨૭૬૬૨૬૮૬૨૮	૨૩૭૨૬૨૬૫૧૭

અધિનિયમના પરિશિષ્ટ-૩ અંતર્ગત સામાન્ય સૂચનાઓ પેરા (૨) હેઠળ તૈયાર કરવાપાત્ર સંયુક્ત નાણાકીય પત્રકોની વધારાની માહિતી

૨૮

જાહેર સાહસનું નામ	ચોખ્ખી અસ્કયામતો = કુલ અસ્કયામતો બાદ કુલ જવાબદારીઓ (નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬)		નફા અથવા નુકશાનમાં હિસ્સો (નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬)		ચોખ્ખી અસ્કયામતો = કુલ અસ્કયામતો બાદ કુલ જવાબદારીઓ (નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫)		નફા અથવા નુકશાનમાં હિસ્સો (નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫)	
માતૃ સંસ્થા	કુલ એકત્રિત અસ્કયામતોના ટકા	રૂપિયા	કુલ એકત્રિત નફાના ટકા	રૂપિયા	કુલ એકત્રિત અસ્કયામતોના ટકા	રૂપિયા	કુલ એકત્રિત નફાના ટકા	રૂપિયા
ગુજરાત રાજ્ય મૂડીરોકાણ લિ.	૩૧.૧૫	૧૨,૧૬૨,૩૨૩,૮૧૬	૧૪.૩૪	૪૨૮,૨૭૮,૮૬૭	૩૧.૪૩	૧૧૩૩,૩૩,૦૨,૮૭૮	૩૭.૨	૪૮,૦૭,૩૪,૭૮૨
સહયોગીઓ								
ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઈઝર્સ લિમિટેડ	૧૪.૬૫	૫,૭૨,૧૦,૫૬,૦૮૨	૨૧.૧૧	૬૩,૦૫,૫૮,૦૦૦	૪૪.૧૨	૫૦૮,૦૪,૮૮,૦૮૨	(૮૦.૬૮)	(૧૯,૬૧,૨૭,૦૦૦)
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમીકલ્સ કંપની લિમિટેડ (એફવી.ડી. ૨/-)	૪૭.૧૧	૧૮,૩૮,૪૮,૫૦,૪૧૧	૪૮.૦૬	૧,૪૬,૫૪,૩૧,૪૪૮	૪૭.૮૭	૧૭૨૬,૧૨,૭૮,૭૫૩	૧૧૭.૪૨	૧૫૪,૮૮,૮૪,૮૭૭
ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ લિમિટેડ	૭.૦૮	૨,૭૬,૬૨,૬૮,૬૨૮	૧૫.૪૮	૪૬,૨૬,૨૫,૨૮૦	૬.૫૮	૨૩૭,૨૬,૨૬,૫૧૭	૩૬.૦૫	૪૭,૫૫,૩૭,૭૬૭
કુલ	૧૦૦.૦૦	૩૮,૦૪,૪૫,૮૮,૮૩૬	૧૦૦.૦૦	૨,૮૮,૬૮,૮૩,૬૦૬	૧૦૦.૦૦	૩૬૦૫,૭૭,૦૬,૩૩૧	૧૦૦.૦૦	૧૩૧,૮૦,૩૦,૫૨૭



૨૯ (ઓડીટર્સનું મહેનતાણું)	(રકમ રૂપિયામાં)	
વિગત	૨૦૧૫-૧૬	૨૦૧૪-૧૫
કાયદાકીય ઓડીટ પેટે	૧૭૪૨૧.૦૦	૧૬૮૫૪.૦૦
ટેક્ષ ઓડીટ પેટે	૧૪૫૧૮.૦૦	૧૪૦૪૫.૦૦
આંતરિક ઓડીટ પેટે	૨૮૬૨૫.૦૦	૨૮૦૮૦.૦૦
ઈ.પી.એફ. ઓડીટ પેટે	૨૮૬૩.૦૦	૧૧૨૩૬.૦૦
સકેટીયલ ઓડીટ ફી	૨૩૩૧૦.૦૦	૨૮૦૮૦.૦૦

૩૦. શેર ઉપરની આવક	૨૦૧૫-૧૬	૨૦૧૪-૧૫
આપેલા સમયગાળાનો નફો/ખોટ	૨૮૮૬૮૮૩૬૦૬	૧૩૧૮૦૩૦૫૨૭
વેઈટેડ એવરેજ મુજબ શેરની સંખ્યા (ફેસ વેલ્યુ રૂા. ૧૦ પ્રતિ શેર)		
શેર ઉપરની આવક (મૂળ/ધટોડેલ)	૧૦૪૨૭૬૮૦૭૦	૧૦૪૨૭૬૮૦૭૦
(મૂળકિંમત રૂા. ૧૦ પ્રતિશેર)	૨.૮૬	૧.૨૬

૩૧. કન્ટીજન્ટ જવાબદારી :

આકારણી વર્ષ ૨૦૦૧-૦૨, ૨૦૦૪-૦૫, ૨૦૦૬-૦૭, ૨૦૧૦-૨૦૧૧, ૨૦૧૧-૧૨, ૨૦૧૨-૧૩, ૨૦૧૩-૧૪ ના આવક વેરાની ચૂકવણી વિવાદસ્પદ હોવાથી દેવા ખાતે ઉધારેલ નથી. કંપની અપીલમાં ગયેલ છે અને આજની તારીખે કંપનીનાં નાણાકિય પત્રકોમાં કંપની સામે કોઈ રકમની ડિમાન્ડ બાકી નથી.

૩૨. અગાઉના નાણાકિય વર્ષની રકમો ચાલુ વર્ષના ક્લાસીફિકેશન/ડિસ્ક્લોઝરની જરૂરિયાત મુજબ રીસ્ટ્રુપ/રીકાસ્ટ/રીક્લાસીફાય અને રીએરેન્જ કરવામાં આવી છે.

૩૩. ભાવનગર એનર્જી કંપની લિમિટેડ (BECL)ના પ્રમોટર તરીકે કંપનીએ સ્પોન્સર્સ સર્પોર્ટ એગ્રીમેન્ટ (SSA) કરેલ છે અને આ એગ્રીમેન્ટ (કરાર) હેઠળ, પ્રમોટરો (પ્રોત્સાહકો) લેવડ-દેવડની અંતિમ તારીખ સુધી (એ તારીખ કે જ્યારે એગ્રીમેન્ટ હેઠળનું બધું ઋણ બિનશરતો અને રદબાતલ ન થઈ શકે તે રીતે લેણદારોના સંપૂર્ણ સંતોષ સાથે ચૂકવાઈ જાય) સંયુક્તપણે તેમનું શેર હોલ્ડીંગ વેચી શકશે નહીં કે જેને લીધે તેમનું શેર હોલ્ડીંગ ઘટીને ૫૧%ની નીચે પરિણમે.

સાથે બીડેલ અહેવાલ મુજબ
જે. પી. શાહ એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વતી,
રજીસ્ટ્રેશન નંબર : ૧૦૮૬૧૨W
(સી.એ. નિરવ જે. શાહ)
પાર્ટનર
સભ્ય નંબર : ૧૦૭૭૧૭
સ્થળ : અમદાવાદ
તારીખ : ૨૮-૧૦-૨૦૧૬

નિયામક મંડળ અને તેમના વતી
ગુજરાત સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ લીમિટેડ

વહીવટી સંચાલક | સંચાલક | કંપની સચિવ | મુખ્ય નાણાકિય અધિકારી

સ્થળ : ગાંધીનગર
તારીખ : ૨૮-૧૦-૨૦૧૬